

ફોર્મ નં. ૨

(નાઈ ધોજનાના દુલાખભાઈ જતા અટ ગામની અસ્થાય)

અહેવાત વિભાગ

જશ્વરંતસિંહ ના. ૨૧૮૮

સરકાર

ડાકોરલાઈ લાઈ નાયક

આદિવાસી સૈંચાંબન અને તાલીમ કેદ
ગુજરાત વિધીયોઠ, અમદાવાદ ૩૮૦ ૦૧૪

૧૮૭

૧૮૮

અ તુક ન હિં કા

પ્રકરણ

વિષય

પાઠ નંબર

પ્રકરણ-૧

પસ્તાવના

પ્રકરણ-૨

ઓચિક જવન

પ્રકરણ-૩

આ શિક જવન

પ્રકરણ-૪

સામા જિક્કા મિક જવન

પ્રકરણ-૫

હૂળાણુમાં જતાં કુદુંઘોના
ખાલો

પ્રકરણ-૬

તારણો અને સૂચનો

સંદર્ભ રાચિત્ય

કોઠે સૂચિ

૧. વયજૂથ દર્શાવતો કોઠે
૨. મકાનનો પ્રકાર દર્શાવતો કોઠે (પ્રકાર,
અરેડાની સંખ્યા, દીવાલનો મકાર)
૩. મકાન પોતાની માલિકી જમીન દર્શાવતો કોઠે
૪. છાપરાનો મકાર દર્શાવતો કોઠે
૫. ઘરબધરીજાનાં સાધન દર્શાવતો કોઠે-૧
૬. ઘરબધરીનાં સાધન દર્શાવતો કોઠે-૧૫
૭. ઐતીનાં સાધન દર્શાવતો કોઠે
૮. આર્થિક દરજમો દર્શાવતો કોઠે
૯. વ્યવરાય દર્શાવતો કોઠે
૧૦. જમીન ઘરાબળાં કુટુંબો દર્શાવતો કોઠે
૧૧. જમીનનું પ્રમાણ દર્શાવતો કોઠે
૧૨. અન્ય જમીન ખેડાણ અંગેની માહિતી દર્શાવતો કોઠે
૧૩. પશુઓની સંખ્યા દર્શાવતો કોઠે
૧૪. પશુ માટેની છાપરી દર્શાવતો કોઠે
૧૫. કાડની સંખ્યા દર્શાવતો કોઠે
૧૬. શૌખયી આવક દર્શાવતો કોઠે
૧૭. કુટુંબદીઠ આવક દર્શાવતો કોઠે
૧૮. ઐતી અને પશુપાલનમાંથી થતું વાર્ષિક ઉત્પાદન
દર્શાવતો કોઠે (૩પિયામાં)
૧૯. પાઠ્વાર ઐતીમાંથી ઉત્પાદન દર્શાવતો કોઠે
(૩પિયા કિંમતમાં)
૨૦. ઐતી પશુપાલન ખર્ચ દર્શાવતો કોઠે(૩પિયામાં)
૨૧. કુલ ઉત્પાદન ખર્ચ દર્શાવતો કોઠે

૪૦૬ શૂણી

૧. વચ્છૂથ દર્શાવતો કોઠો
૨. મકાનનો પ્રકાર દર્શાવતો કોઠો (પ્રકાર,
ઓરડાની સંખ્યા, દૈવાલનો મકાર)
૩. મકાન પોતાની માલિકી જીવિન દર્શાવતો કોઠો
૪. છાપરાનો પ્રકાર દર્શાવતો કોઠો
૫. ઘરબઘરીજીઝાનનું સાધન દર્શાવતો કોઠો-૧
૬. ઘરબઘરીનાં સાધન દર્શાવતો કોઠો-૧૨
૭. ઐતીનાં સાધન દર્શાવતો કોઠો
૮. એર્બિક દરજમો દર્શાવતો કોઠો
૯. વ્યવસાય દર્શાવતો કોઠો
૧૦. જીવિન ઘરબલાં કુટુંબો દર્શાવતો કોઠો
૧૧. જીવિનું પ્રમાણ દર્શાવતો કોઠો
૧૨. અન્ય જીવિન ઐડાણ અંગેની માટેણી દર્શાવતો કોઠો
૧૩. પશુઓની સંખ્યા દર્શાવતો કોઠો
૧૪. પશુ માટેની છાપરી દર્શાવતો કોઠો
૧૫. ઝાડની સંખ્યા દર્શાવતો કોઠો
૧૬. ચોખાણી આવક દર્શાવતો કોઠો
૧૭. કુટુંબદીઠ આવક દર્શાવતો કોઠો
૧૮. ઐતી અને પશુપાલનમાંથી થતું વાર્ષિક ઉત્પાદન
દર્શાવતો કોઠો (૩ પિથામાં)
૧૯. પાકબાર ઐતીમાંથી ઉત્પાદન દર્શાવતો કોઠો (૩ પિથા)
(કિંમતમાં)
૨૦. ઐતી પશુપાલન ખર્ચ દર્શાવતો કોઠો (૩ પિથામાં)
૨૧. કુલ ઉત્પાદન ખર્ચ દર્શાવતો કોઠો

૨૨. ધરબપરાણી ખર્ચ દર્શાવતો કોઠો (ઇપિયામાં)
૨૩. કુટુંબદીઠ ખર્ચ દર્શાવતો કોઠો (ઇપિયામાં)
૨૪. દેલું દર્શાવતો કોઠો
૨૫. દેવાનો પ્રકાર અને દેલું દર્શાવતો કોઠો
૨૬. સ્થાવર-જંગમ મિલકત દર્શાવતો કોઠો
૨૭. કુટુંબદીઠ મિલકત દર્શાવતો કોઠો
૨૮. ગોદ્રેખાર કુટુંબની રંધ્યા દર્શાવતો કોઠો
૨૯. સરસ્ય રંધ્યા પ્રમાણે કુટુંબનું કદ દર્શાવતો કોઠો
૩૦. લગ્ન સમયની ઉભર દર્શાવતો કોઠો
૩૧. વૈવાહિક દરજાઓ દર્શાવતો કોઠો
૩૨. લગ્ન સ્થળનું અંતર દર્શાવતો કોઠો
૩૩. શિક્ષણનું સ્તર દર્શાવતો કોઠો
૩૪. ચાલુ શિક્ષણ દર્શાવતો કોઠો

પ્રાસ્તાવિક, વિસ્તાર-વસ્તિ

પ્રાસ્તાવિક

ગુજરાતમાં ખેદ નિયાતના નવાગામ આગામી ૪૦૪૨
કરોડના ખર્ચે આકાર લઈ રહેલી નર્મદા યોજના એ કરોડો
બોડો માટે આ ચિહ્નિદિશ્ય છે. ગુજરાતનું ખોટામાં મોટું
સાંજસ છે. નર્મદા યોજના સંપૂર્ણ તૈયાર થતાં ગુજરાત,
મહારાષ્ટ્ર, મધ્યપ્રેદેશ અને રાજસ્થાન જેવા યારે યારે
રાજ્યોને નર્મદાના અમૃતસમાં પાણીનો લાભ મળશે. હરિ-
ભાઈ ઘરની જોવા મળશે અને જ્યાં કુદરતે પાણીનો પુરવણો
આખ્યો નથી કેવા રણ જેવા વિસ્તારોમાં પાણી પહોંચતું
કરી શકાશે કેવી આ એક અખતન યોજના નવાગામ આગામી
આકાર લઈ રહેલ છે કે જનસમુદ્દરાય માટે આર્થિક વાદ અને
સરકાર માટે ગૌરવસમી આ યોજનાનું કામ આજે પૂર્જરાયે
યાણી રહ્યું છે.

"પણ"ને પોણતું લે મારવું"એ ક્ષમ દિસે ને "કુદરતી" લે
કહેવાના આધારે વખોંથી ન હીના ડિનારે વસવાટ
કરતા હતા કેમની જીવનદિવી નર્મદા હવી, નેઓ સમાજથી
અને પણ દરેક પ્રકારે પણાત છે કેમની સ્થિતિ આપણું
દૂદિયે ધાર્યું નથાયી છે કેવો કર્ણ ને નદી ડિનારે વખોંથી
વસવાટ કરતો આખ્યો છે કેમને આને બીજે જવાનું થાય છે
કેમને આને પોતાના વતનનો સોંગ આપી બીજે વતન ખના-
વવાનું છે. સરકાર કેમને શક્ય એટલી પદ્ધા જ પ્રકારની મદદ
આપવા તૈયાર થાય છે કોણો પણ કેમના મનમાં કોઈ પણ
પ્રકારનું દુઃખ તો રહી જેણે ખરું ? કેમને જરું ગમે છે ખરું ?
કેમને જી જ જથું અનુકૂળ આવશે ખરું ? ખાવા અનેક
પ્રકારના પ્રસનો આપણા મગજમાં આખ્યા કરે છે કેને જાણ-
વાની ઉદ્દેશ્યા થયા કરે છે. વળી આ યોજના તૈયાર થઈ
રહી છે ત્યાં મોટાખાગનો વસવાટ આ દિવારીનો છે. કે

પોતે કંઈ જાણું નથી. પોતાની પાસે બેચી કોઈ શક્તિ નથી કે ને અવાજ કરી પોતાના હક્કો મેળવી શકે. તો તે કેવા પ્રકારના પ્રત્યાધાતો પાડતો હોય છે? કે કોને પૂછતો હોયે? તેના મનમાં કેવા વિચારો આવતા હોયે? તે જાણવાની દરેકને અસરાં ઘણ્ય કે સ્વાસ્થાવિક છે.

જ્યારે અમે તો આદિવાસી સંશોધન વાલીમં કેન્દ્રમાં કરવા હોવાથી સ્વાસ્થાવિક છે કે તેવા વિચારો આવા શિવાય રહીએ નહીં. કેન્દ્રના નિયામક શ્રી ટાકોરીભાઈ નાથકે કે અગેનું માર્ગદર્શિન આપી નર્મિં થોજનામાં દૂષાણમાં જતાં આદિવાસી વિસ્તારનાં બે ગામોની અભ્યાસ કરવો તેવો નિર્દેશ મને કરવામાં આવ્યો કે મેં સહ્ય રહી-કર્ણી લિધો અને વડોદરા જિલ્લાના છોટાઉદેપુર વાલુકાનાં પ્રણ ગામાં દૂષાણમાં જાય છે તેમાંથી હંદુ (હંદેધર) ગામને પસંદ કરી કે ગામનો સ્થળાંતર પહેલાં અભ્યાસ કરવાનું નક્કી કર્યું. ગામો અંગેની માહિતી કેવળીથા કોલોનીથી મેળવી. વડોદરા જિલ્લાનાં કુલ ૮ ગામો નર્મિં થોજનામાં દૂષાણમાં જાય છે કેમાં નસવાડી વાલુકાનાં ૫ંચ ૧. ધુમાણા, ૨. અંગ્રાસ, ૩. ઊરાયારા, ૪. હેરકડા (ખરાઢા), ૫. કડા (ગીરફેડા). જ્યારે છોટાઉદેપુર વાલુકાનાં પ્રણ ગામો વરફેડા, હંસ (હંદેશર), પંદરીથા દૂષાણમાં જતાં આઠ અજાં ગામોમાંથી છોટાઉદેપુર વાલુકાનાં હંદેશગામનાં કુટુંબો સૈથી બધું છે નેની કુટુંબસંખ્યા ૨૪૨ની છે (૧૯૮૧ની વરૂતિ પ્રમાણે). કેથી હંદુ ગામને અંગે પસંદ કરી કેનો અભ્યાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું.

આધિક, સામાન્યિક અને સાંસ્કૃતિક માહિતી બેકર કરવા માટે અનેક જુદી જુદી પ્રવિધિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોણકાયે દરમાન માહિતી બેકર કરવા માટે મુલાકાત સહભાગી નિરીક્ષણનો ઉપયોગ કર્યો હતો.

ગામના આગેવાન ખેડૂતો, ગામના જરૂરી શ્રી મોહનદાસ મહારાજા, લાટી-કમ-ગંગી શ્રી પરમાર, સરકારી અને પિનસરકારી વ્યક્તિગતો લયા થોજાા ડીલીગનના

લાંબા વિસ્તાર :

હાંદુ ગામ છોટાઉદેપુરથી ૪૫ કિલોમીટર દૂર આવેલું છે. ગામમાં હાંદુશર મહાદેવનું મંદિર આવેલું હોવાથી ગામને હાંદુશરના નામથી બોળખવામાં આવે છે. ગામમાં જવા માટે છોટાઉદેપુરથી ૨૭ કિલોમીટર દસ્તિષ્ઠે કવાઈ આવેલું પડે છે. ત્યાંથી ૧૨ કિલોમીટર દૂરમાં કડીપાણી આસ્ટેઝુ આવેલું પડે છે. કડીપાણી જી.એમ.ડી.સી.નું મોટું કારણનું ચાલે છે તેના કારણે એ ટાઇમ વસ સુલિદા પણ ઉપયોગ છે. ત્યારથાં દસ્તિષ્ઠે ૭ કિલોમીટર દૂર પર્વતની હારમાળાઓ વચ્ચે નર્મદા કિનારાના કુંગરોમાં હાંદુશર ગામ આવેલું છે. હાંદુશર ગામ જુદાં જુદાં ૧૨ હજાથામાં બઢેયાવેલું છે. કુંગરોની ઉપર અને ઊંચાણાળા ભાગમાં દરેક હજાથું આવેલું છે. દરેક હજાથા વચ્ચે ૨ થી ૬ કિલોમીટર ચુધીનું અંતર છે. આમ છતાં ગામમાં એ સંસ્કારોનો ચાલે છે તે છે હાંદુશર મહાદેવનું મંદિર અને પણત વર્ગ નોઈ વડોદરા સંચાલિત આક્રમશાળા, ગામમાં પ્રલેશાતાં પહેલાં ૫૧૬૨- હજાથું આવે છે. ત્યારથાં આક્રમહજાથું અને લીંબડી હજાથું આક્રમ હજાથું અને લીંબડી હજાથા કુંગર ઉપરની રૂપાટ જમીન ઉપર આવેલા છે. ત્યારથાં મંદિર હજાથું ને નર્મદા નદીને કિનારે આવેલું છે. દરેક હજાથામાં જવા માટે કોતરો ઉત્તરવાનથઠવા પડે છે. મંદિર હજાથું મેન નદી કિનારે હોવાથી લેમ જ હાંદુશર મહાત્વનું મંદિર હોવાથી બીજા હજાથા કરતાં જમીનો અને ઘરો લેમ જ રહેણી- કરણીમાં કંઈક અંગે જાંદું છે. ખેતીવાડીમાં અણુ પણ ૨૧૩૮- થણ્ણીક ખાતરો લેમ જ છાણીયા ખાતરનો બિનિલગત ઉપયોગ કરે છે. જી.એમ.ડી.સી.નો પાણી પુરવઠો નર્મદા નદીમણી જતો હોવાથી મંદિરની બાજુમાં પંપતું મકાન, પાઠ્યકાલિન, રિષાઈનરી મકાન, વગેરે છે. જી.એમ.ડી.સી. ના કારણે મંદિરમાં પણ લાઈટ અને પાણીની સરબરા ઉપયોગ છે. બીજા કોઈ પણ હજાથામાં લાઈટ કે પાણીની વ્યવસ્થા નથી. આક્રમશાળામાં પણ લાઈટ પાણીની વ્યવસ્થા અન્યોધ્યાનાજીજી જી.એમ.ડી.સી.ના કારણે મૌલ છે.

ગામલોકો હુંગરમાંથી નીકળતા અરણાના પાણીનો કે
(બીરડા) ખાડા ખોડી પાણી મેળવે છે. હુંગર ઉપર ને
કુદુંબો રહે છે તેમને પાણી વેવા માટે હુંગર ઉલરી અને
ચઢવું પડે છે. આ સ્થર્થની વાત એ છે કે આશ્રમશાળામાં
પાણીના નંનાની સગવડો પણ ફરજિયાના લોકો નીચે
ગરણાનું પાણી લાવી ઉપયોગ કરે છે. પણ આશ્રમના
નણના પાણીનો ઉપયોગ કરતા નથી.

ગામની પૂર્વ મધ્યમદેશ અને દક્ષિણ ભાગારા જદી
સરણે લાગી જાય છે. આમ સંપૂર્ણ બોર્ડર ઉપરનું આ ગામ
હુંગરોની વચ્ચે નર્માં નર્માં કિનારે આવેલું છે.

ਲਖ ਮਾਤ੍ਰ ੬੩੫ ਪੰਜਾਬੀ ੫੧੬

ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਮਿਸ਼ਨ
ਅਤੇ ਸਾਹਮਣੇ ਵਾਲੀ ਪਾਇਪਲਾਈਨ
ਦੀ ਵਰਤੋਂ ਵਿਖੇ ਆਪਣੀ ਵਰਤੋਂ
ਵਿਖੇ ਵਿਖੇ ਵਿਖੇ ਵਿਖੇ ਵਿਖੇ

१९६५।—	४०	३४	४६	३८	३९	४५	४१	२७	२५	३२	२५	—	२	१७६	१८८	३८३
--------	----	----	----	----	----	----	----	----	----	----	----	---	---	-----	-----	-----

१२०.३ रु०.३ २१.६ १८.५ २५.५ ४५.७ १५.८ १८.८ १०.८ १६.८ १२८ ३२२

	34	20	26	104	96	96	61	42	46	2	4	392	353	624	954
32.9	32.0	20.4	23.0	2	21.0	21.8	15.3	19.2	16.2	20.2	6.2	4.0	2.5	100.00	100.00

卷之三

ઉપરોક્ત કોઠો જોતાં સ્વએ થાય છે કે અની-

પુરુષનું મમાણ જોતાં પુરુષોની સંખ્યા થોડી વધુ છે. ૩૭૨ પુરુષો અને ૩૬૩ સ્ત્રીઓ છે. ૯૦. કુદુંખોની સંખ્યાંની હુદા ૭૩૫ નિષે. એટલે કે કુદુંખદી રહેરણ સંખ્યા ૮ છે. વધુમાં વધુ સંખ્યાંની ધરાવણું જૂથ ૧ થી ૬ વર્ષનાં બાળકોનું છે. એટલે કે ૧ થી ૬ વર્ષનાં બાળકો કુલ પુરુષ સંખ્યાના ૨૬.૦ ટકા અથડે સ્ત્રી સંખ્યાના ૨૮.૬ ટકા જોવા મળી હતી. તે જ રીતે ૭ થી ૧૪ વર્ષનાં બાળકો કુલ પુરુષના ૨૦.૬ ટકા અને સ્ત્રી સંખ્યાના ૨૧.૪ ટકા હતું. તે જ રીતે ૧૫ થી ૨૪ વર્ષનાં ચુવાનોનું મમાણ પણ કુલ પુરુષ સંખ્યાના ૨૧.૮ ટકા અને સ્ત્રી સંખ્યાના ૨૦.૧ ટકા હતી. કે મજૂરી કરી શકે લેવાં વર્ગ સારા પ્રમાણમાં કહી શકાય. તે જ રીતે ૨૫ થી ૩૫ વર્ષનાં વધ્યજીવમાં અનુક્રમે ૧૬.૮ ટકા અને ૧૬.૬ ટકાનું એ મમાણ છે. તે પછી ૩૬ થી ૬૦ વર્ષનાં વધ્યજીવમાં અનુક્રમે ૧૩.૬ ટકા અને ૧૧.૩ ટકા સંખ્ય હતા. ૬૦થી ઉપરના વધ્યજીવમાં અનુક્રમે ૦.૬ ટકા અને ૧.૪ ટકા હતું. આ રીતે સમગ્ર વધ્યજીવ જોતાં લાગે છે કે ૧ થી ૬ વર્ષનાં અને ૭ થી ૧૪ વર્ષનાં બાળકોનું મમાણ વધુ છે. જ્યારે કમાણી કરી શકે લેવા લગ્નું મમાણ ૧૫ થી ૨૪ વર્ષનાં સંખ્યાનોનું મમાણ કુલ સંખ્યાંમાં અછું કહી શકાય.

ભૌતિક જગત

ધર :

ધર દુંગરી પર ઉચ્ચાણવાળી જગત એ બાંધે છે. મોટા-સાગે ઐતરમાં કે ઐતરની નજીક ધર બાંધવાનું પર્સેંડ કરે છે. ઐતરની ઉચ્ચાણવાળી જગત એ ધર બાંધવાનું વધારે પર્સેંડ કરે છે. એકખીજાથી દૂર બાંધે છે. સાથોસાથ એ ધર હોવાનથી પણ એ સાઇઅં એક ધરના એ સાગ કરી અલગ રહેણું હોય તો રહી શકે છે. પણ તે નવું ધર ન બનાવે ત્યાં સુધી. બાકી અલગ ધર બાંધે છે. ધર એક જાતિના સાથે હોય છે. એટલે કે મોટાસાગે ફળિયામાં એક જ જાતિનો વસવાટ હોય છે. ધર એકખીજાથી ધણાં દૂર હોય છે. એક ફળિયામાં એ જાતિના ધરો હોય છે. એક ગોત્રના સંબંધીઓ જુદા જુદા ફળિયામાં વસે છે. આ ઉપરાંત એક લોહીના સંબંધીઓ બીજા ફળિયામાં વસવાટ કરતા નથી પણ બીજા ફળિયામાં લેમનું ઐતર હોય તો ત્યાં ધર બનાવી રહે છે.

ધર બાંધતી વખતે ખાસ ધાર્મિક વિધિ કરવામાં આવતી નથી પણ ધર બાંધવા માટે ફળિયાના માણસોને બોલાલવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિત્વનું ધર બંધાનું હોય તો ફળિયાવાળા રેની મહે જાય છે. ધર બાંધવાની શરાબાતમાં મરદું મારવામાં આવે છે. આ ઉપરાંત રેની બાધ્રી સ્થિતિ રારી હોય કે બકરો મારે છે. રાષ્ટ્રી બનાવે છે અને ધર બાંધવા આવેલ માણસોને ત્યાં ખવડાવે છે. ધર બાંધવા આવનારને એ ટાઇમ ખવરાલવામાં આવે છે. ધર હૈયાર થઈ ગયા પણ પણ મરદું મારી વિધિ કરવામાં આવે છે.

ધર બાંધવામાં વપરાતો માત્ર-શામાન સ્થાનિક જંગલ-માંથી મેળવી લેવામાં આવે છે. મોટાસાગના જંગલમાંથી પરવાનગી વિના પણ કાપીને ઉપયોગ કરે છે. કેટલાક

પરવાનો મેળવીને વાપરે છે. લાકડું અને વાંસ જંગલમાંથી વાત્તી ઉપયોગ કરે છે. દેશી નળિયાં જાતે બનાવી કે છે. અથવા જાતિલભાઈ પાસેથી કેચાતાં મેળવી કે છે.

ધર જને બાજુ છાળવાળા ઘનાલે છે. ધરની થંડર એકવાજુ વાંસની દિવાલ બનાવી રસોડાનો ભાગ બનાવવામાં આવે છે. રસોડાની દીવાલને લીધી તેના ઉપર ખડીથી અટકજીક ચિત્રો કે લાઈનિંગ દોરવામાં આવે છે. આ ગામના રઠવા કોણી લોકો પીઠારો દોરવલા હોથ લેવી માછિયી કે ચિત્ર જોવા મળ્યું નથી. બાકીનો ભાગ ખુલ્લો રહ્યે છે. ધરની બાજુબાજુ વાંસને બીરી કેની દીવાલ બનાવે છે. ધરનો મસ્થલાગ ઉથો હોથ છે. તેની જને બાજુ છાળમાં જણે લાકડાના દોળિયા નાણી ઢાળ બનાવે છે. તેના ઉપર લાણીઓ નાયે છે. ઉપર વાંસની ખાપથી ચારે છે. તેના ઉપર દેશી નળિયાં ઢકે છે. વશ્યેના ભાગમાં એક લાકડાનો પાટડો નાણી મેડો બનાવે છે. તેને આખા પાતળા વાંસથી છાલ દેવામાં આવે છે. નીથાણવાળા ભાગમાં ચાર મોટા લાકડાના ટેકા બનાવી મૂકે છે. ચારે બાજુ ચાર ચાર જાડા લાકડાના ટેકમ મૂકી દીવાલ બનાવે છે. આ જ રીતે સાંઘે એક ધર બનાવે છે કે નાનું-મોદું હોઇ રહે છે. દોર સામેના ધરમાં જ બંધે છે. ધરની બાજુમાં પાણી માટે નાણી લાકડાની છાપરી બનાવે છે. લ્યાં પાણી મૂકી રહ્યે છે. પાણી પીવા માટે તુંબડાનો હોથો કે શ્રીદુર્ગાની કાથલીનો હોથો બનાવેલ હોથ છે. પાણી ઉથાણવાળા ભાગમાં રહ્યે છે નેથી કોઈ ઝેરી જાનવર કે પણું લેને બગાડે નાનું.

ધરમાં વસ્તુઓ મેડા ઉપર રાખવામાં આવે છે. કેટલીક રોજયર રોજની વપરાસી વસ્તુઓ ધરની દીવાલે ટીંગડી રાખવામાં આવે છે. બીયારણ આપું ધરની ઉથાણવાળી જણ્યાએ લટકાવી રાખવામાં આવે છે. મેડા ઉપર વાંસની કોણીઓ બનાવી તેમાંભરવામાં આવે છે. મેટી, ટોવા વગેરે વસ્તુઓ મેડા ઉપર મૂકવામાં આવે છે. આટલા બહારના

ભાગમાં કે ધરની દીવાલ બાજુ મૂકવામાં આવે છે. ધરમાં
રસોડમાં ભાગ અલગ અનાવવામાં આવે છે. ત્યાં ધંટી અને
શૂલો હોય છે. શૂલો દીવાલની બાજુએ હોય છે. ત્યાં એક
લાકડાની થાંસલી હોય છે કેને ગહરી દેવ તરીકે માને છે.
દીવાળીના દિલ્લે કેની પૂજા કરે છે. તપાસેલ ૨૦ કુદુંઘોનમાં
૪૪ રાઠવાકોણી કુદુંઘો અને ૪૬ લીલ કુદુંઘોનમાં ધરનોનો
પ્રકાર, ઓરદાની ર્થાના તથા દીવાલનો પ્રકાર જોઈએ તો
ધર કેવા પ્રકારનાં બાંધિ છે કેનો પણ ખ્યાત આવે. કોઠો
જોતાં તપાસેલ ૨૦ કુદુંઘોનમાં ધરો કેવા પ્રકારનાં તો કેનો
ખ્યાત આવે છે.

માન્ય-સાધન

કોડ ૧

માનનો મારા, ઓરદાની જેખા તથા દીવાનનો માર દશાલતો કોઠો

દુંબો માનનો માર

દુંબો માર

ગોલા

મહાતમો પ્રકાર, ઓરડાની સેવા તથા દી વાલનો પ્રકાર દચાવિનો કોઠો

જાતિ કુટુંબો મહાતમો પ્રકાર
ઓરડાની સેવા

કુટુંબ પાત્ર કુલ ધરણ શરીર વર્ણનો પ્રકાર
કુટુંબ પાત્ર કુલ ધરણ શરીર વર્ણનો પ્રકાર

ગોલા	અધ્ય									
૨૧૬૧	૪૪	૪૩	૧	૫૭	૨	૩૮	૨	૪૪	-	૪૩
કોણી		૨૭.૭	૨.૩	૧૦૦	૨.૦	૮૩.	૨	૨૭.૭	૨.૩	૧૦૦

ગોલા	અધ્ય									
૨૧૬૧	૪૪	૪૩	૧	૫૭	૨	૩૮	૨	૪૪	-	૪૩
કોણી		૨૭.૭	૨.૩	૧૦૦	૨.૦	૮૩.	૨	૨૭.૭	૨.૩	૧૦૦

ગોલા	અધ્ય									
૨૧૬૧	૪૪	૪૩	૧	૫૭	૨	૩૮	૨	૪૪	-	૪૩
કોણી		૨૭.૭	૨.૩	૧૦૦	૨.૦	૮૩.	૨	૨૭.૭	૨.૩	૧૦૦

ગોલા	અધ્ય									
૨૧૬૧	૪૪	૪૩	૧	૫૭	૨	૩૮	૨	૪૪	-	૪૩
કોણી		૨૭.૭	૨.૩	૧૦૦	૨.૦	૮૩.	૨	૨૭.૭	૨.૩	૧૦૦

તપાસમાં લીધેલ ૪૦ કુટુંબોમાં ૯૮.૮ ૮૫૨ મકાનો
કાચાં જોવા મળયાં હતાં. એક મકાન પાકું જોવા મળયું
હતું. પણ તે મકાન ઉ.અમ્.ડી.સી.ના સ્ટાફ કવાટીનું
જોવા મળયું હતું. તપાસમાં લીધેલ ૪૪ ૨૧૭વા કુટુંબો
પાસે ૪૭.૭ ૮૫૨ કાચાં મકાનમાં જ્યારે તપાસમાં લીધેલ
૪૬ કુટુંબો ને લીલ જાતિનાં હતાં તેથે ૧૦૦ ૮૫૨ કાચાં
મકાનોમાં ૨૫૬વાં જોવા મળયાં હતાં. આમ કુલ કુટુંબોના
૯૮.૮ ૮૫૨ કુટુંબો કાચાં મકાનમાં અને ૧.૨ ૮૫૨ કુટુંબો
પાકું મકાનમાં જોવા મળયાં હતાં. તપાસેલ ૪૦ કુટુંબોમાં
ઓરડાની સંખ્યા જોતાં ૧ ઓરડાવાળા મકાનો ૨૮.૬
૮૫૨ ને ઓરડાવાળા ૬૬.૭ ૮૫૨ જ્યારે ૩ ઓરડાવાળા
૪.૪ ૮૫૨ જોવા મળયાં હતાં. વધુમાં વધુ ધરો ને ખંડ-
વાળાં ૪૪૪૪૪૪૪૪ એક ખંડવાળા છણ્ણાછણ્ણજોવા માથાં
હતાં. ૨૧૭વા કોણી જાતિમાં ને ખંડવાળા ૮૬.૪૮૫૨
એક ખંડવાળા ૨.૦ ૮૫૨ અને ૩ ખંડવાળા ૪.૬ ૮૫૨ જોવા
મળયાં હતાં. જ્યારે લીલ જાતિના ૪૬ કુટુંબોમાં ૧ ખંડ-
વાળાં અને ને ખંડવાળા ૪૭.૮ ૮૫૨ જોવા મળયાં હતાં
જ્યારે ૩ ખંડવાળા ૪.૪ ૮૫૨ જોવા મળયાં હતાં. લીલોમાં
એક ખંડ અને ને ખંડવાળાં મકાનો વધુ જોવા મળયાં હતાં.

તપાસેલ ૪૦ કુટુંબોમાં ૮૬ કુટુંબોનાં મકાનો
વાંશની દીવાલવાળાં જોવા મળયાં હતાં. જ્યારે ૧ મકાન
ઈટની દીવાલવાળુંઝ જોવા મળયું હતું. ને ઉ.અમ.ડી.સી.નું
સ્ટાફ કવાટી હતું.

ઉપરોક્ત કોઠાથી સ્યાટ જોઈ રાકાય છે કે મોટા-
ભાગના કુટુંબો કાચાં મકાનમાં, એકથી ને ઓરડાવાળા
મકાનમાં અને વાંશની દીવાલવાળા મકાનમાં વસવાઈ
કરતા જોવા મળયાં હતી.

2.0.2 2.0.2 2.0.2 2.0.2 2.0.2 2.0.2

3.0.9 3.0.9 3.0.9 3.0.9 3.0.9 3.0.9

4.0.10 4.0.10 4.0.10 4.0.10 4.0.10 4.0.10

5.0.3 5.0.3 5.0.3 5.0.3 5.0.3 5.0.3

6.0.4 6.0.4 6.0.4 6.0.4 6.0.4 6.0.4

7.0.5 7.0.5 7.0.5 7.0.5 7.0.5 7.0.5

8.0.6 8.0.6 8.0.6 8.0.6 8.0.6 8.0.6

9.0.7 9.0.7 9.0.7 9.0.7 9.0.7 9.0.7

10.0.8 10.0.8 10.0.8 10.0.8 10.0.8 10.0.8

11.0.9 11.0.9 11.0.9 11.0.9 11.0.9 11.0.9

12.0.10 12.0.10 12.0.10 12.0.10 12.0.10 12.0.10

13.0.11 13.0.11 13.0.11 13.0.11 13.0.11 13.0.11

14.0.12 14.0.12 14.0.12 14.0.12 14.0.12 14.0.12

15.0.13 15.0.13 15.0.13 15.0.13 15.0.13 15.0.13

16.0.14 16.0.14 16.0.14 16.0.14 16.0.14 16.0.14

17.0.15 17.0.15 17.0.15 17.0.15 17.0.15 17.0.15

18.0.16 18.0.16 18.0.16 18.0.16 18.0.16 18.0.16

19.0.17 19.0.17 19.0.17 19.0.17 19.0.17 19.0.17

20.0.18 20.0.18 20.0.18 20.0.18 20.0.18 20.0.18

21.0.19 21.0.19 21.0.19 21.0.19 21.0.19 21.0.19

22.0.20 22.0.20 22.0.20 22.0.20 22.0.20 22.0.20

23.0.21 23.0.21 23.0.21 23.0.21 23.0.21 23.0.21

24.0.22 24.0.22 24.0.22 24.0.22 24.0.22 24.0.22

25.0.23 25.0.23 25.0.23 25.0.23 25.0.23 25.0.23

26.0.24 26.0.24 26.0.24 26.0.24 26.0.24 26.0.24

27.0.25 27.0.25 27.0.25 27.0.25 27.0.25 27.0.25

કોઠો જોતાં સ્પષ્ટ ખ્યાલ આવે છે કે મકાન
પોતાની માલીકીની જમીનમાં વપાસેલ ૪૦ કુદુંબોમાંથી
૮૮.૯ ૮૫૧ કુદુંબોના મકાનો હતાં જ્યારે ૧૧.૧ ૮૫૧
કુદુંબોનાં ઘરો અન્ય સરકારી, જંગલની, પંચાયતની
જમીનોમાં બનાવેલ જોવા મળ્યાં હતાં. તપાસેલ ૨૧૬વા-
કોળિનાં ૪૪ કુદુંબોમાંથી પંચ કુદુંબોનાં મકાનો અન્ય
જમીનોમાં જોવા મળ્યાં હતાં. જંગલ ખાતાની જમીનમાં
૩ કુદુંબો અને પંચાયતની જમીનમાં ૧ અને અન્ય જમીનમાં
૧ કુદુંબોનાં ઘરો જોવા મળ્યાં હતાં. તે જ રીતે તપાસેલ
૪૬ કુદુંબો ને લીલ જાતિનાં હતો તેઓનાં મકાનો પણ
જંગલની જમીનમાં ૩ કુદુંબો, પંચાયતની જમીનમાં ૧ અને
અન્ય જમીનમાં ૧ કુદુંબોનાં ઘરો જોવા મળ્યાં હતાં.
ઉપરોક્ત કોઠા ઉપરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે મોટા-
લાગનાં કુદુંબોનાં મકાનો પોતાની માલીકીની જમીનમાં
હતાં. જ્યારે ૧૦ કુદુંબો એવાં હતાં કે જેમને અન્ય જમીનોમાંનું
પોતાનાં ઘરો બંદ્ધા હતાં. તપાસેલ ૪૦ કુદુંબો નર્મદા
થોજનામાં ઝૂણાણમાં જતાં હોવાથી અન્ય જમીનોમાં જેઓએ
મકાન બંધ્યાં છે તે બ્રે ગેરકાયદેસર ગણાશે નહિ અથવા તેની
આકારણી કરવામાં નહી આવે તો તેમને ઘરોનું કોઈ પણ
જાતનું વળતર ભાડી શકવાનું નથી તે સ્પષ્ટ થાય છે.

છાપરાનો પ્રકાર દર્શાવતો કોઠો

જીલ કુલ ધારે દેશી વિલાયતી પતરાં કુલ
કુદુંબો નળિયાં નળિયાં

૨૧૬૫૧-૪૪	-	૪૩	-	૧	૪૪
કોઠી				૨૭.૭	૨.૩
					૧૦૦

જીલ	૪૬	-	૪૬	-	૪૬
			૧૦૦		૧૦૦

કુલ	૨૦	-	૮૮	-	૧	૨૦
				૨૮.૮	૧.૨	૧૦૦

તપાસેલ ૨૦ કુદુંબોનાં મકાનો મોટાસાગનાં કાચાં,
વાંસની દીવાલબાળાં અને વાકડાનાં બનાબેલ હતાં.
મકાનોના છાપરાનો પ્રકાર જોવાં કોઠા ઉપરથી તેનો
૨૫૭૮ ખ્યાલ આવે છે કે મોટાસાગનાં કુદુંબોનાં છાપરાં
દેશી નળિયાથી ચારવારમાં આવેલાં હતાં. આપણુંને થાય કે
જ્ઞાન ધારે કે વિલાયતી નળિયાં કે પતરાં નહિ પણ દેશી
નળિયાં કેમ વો દેશી નળિયાં તેઓ જાંબે જ બનાવી વે છે.
બણી જાંબે ન બનાવે વો પોતાનો જાતિસાઈ તે બનાવી વે
છે તેથી બધાં જ કુદુંબો દેશી નળિયાંબાળાં છાજ બનાવે છે.
૧૦૦ દેશી નળિયાંનો જાવ ૨૦ થી ૨૫ રૂપિયા આપવો પડે
છે અથવા જાતે બનાવી વે છે.

ઉપરના કોઠાથી ૨૫૭૮ થાય છે કે દેશી નળિયાંના
છાજવાળા ઘરોનું પ્રમાણ વધુ છે. તપાસેલ ૨૦ કુદુંબોમાં ૮૮
કુદુંબોના મકાનનાં છાજ દેશી નળિયાંબાળા જોવા મળયાં
હતાં જ્યારે એક કુદુંબ પતરાના છાજવાળા મકાનમાં જોવા
માયું હતું તે કુદુંબ અંગળ જોયું તેમ જી.અમ.ડી.સી.ના ૩૮૬૬
કલાર્ટેસેમિઝ રહેતું હતું

ધરવખરી :

ધરવખરીની ચીજોમાં વાસણો એથુ મિનિયમનાં તપેલાં, થળીઓ, પિતળનાં બેડાનો ઉપયોગ પાણી લાવામાં કરે છે. માટીનાં માટલાં પીવાના પાણી લરવામાં વાપરે છે. આ ઉપરાંત કંસાનાં વાસણો, વાટકી અને થળી જોવામાં આખ્યો ને પહેલાના જ્માનામાં ખરીદેલ છે. હાલમાં કંસાનાં વાસણો ખરીદતા નથી. આ ઉપરાંત નેલો જી. એમ. ડી. સી. માં નોકરી કરે છે અથવા આ રીતે સ્થાપનાં સારી છે તેથો સીલનાં લોટો, ઘાલનો ઉપયોગ કરે છે. પિતળનાં વાસણો બેડાં સિવાય કરતા નથી. આટલા લાટકાના દેશેક કુટુંબ વસ્તાઓછા પ્રમાણમાં રાખે છે. ઝીંડાના રેસા કે અંજણ અઠના રેસા બનાવી તેની દોરી બનાવી આટલા લરવામાં આવે છે. આ ઉપરાંત હાંણ ને બેક જાતની વનસ્પતિ થાય છે તેના પણ રેસા બનાવે છે તેનો ઉપયોગ આટલાની પંગોથ બાંધવામાં કરે છે. ઝીંડાના રેસામાંથી કલાત્મક ઈફોણી બનાવે છે. તેમાં બિવિધ રંગના દોરા નાંખી ખૂબ સરજ આટક્રી બનાવે છે. હેટલાંક કુટુંબો ગોદડીનો ઉપયોગ કરે છે. પણ મોટાખાગના ગોદડી કે ગાંદ્લાનો ઉપયોગ કરતા નથી પણ ચાદર નાખી કે ઓફીને સૂઈ રહે છે.

ધરેણાંના ખૂબ શોખીન છે તેથી ધરેણાં ચાંદીનાં, કલાઇનાં વગેરેનો ઉપયોગ કરે છે. નેમની આ રીતે સ્થાપનાં સારી હોથ તે ચાંદીનાં ધરેણાંનો ઉપયોગ કરે છે. બાકીના છલકી ધાતુનાં ધરેણાંનો ઉપયોગ કરે છે. સ્ફીઓ ધરેણાંની ધાણી શોખીન છે. હાથે બંગડી પહેરે છે. ઉપરાંત હાંસી, કંકું, ડોકમાં ભાગકાની માત્રક કે ઇપિયાવાળી સાંકળ પહેરે છે. કાને વાળિયો પહેરે છે. હાથની અંગળીઓ બાંધી પહેરે છે. પગમાં કલ્લાં પહેરે છે તે પતરાનાં કે ચાંદીનાં હોથ છે. પુરુષો કાને કાની પહેરે છે. હાથે કંકું પહેરે છે તે ચાંદીનું કે પતરાનું પણ હોથ છે.

તપાસેલ ૨૦ કુટુંબો પણે ધરવખરી જોવા મળી હતી તે આ પ્રમાણે હતી.

ਦੁਰਵਾਸਾ ਅਤੇ ਮਨੁਸਾ ਸੰਗ ਵਿਚਲੇ।

ନିର୍ମାଣ କରିବାରେ ପରିଚାଳନା କରିବାରେ ଏହା କିମ୍ବା

କାହାରେ କାହାରେ କାହାରେ କାହାରେ କାହାରେ କାହାରେ କାହାରେ କାହାରେ

21641	88	9	205	106	34	223	124	9	604
33.0	59.1	42.00	92.00	81.00	81.00	53.1	100.00	48.00	48.00
65.0	82	926	64	12	243	63	-	603	65.0
86	86	86	86	86	86	86	-	86	86

તપાશમાં લીધેલ કુટુંબોમાં સૌથી વધુ માટીનાં
વાસણો જોવા મળયાં હવાં જેમાં માટ્લાં, તવી વગેરેનો
ઉપયોગ થાય છે. ત્યારણાં ધાતુનાં વાસણોમાં એલ્યુ મિનિ-
થમનાં વાસણો ૪૦૩નીસંખ્યામાં જોવા મળયાં હતાં. કે
કુટુંબદી ૪ થી ૫ની સંખ્યામાં જોવા મળયાં હતાં. એલ્યુ-
મિનિથમનાં રાધનોમાં થાળી, વાટકા, તપેલી જેવી
વસ્તુઓ વાપરતાં જોવા મળયાં હતાં. ત્યારણાં કાંસાતાં
વાસણો પણ કુટુંબદી ૧ થી ૨નીસંખ્યામાં જોવા મળયાં
હતાં. તપાશ કરતાં જાણવા મળેલ કે કાંસાતાં વાસણો
ખાપડાનાં ખરીદેલ છે. અત્યારે અમારાથી ખરીદી
શકાય તેમ નથી તેમ જણા બેલ. વળી કાંસાતાં વાસણોમાં
થાળી, વાટકા જોવામાં આવ્યા હતા. તે જ રીતે
પિતળનાં વાસણો વલાઓછા પ્રમાણોમાં જોવામાં આવ્યાં
હતાં તેનું પ્રમાણ પણ કુટુંબદી ૬ ઐનું કહી શકાય. પણ અઠિંચ
રીતે જારી કે નોકરી કરતા કુટુંબો જ પિતળનાં વાસણો
વાપરતાં હતાં. સ્ટીલનાં વાસણોનો વપરાય જાતે ખરીદીને
કરતા હોથ રેવાં કુટુંબો જોવા મળયાં ન હતાં પણ જેથો
જી.એમ.ડી.સી.માં નોકરી કરે છે તેમને ૬૨ વર્ષોં બોનસમાં
સ્ટીલના ઘાલા, ટીઝીન, લોટા જેવી વસ્તુઓ સેટ આપ-
વામાં આવે છે તેના કારણે સ્ટીલનાં વાસણો ૪૭ નગ જોવા
મળયાં હતાં. તાંબાનાં વાસણોની સંખ્યા નહિંવત જોવા મળી
હતી. કાયનાં કપરકાળી એકાદસે કુટુંબોમાં જોવા મળયાં
હતાં. પિતળનાં વાસણોમાં દેગડાનાં ઉપયોગ વધુ થતો હતો.
કે પાણી લાવવામાં જેને પાણી રાખવાના ઉપયોગમાં લઈ
શકાય.

તપાશેલ ૪૪ રોલવા કુટુંબો પાસે એલ્યુ મિનિથમનાં કુલ
વાસણોમાં ૫૧.૧ ટકા પિતળનાં, ૫૨ ટકા જીલનાં, ૭૪.૪
૮૪ માટીનાં, ૪૭.૯ ટકા કાંસાતાં, ૬૩.૧ ટકા કુલ
વાસણોના ૫૪. ટકા રોલવા કોણી પાંચ જોવા મળયાં હવાં
જ્યારે જીલ કુટુંબો પાસે કુલ વાસણના ૪૬ ટકા વાસણો જોવા
મળયાં હતાં. જીલ કુટુંબોમાં દરેક મકારનાં વાસણો રોલવા-
કોણી કરતાં ઓછા પ્રમાણમાં જોવામાં આવ્યાં હતાં જેનું

કારણ એ કે શીલાની અંગ્રેજી સ્થિતિ જારી નહિ હોવાથી,
ધાતુનાં વાસણું વસાવી શકયા નથી. કાંઈ તે આમાંથી ધણા
ઓછાં કુટુંબો છ.એમ. ડી.સી.માં નોકરી કરતા જોવા મળ્યા
હતા. વળી રાઠવાઓ એવીક્ષેપ્તે પણ જારી પ્રમાણુમાં ઉત્તરો
લેતા માતુમ પડ્યા હતા તેથી તેમની પાસે વાસણુની સંપર્યા।
શીલા કરતાં બધારે જોવા મળી. પણ કુટુંબદીઠ જોતાં તેનું
પ્રમાણ બધારે વો ન જ કહી શકાય તેવી પરિસ્થિતિ જોવા
મળી હતી.

આ ઉપરાંત અન્ય વપરાશની થીનો હવે પછીના
કોણ માં ખતાવ્યા પ્રમાણે હતી.

卷一 - 1915

ଓଡ଼ିଆ ଲେଖକଙ୍କ ପରିଚୟ ଓ କବିତା ଏକାନ୍ତରୀୟ ପ୍ରକାଶନ ।

અતિ કુદુરુણ પ્રાણ-મુરશી ધર્મ- રેડોઓ ભાઈબાન રિકાર્ડના વાનિંગ્સ ચીયની ચીલ- ટ્રોપા- ૬૦- પદી બેરી અથ- કુદુરુણ
 કુદુરુણ ડોરીના ચીલ- પ્રકારની ચાલની હાની- ટ્રોપલી બાની
 વાની ચીલ-
 ચાલની

ધરવપરાશની થીજોનો કોઠો જોવાં લગે છે કે
ભીલો અને રાઠવાખોમાં ધરવખરી ઘણી બોઇ જોવા મો
છે. જુવન જરસિયાતની થીજો પણ વ્યક્તિત્વીઠ હોતી નથી.
કુલ ૬૦ કુદુંબોમાં કુલ ૭૩૫ની વસ્તી છે. આટલી વસ્તિ વચ્ચે
દોરી ભરેલા આટલાની સંખ્યા ૪૪૪ ૨૬૬ જોવા મળયા.
હતા એટલે કે દરેક માટે ન છે પણ ધરમાં બેથી પ્રણ આટલા
દોરી ભરેલા હોય છે. કેટલાંક ધરોમાં આટલા ન હોય તેવાં
કુદુંબો પણ જોવા મળયાં હતાં. રેખલ ખુરસી, ધડિયાળ અને
રેડીઓ દૃક્ત ૨૧૭વા કુદુંબો જેઓ નોકરી કરે છે તેમના ધરે
જોવા મળયા હતા. જ્યારે માઈલાં પકડવાનાં સાધનો જેવાં
કે જાળ, મળી, ભોત, આચવો વગેરે કુલ મળી ૩૬ જોવા
મળયાં હતાં. આ ચિંહ સિથિતિ સારી હોય તેવાં કુદુંબો જાળ
વસાવી રાકે છે બાકીનાં આચવો કે મળી, ભોતનો ઉપયોગ
કરે છે જે જાતે બનાતીલે છે. આવાં સાધનો એકપીજાને
વાપરવા પણ આપે છે. શિકારનાં સાધનોમાં મુખ્ય ત્વે ધનુષ
બાણ જોવા મળયાં હતાં. ૨૧૭વા તેમ જ ભીલ કુદુંબોમાં
કુદુંબદીઠ ધનુષ જોવા મળ્યું હતું. ભીલોમાં ધનુષની સંખ્યા
બધારે જોવા મળી હતી. જેઓ જીગતમાંથી વાંસ કાપી લાવી
જાલે જ બનાવીલેતા હોય છે. વાંઝિંનો હળિનાં હોય છે.
કેટલાંક કદારે નાચવા ગાવાના શોખીન હોય તેઓ દોલ
પોતાના ધરે પણ ૨ાંખે છે તેની સંખ્યા ૮ની જોવા મળી
હતી. થીમનીની સંખ્યા ૬૮ જોવા મળી હતી જે કુદુંબદીઠ
૧ની કાળી શકાય. હજુ પણ હાનસ જોવા મળી ન હતી.
સીવવાનો સંથો એક કુદુંબમાં જોવા મળયો હતો. જે
હાટમાં અથવા ગામમાં નાનાં આગકોના બુશાં, થડી વગેરે
બનાલે છે. આ ઉપરાંં ટોપલા-ટોપલીની સંખ્યા ૫૩૭ની
જોવા મળી હતી જે વ્યક્તિત્વીઠ એક કાળી શકાય. ટોપલીઓ
નાની હોય છે. જાતે બનાવી લેતા હોય છે. ટોપલી ધરમાં,
જીગતમાં, એતરમાં દરેક જાય જે ઘણી ઉપયોગી વસ્તુ હોવાથી
દરેક કુદુંબો બેગણ ટોપલી રાખતાં જોવા મળયાં હતાં. તે જ
રીતે દળવાની ઘંટી પણ દરેક કુદુંબ પાસે જોવા મળી. આને

પણ આ દિવાસી ખીઓ જાતે ન હતે છે. દળવાળી ધંટી એ જીવન જરૂરી અગત્યાની બીજી હોવાથી દળવા, દળ બનાવવા વગેરે માટે ધંટી ખૂબ જરૂરી હોવાથી દરેક કુદુંબ ધંટીને વસ્તુવી લે છે. પેટી, બેટરીની સંખ્યા ૨૧૬૩૭ કુદુંબોમાં વધારે જોવા મળી હતી જ્યારે લીલોમાં રેનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું. જેણાના કારણે બેટરી એ ઘણી જ ઉપયોગી હોવાથી નોકરી કરતા કુદુંબો પણે પેટી અને બેટરી જોવા મળી હતી. તપાસેલ ૪૪ ૨૧૬૩૭ કુદુંબો પણે ધરવપરાશની કુલ બીજોના ૫૫.૪ ૮૫૧ જોવા મળી હતી જ્યારે તપાસેલ ૪૬ લીલ કુદુંબો પણે કુલ બીજોના ૪૪.૬ ૮૫૧ લીલો પણે જોવા મળી હતી. આમ ૨૧૬૩૭ અને લીલ બચે ધરવપરાશની બીજોમાં પણ તહીવત જોવા મળે છે.

ખેતીનાં સાધનો દર્શાવતો કોઠો

જાતિ	કુલ	જી	કરણ	નાના	કુલ
	કુદુંબો	લાકડું		નોજારો	
૨૧૬૩૭	૪૪	૭૩	૪૭	૨૫૨	૩૭૭
		૪૨.૭	૬૧.૨	૪૨.૮	૫૦.૬
લીલ	૪૬	૭૪	૩૦	૨૫૪	૩૪૮
		૪૦.૦૩	૩૮.૬	૪૦.૨	૪૮.૦૧
કુલ	૪૦	૧૪૭	૭૭	૫૦૫	૭૨૯
		૧૦૦	૧૦૦	૧૦૦	૧૦૦

આરોકલ કોઠો જોતાં ૩૫૦૮ ખ્યાત આવે છે કે તપાસેલ ૪૦ કુદુંબો પણે ખેતીનાં સાધનો આધુનિક નહીં પણ જાતે બનાવેલાં અથવા તો પૌત્રાના વિસ્તારમાં વપરાતાં એવા લાકડાનાં જી ૧૪૭ હતાં. કરણની સંખ્યા

૭૭ અને નાતાં ઓજારોની સંખ્યા ૫૦૫ની જોવા મળી હતી. નાતાં ઓજારોમાં કોડાળી, કુહાડી, પાવડો, દાતરડું, જેવાં એતીનાં ઓજારોનો સમબેશ થાય છે. તપાસેલ ૪૪ રોઠવા કુટુંબોમાં જોઈએ તો ૪૬.૭૮૫ જીવા મળ્યાં હતાં. કરણ ૬૧.૧૮૫ અને ૪૬.૮૮૫ જીવા મળ્યાં હતાં જેથી સ્પૃષ્ટ થાય છે કે એતી કરવાના પ્રાથમિક સાધનો દરેક કુટુંબો પાસે ઓછામાં ઓછાં વેની સંખ્યામાં જોવા મળ્યાં હતાં. કેંજ રીતે ભીલ જાતિનાં ૪૬ કુટુંબો પાસે ૭૪ હજાં જે કુલ હળવા ૫૦.૩૮૫, ૩૦ કરણ જે કુલ કરવાના ૩૮.૬૮૫ અને નાતાં ઓજાર ૨૫૪ જે કુલ નાતાં ઓજારના ૫૦.૨૮૫ જોવા મળ્યાં હતાં. ભીલ કુટુંબો પાસે કરણની સંખ્યા ઓછી જોવા મળી હતી એટથે કે તેઓ એતીની જરૂરિયાં બધાં સાધનો વસ્તુવી શક્યા નથી પરંતુ લાકડાનાં હજાં અને નાતાં ઓજારની મદદથી એતી કરવા માતુમ પડ્યા છે. તપાસેલ કુટુંબોમાં બધાં કુટુંબોને નામે જમીન નહિ હોવા છતાં જંગલની કે અન્ય પડતર જમીનોમાં પણ તેઓ વખ્ટોથી એતી કરવા હોવાથી લેમની પાસે એતી માટેનાં સાધનો જોવા મળ્યાં હતું.

પછેરવેશ :

પુરુષો લંગોટ પહેરે છે. ઉપર બંડી, ઘમીસ પહેરે છે. મોટાભાગના ખુલ્લા રહે છે અને એક કૃપું ઓઢી નાં. લંગોટ પથી ૭ ૩ પિયામાં આવે છે. લંગોટ ૩ દોરી જાતે જ બનાવી લે છે. લંગોટની બાગળ પટ્ટા એક ૧૬ કુટના લટકતા રહે છે. લંગોટ રંગબેરંગી આકર્ષક રહે છે. છેડ નાવે છે. માણે લાલ પાદણી નાં. ઉપર ઝૂમતાં કે કલરવાળો નાં. કિંમત ૨૫ ૩ પિયા સુધીની થાય ૨૧, સખલું કો પાડો

૭૭ અને નાનાં ઓજારોની રીતથા ૫૦.૧ાં જોવા મળી હતી. નાનાં ઓજારોમાં કોઈઠાણી, કુહાડી, પાવડો, દાતરડું, જેવાં ખેતીનાં ઓજારોનો સગાવેશ થાય છે. તપાસેલ ૪૪ રોઠબા કુટુંબોમાં જોઈએ તો ૪૮.૭૮૫ અને જોવા મળયાં હતાં. કરણ ૬૧.૧૮૫ અને ૪૮.૮૮૫ જોવા મળયાં હતાં જેથી સ્પૃષ્ટ થાય છે કે ખેતી કરવાના પ્રાથમિક સાધનો દરેક કુટુંબો પાસે ઓછામાં ઓછાં ખેતી સંખ્યામાં જોવા મળયાં હતાં. કે જ રીતે લીલ જાતિનાં ૪૬ કુટુંબો પાસે ૭૪ હજા કે કુલ હજાના ૫૦.૩૮૫, ૩૦ કરણ જે કુલ કરણના ૩૮.૬૮૫ અને નાનાં ઓજારી ૨૫૪ કે કુલ નાનાં ઓજારના ૫૦.૨૮૫ જોવા મળયાં હતાં. લીલ કુટુંબો પાસે કરણની સંખ્યા ઓછી જોવા મળી હતી એટલે કે તેથો ખેતીની જરૂરિયાતનાં બધાં સાધનો વસ્તુઓ રાક્યા નથી પરંતુ લાકડાનાં હજા અને નાનાં ઓજારની મદદથી ખેતી કરવા માત્રમનું પડ્યા છે. તપાસેલ કુટુંબોમાં બધાં કુટુંબોને નામે જમીન નહિં હોવા છતાં જંગલની કે અન્ય પડતર જમીનોમાં પણ તેથો વખ્ટોથી ખેતી કરવા હોવાથી લેમની પાસે ખેતી માટેનાં સાધનો જોવા મળયાં હતું.

પછેરવેશ :

પુરુષો લંગોટ પહેરે છે. ઉપર બંડી, ઘામિસ પહેરે છે. મોટાબાળના ખુલ્લા રહે છે અને એક કપડું ઓઢી રાખે છે. લંગોટ પથી ૭ ૩પિયામાં આવે છે. લંગોટ બાંધવાની હોરી જાતે જ બનાવી કે છે. લંગોટની આગળ પાછળ બે પદ્ધાં એક ૧૬ કુટના લટકતા રાખે છે. લંગોટ બાંધવાની હોરી રંગયેરેણી આકર્ષક રાખે છે. છેડા ઉપર ઝૂમતાં હોય છે. આ હોરી કેટલાક જાતે બનાવી કે છે કેટલાક તૈયાર લાવે છે. માણે લાલ પાધડી અંટાવણી બંધે છે. છેડા ઉપર ઝૂમતાં કે કલરવાળો ભાગ હોય છે. લાલ પાધડીની કિંમત ૨૫ ૩પિયા સુધીની થાય છે.

સ્ત્રીઓ ધાધરો અને ઓછણી ઓદે છે. સ્ત્રીઓ ચોલી કે બાંદું પહેરતી નથી. કેટલીક સ્ત્રીઓ ડગલી નેતું પહેરે છે. ધાધરા માટે છ હાથ લાંબું રંગીન કપડું લાવે છે. પણી લેને જાતે જ સીવી લે છે. ધાધરો પહેરે લેનો કહોટો વાળો હે છે. ઉપર ઓછણી પહેરે છે. ઉપરાયક સ્ત્રીઓ ડગલી પહેરતી નથી, ઓછણું છાતી ઉપર નાખી હે છે. ધાધરા માટેનું કાપડ પો ઇપિયા સુધી આવે છે. ઓછણી રૂપ ઇપિયાની તૈથાર આવે છે.

નાનાં બાળકો પણ લંગોટ પહેરે છે. કેટલાક ચુવાનો ચૂઝી અને બંદી પહેરે છે. બંદી કલરવાળો પસંદ કરે છે. બાળકો તૈથાર કપડાં પહેરે છે. મોટાભાગે ઉધાડા શરીરે રૂઢે છે.

ખોરાક અને પીણાં :

મુખ્ય પાડ જુવાર, મકાઈ, લીંડી અને બંદી હોવાથી મુખ્ય ખોરાક પણ તેમનો આ જ છે. જુવાર, મકાઈના રોટલા અને દાળ બનાવી ખાય છે. જુવાર મકાઈ, લીંડીને દળી લેના રોટલા બનાવી ખાય છે. આ ઉપરાંત લેને ભરડી તેની થૂલી બનાવી ખાય છે. ધરમાં માળુસો વધારે હોથ અને અનાજ થોડું હોથ તો અનાજને ભરડી તેની રાખ (ગોંઠ) બનાવી પણ ખાય છે. આમ તેમનો મુખ્ય ખોરાક રોટલા અને દાળ છે. આ ઉપરાંત થૂલી અને રાખ. થૂલી તેથો પ્રસંગોપાત બનાવે છે. લગ્નમાં, મૃત્યુમાં, કે વાર-તહેવારે થૂલી બનાવી ખાય છે. તહેવારોમાં અહેનાં છેખરાં બનાવી પણ ખાય છે. લીંડીને દળી લેના રોટલા બનાવે છે. બંદીની રાખ બનાવે છે. લેમની દાળ એ લખકા દાળ છે કે રોટલા ઉંઘર રાખી ખાઈ નાકાય છે. દાળમાં મરણું, ભીંકું નાંખી બનાવે છે. લેલનો ઉપયોગ પ્રસંગોપાત કે વારતહેવારે કરે છે.

આ ઉપરાંત માછલી, મરણી, બાકડું, લેતરા, સસલું ઝંગલી બિલાડાનું માંસ પણ ખાય છે. લીલ લોકો પાડો

અને મરેલા ઠોરનું માંસ પણ ખાય છે. માંસ વારતહેવારે કે મહેમાન આબ્યા હોય ત્યારે ખાય છે. માણલી પકડવા જાય છે કે જ્યારે પકડી લાવે ત્યારે ખાય છે. તેમને પૂછતાં કહે છે કે જુદે ત્યારે ખાય છે. પણ વારતહેવારે દેવની વિધિ કરે ત્યારે મરદાને મારે છે અને તે દિવસે મરદાના માંસ સાથે થૂલી ઘનાવી ખાય છે. મોટા કુદુંખ-વાળા કે આધિક રીતે સારા કુદુંખો બકડું મારીને માંસ થૂલી અને દાઢનો ઉપયોગ કરે છે.

પીણામાં દાઢ, વાડી, ચા વગેરે પીવે છે. પણ નિયમિત પીતા નથી. જ્યારે મણી ત્યારે પીવે છે. ચાનો ઉપયોગ ચોમાસામાં અને શિયાળામાં ડેટલાંક કુદુંખો સવારે નિયમિત પીવે છે. ડેટલાંક પીતા નથી. વારતહેવાર કે મહેમાન આબ્યા હોય તેવા પ્રસંગે દાઢ કે વાડી બને પીવે છે. મહેમાનનું સ્વાગત દાઢ અને મરદીથી કરવામાં આવે છે.

રાઠવા, કોળી અને ભીલ પુરુષ લ્લીઓની ઝોરાક ઝોલાની આસ્તિયત જોઈએ તો બેસીને ઝોરાક ખાતા નથી પણ ધરમાં કે ધરની બજાર આવી પોતપોતાની અનુકૂળ જગ્યાથે લાકડા ઉપર અધ્યાર પગે બેસી, બજાર ઉલા રહી રોટલા ઉપર કે વાસણુમાં દાળ લઈ બજાર આવી ઉલા ઉલા પણ ખાતા હોય છે. બાળકો પણ રોટલા ઉપર શાક-દાળ લઈ ખાય છે.

રાઠવાંકોળીમાં ઉદ્દરતા :

મારા ક્ષેત્રકાર્ય દરમ્યાન મધ્ય પ્રદેશથી નવ માણસોની બેક મદદરી ટોળી ગામમાં આવેલી. આ ટોળી શિવરાણી મહોલ્સાવ વખતે આવેલી. આ ટોળી ક્ષણથી થાર દિવસ ગામમાં રહી. ધરે ધરે માંગવાનો ધંધો કરે. મારી કુદુંખોની મુલાકાત વખતે એ કુદુંખોમાં આ ટોળીના પણે માણસો આવેલા. રાઠવા કોળી ભાઈને રામ રામ કરી ધરમાં જ બેઠા. કંઈ પણ બોલ્યા. શિવાય રાઠવાંકોળી

ભાઈ ધરમથી અનાજ લાવી આપવા લાગ્યા। ત્યારે
મહારીએ કહ્યું કે મારે અનાજ નથી જોઈતું, મારે તો
લોટ (આટો) જોઈએ છે. તો ધરમાંથી ૪૦૦થી ૫૦૦
ગ્રામ જેટલો લોટ વિનાસંકોણે લાવી આપ્યો. બીજા
ધરેથી ૩૦૦થી ૪૦૦ ગ્રામ જેટલી જુવાર આપેલી.

મૈં કહ્યું એ લોકોને તમે કેમ આપો છો ? તો
તેમણે કહ્યું "માગવાવાળાને તો આપવું જ પડે. અહીં તો
ધણા આવે છે. તેમને અમે કે માગે તે આપીએ છીએ. કોઈને
પાળ કાઢવા નથી." રઠવા કોળિમાં મહારી, ગરીબ
હરિજન વગેરે માંગવા આવે છે. ન આપો તો તેવો પ્રશ્ન
કર્યો! ત્યારે કહ્યું કે માગવાવાળાને તો આપવું જ પડે પણ
ન હોથ અને ન અપે તો કંઇ નહીં. ગ્રામ મધ્યપ્રદેશની
સરહે આવેલું હૌવાથી આવા ધણા બદા માગવા આવે છે.

આ થિકી જીવન

વસતિ :

૧૯૮૧ની વસતિ ગણુતરી મમાણે ગામની કુલ વસતિ ૧૯૮૪ની છે. ૮૫૭ પુરુષો અને ૭૮૭ સ્ત્રીઓ છે. મુખ્ય વસતિ સીલ, ૨૦૬૩ કોણીની છે. એ કુદુંઘ મુખ્યાં માત્રાતાં છે. કેબો જીવન જરૂરિયાતની ચીજાં સુશોની દુકાન ચલાવે છે. ગામલોડોનો મુખ્ય વ્યવસાય ખેતી, મજૂરી, જંગલપેદાનો એકટી કરતાનો અને પશુપાલનનો છે. પશુઓમાં મુખ્ય ત્વારે ગાય, બળદ, બકરી પણે છે. મરધાં પણ પાણે છે. કેટલાંક કુદુંઘો સેંશ અને પાડા પણ પાણે છે. આ ઉપરાંત ગામમાંથી ૨૫ થી ૩૦ પુરુષો જ.આમ.ડી. સી.ના કારણાને કાયમી નોકરી કરે છે. કેટલાંક છૂટક મજૂરાણેપણ બોલાવે ત્વારે જાય છે. આ ઉપરાંત જંગલકૃપ, નરી, રોડકામ કેવી મજૂરી કરે છે. ખેતીમજૂરીમાં અનાજ આપવામાં આવે છે તે ખાસ કરી થાંમાસાના દિવસોમાં ભણે છે બાકી મળતી નથી. આમ મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે. ખેતીની જમીન હુંગર ઉપર જથું સપાટ મેદાન હોથ લેવી જગ્યાએ ખેતી કરે છે. હુંગરો ઉપર જથું સપાટ મેદાનો છે તે જમીનો ખેતી માટે ધારી સારી હૈ પણ હુંગરોના ટોઠાવો ઉપર એ ખેતીની જમીનો છે તે પણ રવાળી અને ઓછા કસવાળી છે. દરેક કુદુંઘ ખેતી કરે છે તે રેતા નામ પર જમીન હોથ કે ન હોથ તો પણ જંગલની કે ખરાયાની જમીનમાં વત્તાઓછા પ્રમાણમાં જમીનો ખેડે છે. મોટાલાગના ખાવેદારો ખાસે રેવન્યુ જમીન કરતાં જંગલ અને ખરાયાની જમીનો વધારે પ્રમાણમાં ખેડે છે.

ખેતી માટે બળદનો ઉપયોગ કરે છે. મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલનનો હોવાથી દરેક કુદુંઘ પણે બળદની જોડી

અવસ્થા રાખે છે. ગાય પાડી છે જેથી બળદ બેશતા લાવવા
પડતા નથી. એતી માટે પાડાનો ઉપયોગ પણ કરે છે. તે
ધરણાં ઓછાં કુદુંબો કરે છે. મોટાખાગના રાઠબાકોણી
કુદુંબો પશુઓ માટે પોતાના ધરની સામે જ એક એવા જ
પ્રકારનું ધર અનાંબી પોતાની સામે જ બંધે છે. વર્ષે
લાકડાં મૂકી દેવામાં આવે છે. આમ તેઓ પશુઓને
પોતાની આગળ બંધે છે. કેટલાંક બાજુમાં પણ છાપરી
અનાંબી બંધે છે. મરધાને તો ધરમાં જ વાંસના ટોપલા
અનાંબી તેમાં રાખે છે જેથી તેનાં ઠડાં અને બરચાંને કોઈ
પણ પ્રકારના પક્ષીઓ હેરાન કરે નાં. જ્મિન ન હોય તો
પણ પશુઓ પાણે છે. તેમાં બકરાં અને મરધાંના તો બધાં જ
કુદુંબો પાણે છે. એકદરે પશુઓની જાત કહમાં નાની હોય
છે. પણ તે એતી માટે લાયક બાણવામાં આવે છે. બળદ
કહમાં નાના હોય છે કે હુંગર વિસ્તારની જ્મિનો એડ-
વામાં લાયક બાણવામાં આવે છે.

એતી માટેનાં મુખ્ય બે સાધનો છે, લાકડાનું હળ
હોય છે તેની નીચે લોખંડનો ફારવો અને લોખંડનો પાટો
જ લગાંબી એડવામાં આવે છે. તેના ચાસ પાડી તેમાં
અનાજ અટેવામાં આવે છે. બીજું સાધન કરડી (કરણ).
આનો ઉપયોગ એતીની જ્મિન વખોડવા માટે થાય છે.
કરડીથી જો પ્રથમ એતર વળોડી નાખવામાં આવે છે. આ
સિવાય નાનાં સાધનો દાતરણું, કોણાળી, પાવડાનો
ઉપયોગ જ્મિન સરણી કરવા કે ખોડકાખ કરવા વાપર-
વામાં આવે છે. અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવતો
નથી. અનાજને ચાસ પાડી ઓરી દેવામાં આવે છે.
લાવણીનો ઉપયોગ કરવા નથી. એતી માટેનાં સાધનો
પશુઓની છાપરીમાં અથવા ધરની દીવાલે એક બાજુ
મૂકવામાં આવે છે. દરેક ઝેડૂત પાસે એતી માટેનાં સાધનો
પૂરતાં નથી હોતાં. પણ જેની પાસે બળદ છે તેમની પાસે
હોય છે. એતીનાં સાધનો ન હોય તો માણી લાંબીને પણ
એતી કરાવે છે. કુદુંબી પાસેથી હળ અને બળદ માણી લાવે છે.

ખાતરનો વ્યવસ્થિત ઉપયોગ કરવાને અહેવા ખેતરમાં
કેરી દેવામાં આવે છે. કેટલાક રાન્ડવેચોળી કુદુંબો
જાણ્યા ખાતરને લેંગું કરી વ્યવસ્થિત ખેતરમાં ન હોય છે
જ્યારે કેટલાંકી કુદુંબો તેમ ન કરતાં રોજેરોજ ખાતરને
પોતાના ખેતરમાં જ નાણી દેતા હોય છે. મોટાસાગે લીલ
લોકો રોજેરોજ ખેતરમાં ખાતર નાણી હોય છે. આ ઉપરાંત
નેથો હાઇઝ્ટ બિચારણનો ઉપયોગ કરે છે તેથો રાસાય-
નિક ખાતર યુરિયાનો ઉપયોગ કરે છે. જેમની આંધીક
સ્થિતિ સારી હશેય તે એકાદ ખેતી વાપરે છે. ખાકીના
જાણ્યું ખાતર વાપરે છે.

મુખ્ય ૫૧૪ જુવાન, મહાઠ, બંદી, લીંડી, લલ,
તુલાર અને અડ્ડ છે. આ ઉપરાંત કપાસનું વાલેતર પણ
એકાદલ્યે જ્યાએ જોવામાં આવ્યું. આ ઉપરાંત પોતાની
માલિકીની જમીનમાં અંબા, મફુડા, વાડ, વોરડી વગેરે
ગુંડ હોય છે જેના ફુલની આવક પણ મેળવે છે.

નીચેના કોઠા અંગ ઉપરથી તપાસેલ છું કુદુંબોના
આંધીક દરજાનો સ્પેશ ખાલ મેળવી શકાય છે કે કુલ
સુધ્ય સંપદામાં કેટલા કમાનાર, કેટલા કમાનાર પણ
કમાનાર પર આધારીત અને કેટલા નહિ કમાનાર પણ
કમાનાર ઉપર આધારીત સુધ્ય સંપદા છે લેનો સ્પેશ
ખાલ આવે છે.

33. 8 28. 6 33. 6 100. 00 100. 00 100. 00

363 363 363 363 363 363 363 363 363 363

202 202 202 202 202 202 202 202 202 202

30. 2 30. 2 30. 2 30. 2 30. 2 30. 2 30. 2 30. 2 30. 2

925 925 925 925 925 925 925 925 925 925

36. 0 36. 0 36. 0 36. 0 36. 0 36. 0 36. 0 36. 0 36. 0

616 616 616 616 616 616 616 616 616 616

106 106 106 106 106 106 106 106 106 106

85 85 85 85 85 85 85 85 85 85

36. 0 36. 0 36. 0 36. 0 36. 0 36. 0 36. 0 36. 0 36. 0

925 925 925 925 925 925 925 925 925 925

100. 00 100. 00 100. 00 100. 00 100. 00 100. 00 100. 00 100. 00 100. 00

1916 1916 1916 1916 1916 1916 1916 1916 1916

કોઠો જોતાં ૨૫૭૮ થાય છે કે કુલ સંખ્યામાંથી
 કમાણી કરનાર ૪૦ પુરુષો છે જેનું પ્રમાણ ૨૪.૧ ૮૬૮૮
 છે. જેમની ઉપર બીજા સંખ્યાનો અધિક છે. જ્યારે
 કમાણી કરતા હોવા છતાં કુટુંબ પર આધારિત એવા
 થુબાનો ૩૩.૪ ૮૬૮ અને સ્ત્રીઓનું ૫૫.૭ ૮૬૮ પ્રમાણ
 જોવા મળ્યું હતું. આ સંખ્યા વત્તાઓછા પ્રમાણમાં કુટુંબને
 કમાણી કરવામાં મહાગાર થાય છે જ્યારે કુટુંબને
 કમાણીમાં બિલકુલ MEE નહિ કરી શકતાં નાનાં બાળકો,
 સ્ત્રીઓ અને વૃદ્ધ્યોની સંખ્યા વધુમાં વધુ છે. કુલ પુરુષ
 સંખ્યામાં ૪૨.૫ ૮૬૮ અને સ્ત્રી સંખ્યામાં ૪૪.૩ ૮૬૮
 જોવા મળી હતી. તપાસેલ ૪૪ ૨૧૬વા કુટુંબોમાં ૪૪
 પુરુષો અને કુટુંબના મુખ્ય કમાણાર વ્યક્તિ હતા જ્યારે
 કમાણી કરનાર પરંતુ કમાણાર પર આધારિત પુરુષો ૬૫
 હતા કે પુરુષ સંખ્યાના ૩૭ ૮૬૮ થાય છે જ્યારે સ્ત્રી
 સંખ્યામાં ૫૮.૮ ૮૬૮ સ્ત્રીઓ કમાણી કરનાર પરંતુ કમા-
 ણાર પર આધારિત હતી. જ્યારે નહિ કમાણારમાં પુરુષ
 અને સ્ત્રીઓની સંખ્યા સરળી જોવા મળી હતી. તે જ
 રીતે ભીલ કુટુંબોમાં પણ ૩૦.૨ ૮૬૮ પુરુષો કમાણી કર-
 નાર પણ કમાણાર પર આધારિત હતા જ્યારે સ્ત્રીઓની
 સંખ્યા ૧૦૦ હતી કે કુલ સ્ત્રીના ૫૨.૧ ૮૬૮ પ્રમાણ હતું.
 તે જોવાં સ્ત્રીઓ દેશ પ્રકારના રોજગાર-ધ૰્માભાઈ
 મહારાજ થાય છે તે સ્પેચ દેખાય છે.

આગળ જોથું તેમ હંહેશ્વર ગામમાં મુખ્ય એ જાતિનાં
 કુટુંબોનો વર્ણવાટ જોવા મળે છે. ૨૧૬વાટોણી અને ભીલ.
 આ એ જાતિનો મુખ્ય વ્યવસાય ખેતી અને ખૂપાતન છે. ઝંગલ
 અને પણડી વિસ્તાર હોવાથી અન્ય ધંધા થઈ શકે તેબી
 ઝંગોલિક પરિસ્થિતિ થોઇ પ્રકારની હોવાથી મુખ્ય
 વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પણપાતનનો છે. ચોમાણુ
 ખેતી સિવાય બીજી કોઈ ખેતી આ વિસ્તારમાં થઈ શકે તેમ
 નથી. અથવા પાણીની સગલ નથી તેથી ચોમાણાની ખેતી

૩૧૬ મજૂરી માટે જેગલ બાંધકામ અને પશુપાલનનો
આસરો કેવો પડે છે. બાળકો કામ કરવા જેવાં થાય
ત્યારે જેગલમાંથી કડણનો ગુંડર, ગુગળ, ચારોળી,
એકટી કરવાનું કામ કરે છે. નાનાં બાળકોને રાખવાનું
કામ પણ કરે છે. આ ઉપરાંલ પશુપાલનનો વ્યવસાય
હોવાથી હોર ચારવાનું કામ પણ બાળકો જ મુખ્ય ત્થે કરે
છે. કડીપણી જ. એમ. ડી. સી. નું કારખાનું હોવાથી કેદ-
વાચ ચુવાનો ત્થાં નોકરી કરવા માટે જાય છે. વળી
કેટલાક ચુવાનો છૂટક મજૂરીનું કામ ચાલે ત્યારે કારખાના-
માં જાય છે. જ. એમ. ડી. સી. નો પણી પુરવઠો હાંદ
ગામના નર્મિના કિનારેથી આવતો હોવાથી હાંદ
ગામના માણુસોને રોજગારીની તક મળી છે. આ તકનો
લાલ મોટાખાગના રાઠવા આ કુટુંબોને લીધો છે તેમ તપાસ
દરમાન જોવા મળે છે. ભીલ જાતિના કુટુંબો નોકરી
કરતા ઓછા જોવા મળ્યા હતા તેનું કારણ એ પણ હોઈ
શકે કે ગામ ૧૨ ફિલિયામાં વહેંચાયેલું છે. વિસ્તાર ધણો
મોટો હોવાથી જ. એમ. ડી. સી. ના નાણકના અથવા પણી
પુરવઠો નાણકના ફિલિયાવાળાઓને તેનો લાલ વધારે મળ્યો
છે. નીચેના વ્યવસાય દર્શાવતા કોઠા ઉપરથી તે રૂપ ૭૮
જોઈ શકાય છે.

୪୮

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ

କାଳେ ପାଦରୁଷି ପାଦରୁଷି ପାଦରୁଷି
ପାଦରୁଷି ପାଦରୁଷି ପାଦରୁଷି ପାଦରୁଷି

બ્યવસાય દરોવતો કોઠો જોતાં સ્પષ્ટ ખ્યાલ
આવે છે કે દૂણમાં જતાં કુદુંઘોનો મુખ્ય બ્યવસાય હેતી
અને મજૂરીનો છે, તપાસેલ ૪૦ કુદુંઘોના ૭૫.૬ ૮૫૧
કુદુંઘો હેતી અને મજૂરી ઉપર આધારીત જોવા મળથાં
હતાં. જ્યારે હેતી કરતા કુદુંઘો ૬.૭ ૮૫૧ જોતાં મળથાં
હતાં. હેતી અને નોકરી કરતા ૧૨ કુદુંઘો જે કુલ કુદુંઘોના
૧૩.૩ ૮૫૧ હતાં. જ્યારે મજૂરી ઉપર નથતું ૧ કુદુંઘ જોવા
મળયું હતું. ધ્યાં અને હેતી કરતું ૧ કુદુંઘ જોવા મળયું હતું.
જ્યારે નોકરી કરતા ૨ કુદુંઘો જોવા મળથાં હતાં.

કોઠા ઉપરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે ૨૧૬વાકોણી
૧૧.૩ ૮૫૧ હેતી, હેતી અને મજૂરી કરતા ૫૬ ૮૫૧ અને
હેતી અને નોકરી કરતા ૨૨.૮ ૮૫૧ જ્યારે ધંધો અને હેતી
કરતા ૨.૩ ૮૫૧ અને નોકરી કરતા ૪.૬ ૮૫૧ કુદુંઘો
જોવા મળથાં હતા કે જોતાં ૨૧૬વાઓ કડીપાણી છ.એમ.
ડિ.સી.ના કારણાને કારણે નોકરીએ લાગ્યા હતા
જ્યારે હેતીમાં પણ તેમનું પ્રમાણ સાચું જોવા મળયું હતું.
જ્યારે તપાસેલ ૪૬ કુદુંઘો લીલ જાતિના હતાં. તેમનો
બ્યવસાય જોતાં ૧ કુદુંઘ હેતી કરતું હતું. મોટાસાગનાં
કુદુંઘો હેતી અને મજૂરી કરતાં જોવા મળથાં હતાં જેનું
પ્રમાણ ૪૧.૩ ૮૫૧ હતું. હેતી નોકરી કરતાં ૨ કુદુંઘો
જોવા મળથાં હતાં જ્યારે નોકરી કે ધંધાતાજી એક પણ
કુદુંઘ જોવા મળયું ન હતું. તે જોતાં ૨૧૬વાઓની સ્થિતિ
લીલો કરતાં એકદરે સારી અને ધંધા બ્યવસાયમાં પણ
જોડાયેલા જોવા મળથાં હતાં. જ્યારે લીલો હજુ પણ
પોતાની કુની પદ્ધતિથેથી હેતી અને મજૂરી કરતા જોવા
મળથાં હતાં. છ.એમ.ડિ.સી.ના કારણાનો લાસ પણ
૨૧૬વાઓએ સારા પ્રમાણમાં લીધો છે કે સ્પષ્ટ જોઈ
શકાય છે.

નમ્રેદી બોજનામાં દૂણાણમાં જતાં હાંક ગામના
તપાસેલ ૪૦ કુદુંઘોમાંથી ૪૪ ૨૧૬વા કુદુંઘો અને ૪૬ લીલ
કુદુંઘોનો સમાવેશ થાય છે. તપાસેલ ૪૦ કુદુંઘોમાંથી ૩૩

કુદુંબો પાસે જમીન પોતાના નામ પર હતી. જે કુદુંબો
કુલ કુદુંબોના ૩૪ ૮૫ થાથ છે જ્યારે પછી કુદુંબો બેટલે કે
૬૪ ૮૫ કા કુદુંબો એવાં હતો કે જેમની પાસે રેવન્ચુ જમીનો
હતી. આપા હંદે શ્વર ગામમાં ૫૨ ખાતેડારોના નામ
પર જમીનો છે. બાકીનાં જે કુદુંબો છે તેમના જાગ અ
પ્રમાણેની જમીન એડે છે બેટલે કે જમીન નામ પર ન હોય
તો પણ તેની પાસે બેલીની જમીન હોઈ શકે બેટલે કે વાર-
સાઈ કાથેડા સિવાય વાપના કે મોટાલાઈના નામે જમીન
હોય તે જમીનોના જાગલા કરી અંદર અંદર સમજ પેતી
કરતા હોય. જ્યારે જમીન એક વ્યક્તિના નામે હોય.
જાગલગ મોટાજાગનાં કુદુંબોમાં આવા પ્રકારની વ્યવહાર
જોવા મળયો હતો કે બેદ્ધાં જેમની જમીન એક કુદુંબ
જાઈના નામે હોય. આ ઉપરાંત કેટલાંક કુદુંબો એવાં પણ
જોવા મળયાં છે કે કેબો જંગલની કે ખરાબાની જમીનો
વરસોથી એડતા હોય તણ જમીન નામ પર ન હોય. સર-
કારી કોઈ પણ પ્રકારની કાર્યકાણી કે દંડની પણ્ણોય
તેમની પાસે ન હોય. મોટાજાગનાં કુદુંબો જંગલની કે
ખરાબાની જમીનો થોડીગણી પણ એડતા માતુમ પડયાં છે.
તે કેટલી જમીન છે તેમ ન જણાવતાં એક કે બે પેતર છે તે
એડે છે તેવા જવાયો મળેલ છે. પંચાયતના ખરાબાની જમીન
બેથી દ્રષ્ટું કુદુંબો એડે છે તેનો પંચાયત રેકડ મળે છે પણ
બાકીના જે કુદુંબો પંચાયતની કે જંગલની જમીનો એડે છે
તેનો કોઈ પૂરવો કે રેકડ ઉપર તેમનું નામ નથી. કેટલાંક
કુદુંબો એવાં પણે કે જેમને જંગલનો દંડ ભરી પેતી કરતાં
હોય. કેટલાંક કુદુંબો એવાં પણ છે કે કેબો જ્યારે હોરે સ્ટર
અને ત્યારે તેને અમુક રકમ આપી ઘુસ કરી મોકલી દેતા
હોય અને જમીનો એડતા હોય તેવી પણ માહિતી જાણવા
મળેલ છે. બેટલે કે અત્યાર સુધીની પરિસ્થિતિ માટે આ
બધું વ્યાજાણી હતું પણ અત્યારે જ્યારે નન્દિં થોજનામાં
હૂબણામાં આ ગામ જાય છે ત્યારે તેમના નામ પર તો
જમીન નથી, જેનની પાસે કોઈ પહોંચ નથી, સરકારી
થોપડે કોઈ બેન્દી નથી ત્યારે તેમને કોઈ પણ પ્રકારનું

વળતર કે મદ્દ મળવાની નથી તે નિર્ધિષ્ટ છે. વળી નેમના
 નામ પર જમીન છે તે પણ ઓછી છે અથવા એ કંઈ વળતર
 મળવાનું છે તે એક વ્યક્તિને મળવાનું છે. અહારની જમીનો
 રેમને રેમની પાસે છે કેટલા * પ્રમાણમાં જમીન મળવાની
 નથી લારે નેમના નામે જમીન કે કંઈ મિલકત નથી રેમને
 પોતાના ઘર સિવાય કોઈ પણ જમીનની આકારણી થઈ
 શકે રેમ નથી તો રેમના આપરાના ઘરની આકારણી
 કેટલી થરો ? કેટલું વળતર મળરો ? કેટલો ઘરસારો કપારો
 કેટલો ખસેડવાનો ખર્ચ, કપારો અને કેટલી બધત રહેણે કે
 રેનાથી તે પોતાનું રાખેતા મુજાહનું લદનદ્યોરણ ચલાવી શકે
 અથવા બીજુ જયાંથે સ્થાની થઈ શકે. બીજું એ પણ ચોક્કસ
 છે કે આ દિવાસી પોતાના હક્ક મેળવવા માટે કેટલો જાગૃત
 છે રેતો આપણે જાહૂનીએ હીએ કે જૂદે બેસી રહે પણ અપરિચિત
 વ્યક્તિ જોડે, અપરિચિત અંદ્રિસમાં કે અપરિચિત
 વિસ્તારમાં પોતાનો અથાજ ઉઠાવતો નથી.

આ બધી બાળતોને દ્યાનમાં રાખી રેને કંઈ પણ
 મકારની મદ્દ કરવામાં આવે કે જે નાના બાળકનો
 જ્યાલ રેનાં માતાપિતા રહે છે. બળકને કોઈ પણ
 મકારનો જ્યાલ હોતો નથી કે મારે શું કરવાનું છે રેને
 જ્યાં લઈ જાવ લાં જાય છે, જ્યાં બેશરાડો લાં બેસે છે
 અને જે ખવડાવો રે ખાય છે. બળકને મુશ્કેલી પડે કે ભૂમ
 લાગે લારે રહે છે લારે રેનાં માતાપિતા રેની પાસે
 દોડી જઈ બેની છજી પૂર્ણ કરે છે. પણ આ બળકને છોડી
 દીધા પછી રેનાં માતાપિતા રેની અધર લેવા રેની પાસે
 જરો ખરાં ?

પહોંચ અને નુંગલ સાથે રેની મૈક્રો છે. એકલતા રેનું
 જીવન છે એવા આ કુદુર્યો આજે નર્મદા અંગેજનામાં ઝૂબાણમાં
 જવાનાં હોવાથી શું થરો ? કચાં જઈશું ? વિચારો સાથે
 એક દિવસ એક વર્ષ બરાબર પસાર કરે છે રેનું લાંબા
 સિવાય રહેણું નથી.

નહિવત કરે છે. ગમમાં શિક્ષણું પ્રમાણું નહિવત છે. આજેમ હજિયાનાં બૈન્દુણ વાળકો અસ્થાસ કરતાં માતુમ પડયાં હતાં. બાકી કોઈ અભ્યાસ કરતું નથી. રામાનિક, ધાર્મિક ખર્ચ તો કરવો જ પડતો હોય છે. તેમની આગવી સંસ્કૃતિ છે તેની પાછળ ઇ.૪ ૮૫૧ જેટલો ખર્ચ થયેલો જોવા મળે છે. દવાદાં અને ભગતસ્થૂવા પાછળ કુલ કુટુંબોના ૦.૩ ૮૫૧ ખર્ચ થયેલો જોવા મળ્યો છે એટલે કે ભગતસ્થૂવા પાસે દોચા ધાગા કે મંત્રતંત્ર કરવે છે તેમાં ધરનો જ ખર્ચ કરવાનો હોય છે તેમાં ભરદું, દરે વગેરે જોઈએ તે ધરમાંથી આપી દે છે. નોકરી કરતાં કુટુંબોને જ.અમ.ડી.રી.ના દવા-ખાનાનો લાભ મળે છે. આમ ખર્ચનું પ્રમાણું મોટાખાગે ખાદ્યા-ખોરાકીના અનાજ માટે વધારે કરવામાં આવે છે એટલે કે જીવન ટકાવી રાખવાનું જ મુશ્કેલ છે.

કુલ ખર્ચના ૩૭.૬ ૮૫૧ ખર્ચ ધરનો કરવામાં આવે છે એટલે કે અનાજ, પશુપાલન અને જીડમાંથી જે આવકો થઈ છે તે ધરકપરાશ માટે ઉપયોગ કર્યો છે. તેમ છતાં ૨૦૨૬થી જે ખરીદી કરી છે તે ૬૨.૪ ૮૫૧ છે એટલે કે ધરપૂરતું પણ ઉત્પાદન તેઓ મેળવી શકતા નથી તેથી અન્ય મજૂરી કરી ૨૦૨૭થી લાવી પોતાનું જીવનધોરણ થલાવે છે.

કુદુપણી બ વાળ્યિક ભરેરાશ ખરે દશ્વત્તાનો કોનો (૩ પિંચામા)

ପ୍ରମାଣ କରିବାକୁ ଅନେକ ଶାକ-ଖର୍ଚ୍ଛାକୁ ଆଜିର ଦିନରେ ଏହାରେ ଯାଇଲୁ ଥିଲା ।

વળતર કે મદ્દ મળવાની નથી તે નિશ્ચયત છે. વળી જેમના
નામ પર જમીન છે તે પણ ઓછી છે અથવા જે કંઈ વળતર
મળવાનું છે તે એક વ્યક્તિને મળવાનું છે. અહારની જમીનો
તેમને કેમની પારો છે તેટલા જે પ્રમાણમાં જમીન મળવાની
નથી લારે જેમના નામે જમીન કે કંઈ મિલકત નથી તેમને
પોતાના ધર સિવાય કોઈ પણ જમીનની આકારણી થઈ
જાકે જેમ નથી તો તેમના છાપરાના ધરની આકારણી
કેટલી થશે? કેટલું વળતર મળશે? કેટલો ધરસારો કપાસે
કેટલો ખસેડવાનો ખર્ચ, કપાશે અને કેટલો વયત રહેશે કે
જેનાથી તે પોતાનું રાખેતા મુજબનું છુફનદ્યોરણ થલાવી શકે
અથવા બીજું જગ્યાએ સ્થાની થઈ જાકે. બીજું એ પણ ચોકચું
છે કે આ ટિંડિવાલી પોતાના હક્ક મેળવવા માટે કેટલો જાગૃત
છે તેથો આપણે જાણું છીએ કે ભૂખે બેસો રહે પણ અપરિચિત
વ્યક્તિ જોડે, અપરિચિત ઓછિસમાં કે અપરિચિત
વિસ્તારમાં પોતાનો અખાજ ઉઠાવતો નથી.

આ વધી બાળતોને ધ્યાનમાં રાખી તેને કંઈ પણ
પ્રકારની મદ્દ કરવામાં આવે કે જેમ નાના બાળકનો
ખ્યાલ તેનાં માતાપિતા રહે છે. બળકને કોઈ પણ
પ્રકારનો ખ્યાલ હોતો નથી કે મારે શું કરવાનું છે તેને
જ્યાં લઈ જાવ લાં જાય છે, જ્યાં બેસાડો લાં બેસે છે
અને જે ખવડાવો તે ખાય છે. બળકને મુશ્કેલી પડે કે ભૂખ
લાગે લારે રહે છે લારે તેનાં માતાપિતા તેની ખર્ચ કેવા તેની પાસે
જરો અરાં?

પહાડ અને જંગલ સાથે જેની ઐક્રી છે. એકલતા જેનું
હવન છે એવા આ કુદુંબો આને નર્મદા બોજાનામાં દૂધાણુમાં
જવાનાં હોવાથી શું થશે? કયાં જઈશું? વિચારો સાથે
એક ટિંડિવસ એક વર્ષ બરાબર પણ કરે છે તેનું લાંબા
સિવાય રહેતું નથી.

જમીન ધરાવતાં કુટુંબો દર્શાવતો કોઠો

જાતિ	કુલ	જમીન કુટુંબો	જમીન વગરના	જમીનના વાળાં	કુલ
૨૧૭૯૮	૪૪	૧૬	૨૮	૪૪	
		36%	64%	100%	
ભીલ	૪૬	૧૭	૨૨	૪૬	
		35%	64%	100%	
કુલ	૮૦	૩૩	૫૭	૮૦	
		35%	64%	100%	

ઉપરોક્ત કોઠો જોતાં ખ્યાલ આવે છે કે તપાસેલ
૪૪ ૨૧૭૯૮ કુટુંબોમાંથી ૨૮ કુટુંબો એટલે કે 64% કુટુંબો
પણે જમીનો હતી જ્યારે ૩૬ ૮૫૯ પણે જમીનો નામ
પર ન હતી. તે જ રીતે ભીલ જાતિના ૪૬ કુટુંબોમાંથી
પણું ૬૪ ૮૯૯ કુટુંબો પણે જમીનો નામ પર હતી જ્યારે
૩૬ ૮૯૯ કુટુંબો પણે નામ પર જમીન ન હતી. આમ
તપાસેલ ૮૦ કુટુંબોમાંથી ૬૪ ૮૯૯ જમીનવળા અને ૩૬ ૮૯૯
જમીન વગરનાં કુટુંબો જોવા મળ્યાં હત્યાં.

તપાસેલ ૮૦ કુટુંબોમાં ૬૪ ૮૯૯ જમીનવળા
કુટુંબો હતા લેમની પણે કેટલી જમીનો હતી તે જોતાં
જમીનના પમાણ અંગેનો ખ્યાલ આવશે. નીચેના કોઠામાં
જમીનનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે તે વિગતે જોઈયું.

20	50	60	70	80	90	100	110	120	130	140	150	160	170	180	190	200	210	220	230	240	250	260	270	280	290	300	310	320	330
500.00	90.00	92.00	94.00	96.00	98.00	100.00	102.00	104.00	106.00	108.00	110.00	112.00	114.00	116.00	118.00	120.00	122.00	124.00	126.00	128.00	130.00	132.00	134.00	136.00	138.00	140.00	142.00	144.00	146.00
200.00	40.00	42.00	44.00	46.00	48.00	50.00	52.00	54.00	56.00	58.00	60.00	62.00	64.00	66.00	68.00	70.00	72.00	74.00	76.00	78.00	80.00	82.00	84.00	86.00	88.00	90.00	92.00	94.00	96.00
100.00	20.00	22.00	24.00	26.00	28.00	30.00	32.00	34.00	36.00	38.00	40.00	42.00	44.00	46.00	48.00	50.00	52.00	54.00	56.00	58.00	60.00	62.00	64.00	66.00	68.00	70.00	72.00	74.00	76.00
50.00	10.00	12.00	14.00	16.00	18.00	20.00	22.00	24.00	26.00	28.00	30.00	32.00	34.00	36.00	38.00	40.00	42.00	44.00	46.00	48.00	50.00	52.00	54.00	56.00	58.00	60.00	62.00	64.00	66.00

કોઠો જોતાં ૩૫૭૮ થાય છે કે તપાસેલ ૨૦ કુદુંબો-
માંથી ૫૭ * કુદુંબો જમીન ધરાવતા હતા એટલે કે કુલ
કુદુંબોના ૬૩.૩ ૮૫૧ કુદુંબો જમીન ધરાવે છે. ૦૧૧ થી ૧
જમીન ધરાવતા ૧૦ કુદુંબો હતાં કે જમીન ધરાવતા
કુદુંબોના ૧૭.૬ ૮૫૧ હતાં. તે જ રીતે ૧૧૨થી ૨ એકર
જમીન ધરાવતાં ૨૧ કુદુંબો હતાં કે ૭૬.૮ ૮૫૧ થાય છે.
આમ કુલ જમીન ધરાવતાં કુદુંબોમાં વધારેમાં વધારે
૧૧૨થી ૨ એકર જમીન ધરાવતાં કુદુંબો જોવા મળયાં હતાં.
જ્યારે ૨૧ થી ૩ એકર જમીન ધરાવતાં ૧૬.૨ ૮૫૧,
૩૧ થી ૫ એકર જમીન ધરાવતાં ૮.૮ ૮૫૧, ૫૧૨થી ૬
એકર જમીન ધરાવતાં ૮.૮ ૮૫૧ અને ૬૧ થી ૮ એકર જમીન
ધરાવતાં ૮.૮ ૮૫૧ કુદુંબો જોવા મળયાં હતાં. તપાસેલ ૪૪
૨૧૬હાં કુદુંબોમાંથી ૨૮ કુદુંબો જમીન ધરાવતાં હતાં નેમાં
વધુ ૧૧૨થી ૨ એકર જમીન ધરાવતાં કુદુંબો
હતાં જ્યારે ૦૧૨થી ૧ એકર જમીન ધરાવતાં ૧૪.૨ ૮૫૧
૨૧ થી ૩ એકર ૧૦.૭ ૮૫૧, ૩થી ૭ ધરાવતાં ૧૦.૭
૮૫૧, ૫૧૨થી ૬ ૧૭.૬ ૮૫૧ અને ૬૧થી ૮ ધરાવતાં
૧૦.૭ ૮૫૧ કુદુંબો હતાં. તે જ રીતે લીલ જાતિનાં વમાસેલ
૪૬ કુદુંબોમાંથી ૨૮ કુદુંબો જમીન ધરાવતાં હતાં કે ૬૩%
થાય છે. લીલ જાતિનાં કુદુંબો પાસે પણ ૧૧૨થી ૨ એકરમાં
વધારે કુદુંબોનો સર્વાખેચ થયેલ જોવા મળયો હતો. ઓછામાં
ઓછા ૩૧ થી ૫ અને ૬૧ થી ૮ એકર જમીન ધરાવતાં કુદુંબો
જોવા મળયાં હતાં નેંનું પ્રમાણ ૬.૬ ૮૫૧ હતું. જ્યારે ૦૧૨થી
૧ એકર જમીન ધરાવતાં ૨૦.૭ ૮૫૧ કુદુંબો જોવા મળયાં
હતાં. ઉપરોક્ત કોષ્ટો જોતાં ૩૫૭૮ ખ્યાલ આવે છે કે
મુશ્કુલુમાં વધુ જમીન ધરાવતાં કુદુંબો પાસે ૬૧ થી ૮ એકરથી
જમીન વધારે નથી. જમીનનું પ્રમાણ ધાર્યું જ ઓછું કહી શકાય
તેવી પરિચ્છાતિ જોવા માટી હતી.

1916 ମୁଣ୍ଡରେ କାହିଁ ଏହି ପାତା ଦେଖିଲା ଏବଂ ଏହିପାତାରେ କାହିଁ ଏହି ପାତା ଦେଖିଲା

38° X	900,000
39° X	900,000
40° X	900,000
41° X	900,000
42° X	900,000
43° X	900,000
44° X	900,000
45° X	900,000
46° X	900,000
47° X	900,000
48° X	900,000
49° X	900,000
50° X	900,000
51° X	900,000
52° X	900,000
53° X	900,000
54° X	900,000
55° X	900,000
56° X	900,000
57° X	900,000
58° X	900,000
59° X	900,000
60° X	900,000
61° X	900,000
62° X	900,000
63° X	900,000
64° X	900,000
65° X	900,000
66° X	900,000
67° X	900,000
68° X	900,000
69° X	900,000
70° X	900,000
71° X	900,000
72° X	900,000
73° X	900,000
74° X	900,000
75° X	900,000
76° X	900,000
77° X	900,000
78° X	900,000
79° X	900,000
80° X	900,000
81° X	900,000
82° X	900,000
83° X	900,000
84° X	900,000
85° X	900,000
86° X	900,000
87° X	900,000
88° X	900,000
89° X	900,000
90° X	900,000

કોઠામાં જમીનના પ્રમાણ અંગે જોતાં મોટાખાગતાં
કુદુંબો પાસે જમીનો ધણા ઓછા પ્રમાણમાં જોવા મળી.
આગળ જોથું કેમ કેટલાંક જમીનવાળાં અને જમીન વગરના
બને કુદુંબો કેમાં અન્ય જમીનો ખેડે છે કેવી કે જંગલની,
પંચાયતની; ખરાવાની વગરે. આ જમીનો કેઓ વખતોથી
ખેડતા હોવા છતાં તેમના નામે નથી અથવા તેમની પાસે
કોઈ પુરાવા કે પહોંચ નથી કેનું પ્રમાણ નિશેના કોઠા
દવારા જોઈએ તો. તપાસેલ ૪૦ કુદુંબોમાંથી પછે કુદુંબો
શેવાં હતાં કે કેઓ અન્ય જમીનો ખેડતા હતા કેનું કુલ
પ્રમાણ ઈ. ૬ ૮૭૮ હતું. જંગલની કે પંચાયતની જમીનનું
પ્રમાણ જોઈએ તો ૨૦૬ એકર ૨૪ ગુંઠાનું જેટલું થાય છે
જેટલે કે અન્ય જમીન ખેડતાર કુદુંબો સરેરાસ ૧૧૮ થી ૨
એકર જેટલી જમીનો વરસોથી ખેડે છે. ને જમીનો તેમના
નામ પર નથી ત્યાં જંગલ પે નથી છતાં કે જમીનો જંગલમાં
કે ખરાવામાં ગણવામાં આવે છે.

તપાસેલ ૪૪ ૨૧૬વા કુદુંબોમાંથી ૨૮ કુદુંબો એટલે કે
૪૩.૭ ૮૫૧ કુદુંબો જંગલની જમીનો ખેડે છે કેનું પ્રમાણ ૮૨
એકર ૦૪ ગુંઠા જેટલું થાય છે. ને કુદુંબદી ૩ એકર જેટલી
જમીન ખેડે છે. અન્ય જમીનો ખેડતા કુલ કુદુંબોમાં ૨૨
કુદુંબો જંગલની અને ૬ કુદુંબો પંચાયતની કે ખરાવાની
જમીનો ખેડતા જોવા મળ્યા હતા. એટલે કે જંગલની જમીન
ખેડતા કુલ કુદુંબોના ૪૬.૮ ૮૫૧ જમીનો ૨૧૬વાકોણી
ખેડતા હતા જથારે પંચાયતની જમીન ૬ કુદુંબો ખેડતા હતા
કે બને જાતિના ૫૦ ૮૫૧ હતા.

તે જ રીતે લીલ જાતિના ૪૬ કુદુંબોમાંથી ૩૧
કુદુંબો અન્ય જમીન ખેડતા હતા કે કુલ લીલ કુદુંબોના
૬૭.૩ ૮૫૧ હતા કેબો કુલ જમીન ૧૨૪ એકર ૨૦ ગુંઠા
જેટલી જમીન ખેડતા હતા કે કુદુંબદી ૪ એકર જેટલી ૫
જમીનો ખેડતા જોવા મળ્યા હતા. કેમાં ૨૫ કુદુંબો
જંગલની જમીનો અને ૬ કુદુંબો પંચાયતની કે ખરાવાની

અમીનો ઐડતા જોવા મળયા છુટ. જંગલની અમીન ઐડતાં
કુલ કુદુંખોના પડ. એ હકા કુદુંખો લિલ જાતિના ઐડતા
જોવા મળયા છુટ.

ઉપરોક્ત કોઠો જોતાં સ્પેશ્ટ ખથાલ આવે છે કે
પોતાના વામ પરની અમીનો કરતાં પણ જંગલની અને અન્ય
પંચાયતની કે ખરાખાની અમીનો ઐડતાં કુદુંખો પાસે સરેરસા
વધારે અમીનો ઐડતા જોવા મળયા છુટ. આ જંગલની કે
પંચાયતની અમીનો તેથો વખરોથી જ્યાં જંગલ ન હોય કે
હુંગરના ફોળાવોવાની કે નદીના કોતરવાળી અમીનોમાં
એવી કરતા છુટ. જેનાથી તેમનું જવનધોરણ ચાલતું હતું.
પણ પાલન થઈ રહ્કતું હતું.

અન્ય અમીનોની વાત કરીએ ત્યારે તપાસેલ બંધા જ
કુદુંખો હૂથાણુમાં જાય છે. ગામના છર ખાતેદારોની
અમીનો હૂથાણુમાં જાય છે જ્યારે જેઓની પાસે અમીનો છે
પણ ખાતાં નથી કે ઉપર જોયું તેમ જેઓ જંગલની કે પંચાયત
ખરાખાની અમીનોમાં વખરોથી એવી કરે છે તેમના બળતર
માટેનો કોઈ ઉપાય ખરો ? જાણવા મળયું તે પ્રમાણે તેવી
અમીનોને રેખો બેઠે છે તે રીતે રેઝ્યુલાઇઝ કરવી પડે.
રેઝ્યુલાઇઝ ન થાય ત્યાં સુધી કંઈ બળતર મળે નહિ. આ
અમીનો રેઝ્યુલાઇઝ આદિવાસી કથાં કરશે ? કદમ્બાય આગે-
વાતો દૂવારા રેઝ્યુલાઇઝ કરવામાં આવશે તો તેની અમીનો
માપણીનો પ્રશ્ન ઉભો થશે. અમીન મપાસે ત્યારે તે કેટલા
વર્ષથી એવી કરે છે તેનો પ્રશ્ન ઉભો થશે. ત્યારથી એ
આદિવાસી કુદુંખ જેટલા વર્ષથી આવી અનધિકૃત અમીનો
બેઠે છે તેથો પાસેથી અમીનવેરો જેટલાં વર્ષથી અમીન બેઠે છે
જેટલા વર્ષ સુધીનો વસૂલ કરવામાં આવશે. આ વસૂલ કરેલા
કેરો પણી આવી પણ રવાળી બોછું ઉત્પાદનની ક્ષમતા
ધરાવતી અમીનની આકારણી કેટલી કરવામાં આવશે ?
ત્યારથી તેનો કેરો (દેખ) લરતાં તેને શું મળશે તે
વિધારવા જેવો મુદ્દો છે.

દૂષાણમાં જતા હંદુ ગામનો મુખ્ય વ્યવસાય હેતી,
પશુપાલનનો છે. ક્રીડ કુટુંબ પશુઓ પાળે છે. પશુઓ પણ-
વાતું મુખ્ય કારણ એ પણ છે કે જંગલના કારણે ત્યાં ધારા-
ચારો મળી રહે છે. હેતી અને પશુને અલગ પાડી શકાય તેમ
નથી. હેતી કરે લે પશુપાલન કરે જ કારણ કે હેતી બજાદ
લગર થઈ શકે નહિ. કારણ કે આ દિવાસીની હેતી એ કોઈ
સપાટ મેદાનમાં કે એને હેતરમાં નથી કે ત્યાં અન્ય સાધનો
ઉપયોગમાં લઈ શકાય. ત્યાં તો બજાદ અને પાડાનો ઉપયોગ
કરી હેતી થઈ શકે છે. જેની પાસે બજાદ ન હોય તે હાથથી
ખોદીને પણ હેતી કરે છે. બીજું મહાત્વનું કારણ પશુપાલન
માટે બે છે કે આ દિવાસી પાસે કોઈ પણ મુકારનું બેનું સાધન
નથી કે જેમાંથી તેને રોકડ આવક મળે કે જેનાથી તેઓ
વ્યવહાર ચલાવી શકે. આવા રંજોગોમાં અથવા કૌદુર્યિક
ખર્ચમાં સામાજિક ખર્ચમાં કે અન્ય ધાર્મિક ખર્ચ કરવાનો આવી
પડે ત્યારે લે પોતાના પશુઓનો ઉપયોગ કરે છે. પશુઓને
બદલીમાં આપે છે. હાટમાં કેચી હે છે અથવા તેનું બલિદાન
આપીને પણ તેનું વળતર તે પણ પાસેથી મેળવી લે છે. આ દિ-
વાસી સમાજમાં જોઈએ છી એ તેમ દેવ-દેવી ભગત-સ્તુતો
વારતહેવારના દિવસોમાં અમુક મુકારની વિધિઓ કરવી લે
કર જિયાત હોય છે. આવા કપરા સમયે અથવા તહેવાર
ઉજવવાના સમયે તેના પાળેલાં બકરાં, મરધાંનો ઉપયોગ એ
છૂટથી કરી શકે છે. તેની પાસે પૈસા નહિ હષેવાથી કેચાતું
કે અન્ય વ્યવસ્થા કરી શકતો નથી ત્યારે લે પાળેલા પશુઓ-
માંથી બેકાદનો લોગ આપી વિધિ પતનાવવામાં આવે છે. આ
રીતે પણ પશુપાલન આ દિવાસીઓ માટે મહાત્વનો વ્યવસાય
છે. જ્યારે લગ્ન જેવા પ્રસંગે દાપું આપવા માટે બજાદ કે
ગાય કેચી તેના પૈસા મેળવી લેનું દાપું પૂરું કરવામાં આવે છે.
કોઈની પાસેથી ઉછીના પૈસા કે વસ્તુ લાભ્યા હોય તેના
બદલામાં પણ આપીને પણ પોતાનું કરજ ઉતારે છે. આમ
પશુપાલન એ આ દિવાસીનો મહાત્વનો ધંધો છે. નીચેના કોઠા
પરથી પશુઓનું પ્રમાણ જોઈશું.

ઉપરોક્ત પશુઓની સંખ્યા દર્શાવતો કોઠો જોતાં
 તપાસેલ ૬૦ કુદુંબો પાસે વધારેમાં વધારે બકરાની સંખ્યા
 જોવા મળી હતી, જેની સંખ્યા ૫૫૪ની હતી જે કુદુંબદી ૬
 ડ બકરાની થાય. આમ કુદુંબદી ૬ છ બકરાનું પ્રમાણ એ
 ધણું સારું કહી રહાથ. ૧૨૧૦૧૬ મરધાની સંખ્યા જોઈએ
 તો ૩૮૫ની જોવા મળી હતી. મરધાં એ પ્રકારનું પક્ષી છે
 કે જેની ઉત્પત્તિ પણ ઝડપી થાય છે અને નાશ પણ ઝડપી
 થાય છે એટલે કે જી મરધીને ધણું જયાં હોય તો તેમણી
 કેટલાંક મરી જાય, કેટલાંક વિલાદાં, કૂદરાં મારી નાણી,
 રોગચાળો ફાટી નીકળે વગેરેના કારણે તેનો વિનાશ પણ
 ઝડપી થાય છે. સાથે સાથે તેનું બળતર પણ સારું મળે છે.
 અત્યારે એક મરધીની ૨૫ ઇપિયા જેટલો કિંમત મળે છે.
 તેનાં ઈંદ્રાં વેચે તો ૨૫ થી ૩૦ પેસા એક ઈંડાના મળે. આમ
 મરધી બળતર સારું આપે છે. આ દિવાસો અને મરધાને પણ
 છૂટાં પાઠકાં બોંધ નથી. મરધું તેમનું સસ્તું અને સારું પ્રાણી
 છે જે ધરાણિંગને રહે અને આત્મક સાથે પોતાના ધાર્યાયદા
 કાખમાં આવે છે જેમ કે, તહેવારમાં ભગત-શૂવામાં, લગતમાં,
 બારતહેવારે, મહેમાન આવે ત્યારે, ઘર બાંધતાં, એતી
 કરતાં, કાપણી કરતાં, અનાજ લેતાં વગેરે કાખોમાં મરધાનું
 પાલિદાન આપી ઝુઝાંઝાં શરાબાત કરવામાં આવે છે. તેથી
 મરધું પણ અલિ મહત્વનું પક્ષી છે. તેનું પ્રમાણ ઉટ્પન્ન જોવા
 મળયું હતું. એ સરેરાસ કુદુંબદી ૬ ૪ મરધાની સંખ્યા જોવા
 મળી હતી.

તપાસેલ ૬૦ કુદુંબોમાં ૨૭૬ બળદની સંખ્યા જોવા મળી
 હતી. અંગળ જોયું તેમ બળદ એ જેતી માટે ધણું જ અહેતું
 પણ છે તેના સિવાય એતી કરી રહાથ હેઠળી. લોગોલ્લિક
 પરિ સ્થિતિ નથી. બળદની સંખ્યા કુદુંબદી ૩ ની જોવા
 મળી હતી કે જોતાં આ વિસ્તારના ૨૧૬વા અને ભીલોમાં
 પણ પાલનનું પ્રમાણ બધારે લગે છે. બળદો પણ સારા એવા
 પ્રમાણમાં ૨ ખાતા થયા છે. બળદની સંખ્યા જોયો બાદ
 ગાયની સંખ્યા જોઈએ તો ૧૮૪ની હતી. એટલે કે ગાયો પણ

તપાસેલ કુદુંબની ૬ જોવા મળી. બળદ માટે ગાય એ અનિવાર્ય છે. ગાય ન હોય તો બળદ મેળવી શકાય નહિ. પોતાની પાસે પૈસા નથી કે જેથી તે બળદ ખરીદી શકે. મોટાભાગના બળદો એ પોતાની પાણેલ ગાયના જ હોય છે. લ્યારબાદ જોઈએ તો લેસની સંખ્યા ૫૩ ૨૭ની જોવા મળી હતી. જેથોની આર્થિક સ્થિતિ સારી છે તેવા કુદુંબો લેસનો પણ પાણે છે. લેસના દૂધનું વેચાણ થઈ શકે તેવા દુનિયામાં એટલે કે મંડિર દુનિયું, જરણા દુનિયું, લુ. એમ. ડી. સી. ના સાહુમાં લગેરે જગ્યાએ આવે છે. બાકીનું ધરે જ ખાટ જાય છે. ગાયનું દૂધ મોટાભાગના ખૂદતો છાઠવા નથી. ગાય હોય એટલે વાઈર૭૮, વાઈર૭૯ સ્ટ્રેન્ઝ હોય જ તેની સંખ્યા ૫૩ અનુષ્ઠાની ૭૮ અને ૪૬ની જોવા મળી હતી જે ધર્યું જ સારી કણી શકાય. અન્ય પાડા અને પાડીની સંખ્યામાં ૧૪ પણ અનુષ્ઠાની ૭૮ અને ૪૬ની જોવા મળ્યા હોય. એકદરે તપાસેલ ૨૦ કુદુંબો પાસે પણ ધર્યાનની સંખ્યા ૩૧૨૮ પ્રમાણમાં જોવા મળી હતી. તપાસમાં લીધેલ ૪૪ રાઠવા કુદુંબો અને ૪૬ લીલ કુદુંબોમાં પણ પાલનની દૃજિષ્ટાંત્રી કોઈ મોટો લક્ષાવત જોવા મળ્યો નથી. એટલે કે પણ પાલન બન્ને જાતિમાં સારો પ્રમાણમાં કણી શકાય તેવી જોવા મળી છે.

કોઠો જોતો ૪૪ રાઠવા કુદુંબો પાસે ગાયની સંખ્યા ૫૦.૬ ૮૮૨ જથારે લીલ પાસે ૪૬.૬ ૮૮૨ તે જ રીતે લેસનું પ્રમાણ ૫૧.૬ ૮૮૨ રાઠવા પાસે જથારે લીલ પાસે ૪૮.૧ ૮૮૨ તે જ રીતે ખળદ ૨૧૬વા પાસે ૪૭.૬ ૮૮૨ જથારે લીલ કુદુંબો પાસે ૫૨.૧ ૮૮૨ જોવા મળ્યું હતું. વાઈર૭૮ રાઠવા પાસે ૪૭.૪ ૮૮૨ અને લીલ પાસે ૫૨.૬ ૮૮૨ જોવા મળ્યા હતા. બકરા રાઠવાકોણી કુદુંબો પાસે કુલ બકરાની સંખ્યાના ૫૩.૧ ૮૮૨ જથારે લીલ પાસે ૪૬.૬ ૮૮૨ તું પ્રમાણ જોવા મળ્યો છે. તે જ રીતે મરધામાં કુલ મરધાના ૬૩.૧ ૮૮૨ રાઠવા પાસે જથારે લીલો પાસે ૩૬.૬ ૮૮૨ તું પ્રમાણ જોવા મળ્યું હતું. મરધાનું પ્રમાણ રાઠવા કરતાં લીલોમાં ઓછું

જોવા મળ્યું હતું જ્યારે ૨૧૬વા કરતાં ભીલોમાં પાડાતું
પ્રમાણ વધારે જોવા મળ્યું હતું.

પશુ માટેની છાપરી દશાવિતો કોઠો

જાતિ	કુલ	છ	ના	શરીર	કુલ
	કુટુંબો			અલગ	
૨૧૬વા	૪૪	૪૨	૨	-	૪૪
		૨૫.૪	૪.૬		૧૦૦.૦૦
શીલ	૪૬	૪૪	૨	-	૪૬
		૨૫.૭	૪.૩		૧૦૦.૦૦
કુલ	૬૦	૮૬	૪		૬૦
		૨૫.૬	૪.૪		૧૦૦.૦૦

ઉપરોક્ત કોઠા દ્વારા તપાસેલ ૬૦ કુટુંબોમાં પશુ
માટેની છાપરી છે કે નથી કે ખતાવ્યું છે. કોઠો જોતાં
૩૫૭૮ ખ્યાલ આવે છે કે તપાસેલ ૬૦ કુટુંબોમાંથી ૪૬
કુટુંબો બેટલે કે ૨૫.૬ ૮૬ કુટુંબો પાસે પશુ માટેની છાપરી
હતી. જ્યારે ૪ કુટુંબો જ એવાં હતાં કે જેની પાસે પશુ
માટેની છાપરી જોવા મળી ન હતી. કે કુલ કુટુંબોના
૪.૪ ૮૬તું પ્રમાણ હતું કે ન હિવત કહેવાય. આ કોઠા
પરથી ૩૫૭૮ ખ્યાલ આવે છે કે તપાસેલ ૪૪ ૨૧૬વા કુટુંબો
અને ૪૬ શીલ કુટુંબો મુખ્ય પશુપાલનનો ધંદા કરે છે અથવા
લેમના જીવનવ્યવહાર પશુઓ સાથે વણુંબેલો છે તે સ્પૃષ્ટ
ખ્યાલ આવે છે. પશુ માટેની છાપરી પણ પોતાના ઘરની
સાથે જ જોવા મળી હતી. પશુ માટેની છાપરી પોતાના
ઘરથી અલગ જોવા મળી ન હતી. કે ઉપરથી ૩૫૭૮ થાથ
છે કે પશુ સાથેના લેમના સંબંધો કેટલા ગાઢ અથવા તેઓ
પશુ સાથે પોતાના જીવનના વ્યવહારો ધારા નજીકીય બણી
થેલા છે.

પશુપાતન કેટલું ઉપયોગી છે કેટલું ઉપયોગી આદિ-
વાસીના જીવનમાં ઝડપ છે. છોટાઉદેપુર તાલુકાના હાંક
ગામમાં માલિકીના ઝડપની સંખ્યા સારા પ્રમાણમાં જોવા
મળી છી. ગાડ એ આ દિવાસીના જીવન સાથે વણાખેલ એક
અંગ છે. આ દિવાસીઓને ઝડપને છૂટો પાડી શકાય નહિ.
આ દિવાસી ઝડપને બોળ્યે છે. ઝડપ આ દિવાસીને બોળ્યે છે.
ઝડપ સાથેના બેના સંબંધો ધાર્યા ઘનિષ્ઠ છે. એટલે જ આ દિ-
વાસી કષોધી જંગલ પરંપરા કરતો આવ્યો છે. આજે પણ તેને
જંગલથી દૂર કરવામાં આવે તો તે ધાર્યો દુઃખી થાય છે. તેને
જંગલ સિવાય રહેવાનું ગમતું નથી. તે અંબે ઝડપને કાપતો
હરે પણ તે ઝડપ સિવાય રહી શકતો નથી તે હકીકત છે.
ઝડપ એ આ દિવાસીનો ખોરાક છે. જ્યારે ચોમાણું નિષ્ઠા
જાય, પાક સૈથાર ન થયો હોય, મજૂરી મળતી ન હોય
ત્યારે આ દિવાસી ઝડપનો બાધારો લે છે. ઝડપ અને દરેક
મોશમમાં કંઈ ને કંઈ આપે છે. તેથી જ તો લે જંગલને
છોડવા તૈથાર નથી. ઝડપાતમાં આ દિવાસીને પોતાનું
જીવન ફેણાય છે. આપણને તે દેખાનું નથી. જંગલનો સાલ-
પાલો કેનો જીવમારસ બની જાય છે. જંગલના વાંસની લે
ભાલુ બનાવે, આંખલીના ફૂલની ભાલુ બનાવે. જંગલનાં ફૂલ-
ફૂલ મનફાળે ત્યારે તોડી લાવી ખાડ શકે, ગમે ત્યારે ગમે
લાં હરી છરી શકે. સૂકા લાકડાં તેને કંઈમાં હુંસ આપે
તે આ દિવાસીને જંગલથી છૂટો પાડવામાં આવે ત્યારે તેને
કેટલું દુઃખ થાય તે તો કલ્પનું જ રહ્યું. આ ઉપરાંત કેટલાંક
ઝડપ એવાં પણ છે કે કેને ફળફૂલ, બી વગેરે ખાડ શકાય.
તેના ઉપયોગ ખોરાકમાં કરી શકાય તેવાં ઝડપને આ દિ-
વાસી ખૂબ જતનથી ઉદ્દેશે છે. કેની રખેવાળી કરે છે. તેવાં
ઝડપાં મહુડો, અંખો, તાડ, પોરડો, ચારોડી, ઉઘર
વગેરે છે કેને આ દિવાસી ખૂબ જતનથી ઉદ્દેશે છે. કેની વિગતે
નીચેના છોટા ઉપરથી જોઈશું. પણ તે પહેલાં ઉપરોક્ત ઝડપ
આ દિવાસીને કઈ રીતે ઉપયોગી છે કેની વિગત જોઈયે તો
મહુડો ફળાડી ઝડપ છે. મહુડાનાં ફૂલ ફાગણ માસમાં આવે છે

દુઃખાશભાસ આ દિવાસી માટે મસ્તી, આત્મંદ, નાચવા-
ગાવાનો માસ. બેવા સમયે આ કૂલ બેની મજામાં ઓર
વધારો કરે છે. લેને આ રીક મદ્દ પણ કરે છે. મહુડાનાં
કૂલનો દાઢ નીકળો છે. દાઢ આ દિવાસી પીવામાં અને
બેથવામાં ઉપયોગમાં લે છે. આ ઉપરાંત લેનાં કૂલ બે
ગાવામાં પણ ઉપગોગમાં લઈ રાકાય છે. તેને સૂકળી ખાડીને
લેમાં લોટ જેવી સામાન્ય વસ્તુ નાંખવાથી તે ધણું જ
સ્વાદિષ્ટ અને એક વાર ખાવાથી આપો દિવસ ભૂખ લાગે
નહિ, અનાજની પણ જરૂર પડે નહિ કાંઈ તે પોષણ પણ
બેટાં જ છે. લેને બેથવાથી ૨૦ થી ૨૫ ઇપિયા ૨૦ કિલોનો
ભાવ મળે છે. ઓછામાં બોટો એક મોટો મહુડો ૨૦૦ થી
૩૦૦ ઇપિયાની આવક મહુડાના કૂલમાંથી અપે છે. કૂલ પૂર્ણ
થાય બેટલે લેની ડોળી આવે છે. આ ડોળો પણ મહુડાના
કૂલ કરતાં વધારે ભાવે જાય છે. લેને પીલવાથી લેમાંથી
ડોળીનું તેલ મળે છે. આ તેલ ખોરાક તરીકે ઉપયોગમાં લઈ
જીકાય છે લેને આપણે ડોળિયું કહીએ છીએ. આ ડોળિયું લે
ડોળીમાંથી મળે છે. આ દિવાસી કોંગતેલ કે અન્ય તેલ લાવી
જાકવા શકીત ઘરાલવાં નથી જ્યારે કે ડોળીમાંથી ડોળિયું
પીલવાથી કે ખાવામાં ઉપયોગ કરે છે. લેનાં પણ અંદરો કે
ડોળી ઉરની છાલ આવે છે તે ધણી જ સ્વાદિષ્ટ અને મીઠી
હોય છે તે ખાકે લ્યારે માણસ પણ લેને ખાઈ શકે છે અને
ખકરાં, ગાય, બળાં પણ ખાઈ શકે છે; લેથી પણ ઉપયોગમાં
પણ આવે છે. આમ મહુડો બે ધણો જ ઉપયોગી છે. આ
ઉપરાંત કે દાના ઉપયોગમાં પણ આવે છે. શરીરે કળવર
કે વાયું હોય લ્યારે મહુડાના કૂલ બાહીને બાંધવાથી જાંદું
થાય છે. આવી ખોરાકયુક્ત અંદરીને મહુડો પૂરી પાડે
છે. આ ઉપરાંત પણ આ દિવાસીની નજરે ધણું બધા ગુણો
છે લેણું હું માતું છું.

ત્યારથાં અંબાની વાત કરીએ તો અંબો બે તો
અમૃત સમાન કેરી આપનાર ઝડપ છે. અનાથી આપણે બધા
પરિચિત છીએ. આમ છતાં ગરમીના દિવસોમાં જ્યારે
લોકો કેરૂનું કયુંબર કરે છે લ્યારે. આ દિવાસી કાશી કેરીને

પણ્ણર પર વાડી તેમાં મરયું ભીઠું નથી તેનો ઉપયોગ રોટલા સાથે ખાવામાં કરે છે તેથી શકાની કે અન્ય જરૂર પડતી નથી. કાળી કેરી પાકે ત્યારે ખાવામાં ઉપયોગ થાય છે. તેને બેચવાથી પણ સારી આવક મેળવી શકાય છે. આથી અંધો પણ ધણ્ણો જ મહત્વનો છે. તેથી સરકારે તેને કાપવા પર પ્રતિષ્ણંધ મૂક્યો છે કે કે હજુ ખાઈ શકાય તેવાં આડને કાપવાં નાભિ.

એ જ રીતે તાડ પણ અતિ મહત્વનું આડ છે. તાડને તૈથાર થતાં ૨૫ વર્ષ લાગે છે. તાડ ખૂબ ધીમી ગતિથે તૈથાર થાય છે. દેખાવમાં નાનુ હોથ ત્યારે તાડી આપે છે પણ તેને તાડ આવતાં ઓછામાં ઓછાં ૨૫ વર્ષ લાગે છે. એક તાડ દિવસની ૮ થી ૧૦ કિલો તાડી આપેલી છે. તાડીની એક બોટલનો એક રૂપિયો મળે છે. એક બોટલમાં એક કિલો ગણ્ણીએ તો પણ દિવસના ૮ થી ૧૦ રૂપિયાની આવક તાડ આપે છે. તાડી હાગણ અને ચૈત્ર માસ એમ બે માસ વધારે આપે છે.

તાડની બે જાત આવે છે. વાંચિયા અને સૂચિ. વાંચિયા ૧ વર્ષમાં બે માસ તાડી આપે છે. બે માસ તાડી આપ્યા ૧ વર્ષમાં પછી નીગાલનો પાક આપે તે બે માસ ચાલે. તાડ-હળી ૨૦થે તો તાડી માત્રાતી નથી, પણ તેનાં હજુ મળે છે. તાડહળીના હજુને બેચવામાં તેમ જ ખાવામાં ઉપયોગ કરી શકાય છે. તાડહળીના હજુ હાગણ માસમાં આવે છે. કુલ ૧ વર્ષમાં છ માસ તાડીનો પાક લઈ શકાય છે. તાડનું આડ ૧૫૦થી ૨૫૦ હૂટ જેટનું ઉંઘું થાય છે. તેના ઉપર માટ્લાં બાંધી એક વાટ બનાવી રેમાં તાડી હેળી કરવામાં આવે છે કે જરૂર આવે તેનાં હજુ લાગવાનાં હોય કે જરૂર આવે કાપી રેમાંથી ટપકતો રસ એકઠો કરવામાં આવે છે તેને તાડી કહેવામાં આવે છે. દિવસમાં વ્યાખ્યાતાર તાડી મેળવી શકાય છે. જેટલીવાર તાડી મેળવે તેટલીવાર કેની વાટને સાછુ કરવામાં આવે છે. આમ તાડ પણ આંધીક રીતે

ધર્ષણું જ ઉપયોગી અઠડ છે. વળી તેને વૈચારિક થવામાં ને સમય લાગે છે કે ધર્ષણો જ વધારે છે. તેથી તેમને બીજી જીવાને ખરોડવામાં આવે લ્યારે તેમને ૨૫ વર્ષ સુધીની તપાસ્યાં જતી કરવી પડે છે. ૨૫ વર્ષોનું અઠડ વૈચારિક અભ્યાસ થાથી લ્યાં સુધીની આવક પણ જતી કરવી પડે છે. તેના વદ્વામાં તેમને લાઇનું કે અંકુંઝ શું વળતર મળવાનું છે તેનું કશું જ નિરીશ્વર નથી.

બોરડી અને શારોળી :

બોરડી એ પ્રકારની જોવામાં આવી. મોટાં બોર અને નાનાં બોર આવે લેવી. નાનાં બોર લોકો ખાઈ જાય છે જ્યારે મોટાં બોરનો વેપાર કરી રહ્યા છે. બોરડી એ-લાણ વર્ષો બોર આપતી થઈ જાય છે. તેનાં ખટમીઠાં બોર ધરણાં જ સ્વાદિષ્ટ લાગે છે. નાનાં બોર પણ બેઠઠાં કરી હાટમાં કે અન્ય અંદરોઅંદર વેચવામાં આવે છે. તપાસેલ હાંદ ગામભાં બોરડીની સેંચ્યા શારી જોવા મળી જતી. હાંદ ગામના પટેલ પાસે ૪ થી ૫ બોરડીનાં મોટાં અઠડ હતાં જેમણી તેમને દ્રાર વર્ષો ૨૦૦થી ૩૦૦ ઇપિયા સુધીની આવક થાય છે અને લોકો તથા ધરનાં બાળકો ખાય તે વધારાનાં. તે જ રીતે કેટલાંક કુટુંબો પાસે શારોળીનાં અઠડ પણ જોવા મળયાં હતાં. શારોળીનાં અઠડ મજૂડાનાં અઠડ જેવાં હોય છે. તેને ફૂલનાં ગૂમણાં આવે છે. તેનાં ફૂલ આવે છે અને તે ફૂલ તોડી જેમણી શારોળી મેળવવામાં આવે છે. આડિવાસીઓ શારોળી વીણુવા જાય છે. ખાત્રદેશની અને છોટા-ઉદ્દેપુરની શારોળી વખતું હોય છે. શારોળી તૈયાર થાય લ્યારે તેને હાટમાં કેચે તેના વદ્વામાં હલકું ધાન્ય કે ચોખાની કણુકી મેળવવામાં આવે છે. આમ શારોળીનું અઠડ પણ આ વિસ્તારના આડિવાસીઓ માટે ધરણું જ મહત્વનું ઉપયોગી અઠડ છે.

તે જ રીતે અન્ય અઠડમાં અંખલી, ઊઘ્યર વગેરેનાં અઠડ પણ માલિકીનાં હોય છે. ઊઘ્યરનાં ફૂલ ખાઈ રહ્યા છે. અંખલી પાડે લ્યારે તેનાં છાંતરાં ઉષેડી હાટમાં કે

અજારમાં કેથી દેવામાં આવે છે. એ રોતે મેડે એક ઝાડ
આદિવાસીના જીવતમાં ધર્ષણ જ ઉપયોગી જોવા મળ્યું હતું.
આ ઉપરાંત જંગલની ગૈણા પેદાશ એકઠી કરવાનું કાશ પણ
આદિવાસી બાળકો કરે છે તે એ પણ આપણે આગળ જોઈએ. આમ
આદિવાસી અને જંગલ બંનેને છૂટા પાડી શકાય તેમ નથી.

નીચેનો કોઠો જોતાં સ્વષ્ટ ખ્યાલ આવે છે કે
તપાસેલ છો કુદુંબો પાસે માલીકી ધરાવતાં ઝાડની સંપર્યા
કટલા પ્રમાણમાં જોવા મળી હતી.

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ

અન્યાં અન્યાં અન્યાં અન્યાં અન્યાં અન્યાં

ઉપરોક્ત કોઠો જોવાં સ્પેશ્ટ ખ્યાલ આવે છે કે
તપાસેલ નેતું કુદુંબો પાસે ૧૪૩ મહુડા નાં ઝાડ જોવા મળયાં
હતાં. તે જ રીતે અંબાની સંખ્યા ૧૪૨ની જોવા મળી
હતી. તાણની સંખ્યા ઓઈ જોવા મળી હતી. નેતું કારણ
કે તેને તૈથાર થતાં ઘણાં વર્ષ વાગે છે તેની સંખ્યા ૪૩ની
હતી. જ્યારે બોરડીની સંખ્યા ૧૦, ચારોળી ૧૮ અને અન્ય ૩૫૫
ઝાડ ૩ જોવા મળયાં હતાં. જાતિવાર જોઈએ તો તપાસેલ
૪૪ રાઠવાકોળી કુદુંબો પાસે મહુડાની સંખ્યા ૭૫ જોવા
મળી હતી જે કુલ મહુડાના ઝાડના ૫૨.૪ ટકા, અંબા
પણ જે કુલ અંબાના ઝાડના ૪૧.૬ ટકા, તાણ ૨૨ જે કુલ
વાઢના ૫૧.૧ ટકા, બોરડી ઇ જે કુલ બોરડીના ૬૦ ટકા
ચારોળી ૩૩.૩ ટકા અને અન્ય ૩ ઝાડ જોવા મળયાં હતાં.

તે જ રીતે ભીલ જાતિનાં ૪૬ કુદુંબો પાસે કુલ ઝ
મહુડાનાં ઝાડ ૪૭.૬ ટકા, કુલ અંબા ૫૮.૪ ટકા કુલ
વાઢના ૪૮.૬ ટકા કુલ બોરડીના ૪૦.૦ ટકા, કુલ
ચારોળીના ૬૬.૭ ટકા ઝાડ જોવા મળયાં હતાં. અંબા
અને ચારોળીનાં ઝાડ ભીલ કુદુંબો પાસે રાઠવા કરતાં
વધારે જોવા મળયાં હતાં જ્યારે મહુડા, તાણ, બોરડીનાં
ઝાડ ભીલો કરતાં રાઠવા કુદુંબો પાસે વધારે જોવા
મળયાં હતાં. આમ સરેરાણ કંઈ મોટો તહૃતવત જોવા મળયો
ન હતો. પણ એકદરે ઝાડની સંખ્યા ધૂળ સાંચી જોવા મળી
હતી જે તેમના જીવનમાં ઘણી જ ઉપયોગી અને આધીકન લાભ-
દાયક છે તેમ કણી રાણી અને ગંગા કે ઝાડ સાથેનો તેમનો
વ્યવહાર કેવો છે તે સ્પેશ્ટ જોઈ રાણી છે.

તપાસેલ ૪૦ કુદુંબોમાં ૪૪ રાઠવાકોળી અને ૪૬
ભીલ જાતિનાં કુદુંબોનો મુખ્ય વ્યવસાય ખેતી અને અન્ય
મજૂરી છે. કેટલાક રાઠવા કુદુંબો છે જે નોકરી કરે છે.
ખેતી સાથે પૂરુક એવો ધંધો પણુપાલનનો છે. માલીકીનાં
ઝાડ જે કુદુંબો પાસે જોવા મળયાં છે તેની આવક ખેતી,
પણુપાલન અને ઝાડ સાથે ગણી લેવામાં આવી છે. નોકરી
કરતાં રાઠવા કુદુંબો કેવા મકારની નોકરી કરે છે તે

જોતાં મોટાખાગના બોરાઓપરેટર, મદ્દનિશ, પદ્ધતરની ગાડીઓમાં તથા કારખાનામાં કામ કરતા લેણરો હતો. જી.એમ.ડી.રી.ના કારણે તેમને સરકારી ધારાધોરણ અ પ્રમાણેનો પગાર મળતો હોવાથી એક કારીગરને ૪૦૦થી ૫૦૦ રૂપિયા સુધીનો માસિક પગાર મળતો હતો. કંપનીના નિયમ પ્રમાણે તેમની ચાર રજાઓ કૃપાત પગારે મળે છે. એટલે કે કામ કરેલ દિવસ પ્રમાણે પગાર મળતો હતો. પ્રાણીમાં કામ ચાલ્યું હોવાથી પાણી પ્રમાણે કામે જરૂરું પડતું હતું. આ ઉપરાંત કંપનીના નિયમ પ્રમાણેના લાભો પણ મળતા હોવાથી નોકરી કરતાં કુટુંબોની આવકો પ્રમાણમાં રારી જોવા મળી હતી. દંડો કરતું એક કુટુંબ જોવા મળ્યું હતું જે રોઠવા કોળીનું હતું, તે સુધીનીકામ કરતો પણ તે પોતાના ગામમાં કે નજીકના ગામમાં ધરાંધવાનું, હળ બનાવવાનું, ખાટલા બનાવવાનું, ખુરશી બનાવવી વગેરે કામ પોતાની આવડત પ્રમાણેનું કરતો. આ શિવાય મજૂરી એ મુખ્ય વ્યવસાય હતો. મજૂરી મોટાખાગે થોમાસાની મોસમમાં ઝેતમજૂરી, જંગલમજૂરી, રોપા વાલવા, ખોડા ખોડવા વગેરે. શિથાણે, ઉનાણે, બાંધકામની મજૂરી. બાંધકામમાં સરકારી રોડકામો, રોડની મજૂરી, મકાન બાંધવાની મજૂરી, છૂટક મજૂરી, જી.એમ.ડી.રી.ના કારખાનામાં અથવા અન્ય જગ્યાઓ ઐ-બ્રાણ દિવસ કામ મળે ન મળે એવા મકારની મજૂરી કરતા. જંગલનું પ્રમાણ દિવસે દિવસો ઓછું થવાના કારણે જંગલની ગાંધી પેદાશ એળી કરવાની આવકો ખૂબ ઓછી થતી. લાણી જંગલની ગાંધી પેદાશના સાથો પણ બેપારીઓ ખાસ આપતા નથી તેથી પણ ઓછી આવક જોવા મળે છે. એક તિકોની શુગાળ લેગો કરે ત્યારે ૫ રૂપિયા મળે છે તે ધારી જ ઓછી કહેવાય. આ ઉપરાંત ચારોળી, કરાઈનો ગુંડર, બરુની છાલ, ડીમુનાં પાન વગેરે કેટલાંક કુટુંબો એકઠો કરતાં માતુશ્શ પડથી હતો. અન્ય મજૂરીમાં કોઈ બેપારીનો માલ ઉચ્ચકી જવો, કડીપાણી કોઈના કામે વસ્તુ લઈ આવવી કે મૂકી

શાલવી વગેરે જુદા જુદા મહારાજાનાં કામો કરવા માત્રમાં
પડયા હતા, પુરુષો બાધકામ, જી. એમ. ડી. રી. ના.
કામોમાં જાથ છે જથારે સ્ત્રીઓ છૂટક મજૂરી, રોકડકામ
ઘેતી મજૂરી, જંગલપેદાશ એકઠી કરવી, નવરાશના સમયમાં
સ્ત્રીઓ વહેણામાંથી માછવાં પણ પડી લાવે છે.

ખાલકો જંગલપેદાશ એકઠી કરવી, દોર ચરાવવાં,
નાનાં ખાલકોને રાખવાનું કામે કરે છે.

એ યો ખણી અંતઃ દશ વિત્તો કોનો

તપાસેલ ૪૦ કુદુંબોની જુદા જુદા વ્યવસાય પ્રમાણેની ચોખ્યી આવકો ૮ કોઠા દ્વારા જોઈએ તો કુલ આવકના ૪૭.૪ ટકા આવક હેતી પશુપાલનની જોવા મળી હતી. નોકરીની આવકો કુલ આવકના ૨૫.૩ ટકા, જંગલમજૂરીની ૧.૧ ટકા, બાંધકામની ૧૦.૧ ટકા, છૂટક મજૂરીની ૪.૭ ટકા, જંગલ ગૌણ પેડાશ ૧.૭ ટકા અને ૦.૬ ટકા અન્ય આવકો મેળવતા હતા. હેતી પશુપાલનનો મુખ્ય વ્યવસાય હોવાથી તેની આવકો અન્ય આવકોના સરેરાશ ૫૦ ટકા જેટલી આવકો જોવા મળી હતી. નોકરીની આવકાં પણ સારી જોવા મળી હતી. ઐતમજૂરીની આવક ૭.૭ ટકા હતી કે ચોમાસામાં વધારે મો છે જ્યારે શિથાલે ઉત્તે કંઈ કામ ન મો લ્યારે બહાર બાંધકામમાં રોડ બનાવવા કે કોન્કાણનાં કામોમાંથી આવકો મેળવતા હતા. તેથી જ તેની આવક કુલ આવકના ૧૦.૧ ટકા જોવા મળી હતી. જંગલના કૂપો દર વર્ષે નિકળતા નંભિ હોવાથી તેની આવકો દુઃકત ૧.૧ ટકા જોવા મળી હતી. જંગલ ગૌણ પેડાશની આવકો પણ સાર નંભિ માનવને કારણે ઘણી જ ઓછી જોવા મળી છે જેનું પ્રમાણ ૧.૭ ટકા જેટલું જ હતું.

તપાસેલ ૪૪ રોજવા કુદુંબોની આવકો જોઈએ તો હેતી પશુપાલનની આવકો ૩૬.૭ ટકા અને નોકરીની આવક ૩૮.૨ ટકા જોવા મળી છે કે નોકરી અને હેતીની આવક લંગલગ સરખી જોવા મળી હતી. ઐતમજૂરીની આવક ૫ ટકા ઘંધાની આવક ૧.૬ ટકા, જંગલમજૂરો ૦.૫ ટકા, બાંધકામ ૬.૪ ટકા, છૂટક મજૂરીની આવક ૫.૭ ટકા જોવા મળી હતી.

તપાસેલ ૪૬ ભીલ જાતિનાં કુદુંબોની આવકો ૨૧૬વા કરતાં કંઈક જુદા પ્રકારનું ચિત્ર જોવા મળ્યું હતું. હેતી અને પશુપાલનની આવક ૫૮.૬ ટકા જોવા મળી હતી જ્યારે નોકરીની આવક ૭.૦ ટકા જ જોવા મળી હતી. ઐટલે કે ૨૧૬વા કરતાં લીલોમાં નોકરીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું.

તપાસેલ ૪૦ કુટુંબોની જુદા જુદા વ્યવસાય પ્રમાણેની બોખ્ખી આવકો ૫ કોરા દ્વારા જોઈએ તો કુલ આવકના ૪૭.૪ ટકા આવક હેતી પશુપાલનની જોવા મળી હતી. નોકરીની આવકો કુલ આવકના ૨૫.૩ ટકા, જંગલમજૂરીની ૧.૧ ટકા, વાંદ્યકામની ૧૦.૧ ટકા, છૂટક મજૂરીની ૪.૭ ટકા, જંગલ ગરૌણ પેદાશ ૨.૭ ટકા અને ૦.૬ ટકા અન્ય આવકો મેળવતા હતા. હેતી પશુપાલનનો મુખ્ય વ્યવસાય હોવાથી તેની આવકો અન્ય આવકોના સરેરાશ ૫૦ ટકા રેટલી આવકો જોવા મળી હતી. નોકરીની આવકાં પણ સારી જોવા મળી હતી. ઐતમજૂરીની આવક ૭.૭ ટકા હતી કે થોમાસામાં વધારે મળે છે જ્યારે રિચાર્ડે ઉનાને કંઈ કામ ન મળે ત્થારે ઘણાર વાંદ્યકામાં ૨૦૬ બનાવવા કે કોણાકટનાં કામોમાંથી આવકો મેળવતા હતા. તેથી જ તેની આવક કુલ આવકના ૧૦.૧ ટકા જોવા મળી હતી. જંગલના કૂપો દર વર્ષો નિકળતા નહિ હોવાથી તેની આવકો હકત ૧.૧ ટકા જોવા મળી હતી. જંગલ ગરૌણ પેદાશની આવકો પણ સારુ નહિ માનાને કારણે ઘણી જ ઓછી જોવા મળી છે રેન્ટનું પ્રમાણ ૧.૭ ટકા રેટલું જ હતું.

તપાસેલ ૪૪ રોઠવા કુટુંબોની આવકો જોઈએ તો હેતી પશુપાલનની આવકો ૩૬.૭ ટકા અને નોકરીની આવક ૩૮.૨ ટકા જોવા મળી છે કે નોકરી અને ખાતીની આલક લગભગ સરખી જોવા મળી હતી. ઐતમજૂરીની આવક ૫ ટકા ઘંઘાની આવક ૧.૬ ટકા, જંગલમજૂરી ૦.૫ ટકા, વાંદ્યકામ ૬.૪ ટકા, છૂટક મજૂરીની આવક ૫.૭ ટકા જોવા મળી હતી.

તપાસેલ ૪૬ લીલ જાતિનાં કુટુંબોની આવકો રોઠવા કરતાં કંઈક જુદા પ્રકારનું ચિત્ર જોવા મળ્યું હતું. હેતી અને પશુપાલનની આવક ૫૮.૬ ટકા જોવા મળી હતી જ્યારે નોકરીની આવક ૭.૦ ટકા જ જોવા મળી હતી. એલે કે રોઠવા કરતાં લીલોમાં નોકરીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું.

ખેતમજૂરીની આવક ૨૧૮વા કરતાં ભીલોમાં લગભગ
બમણી જોવા મળી હતી. જંગલ મજૂરીની આવક ૨૧૮વા
કરતાં વધુ જોવા મળી હતી. તે જ રીતે બાંધકામમાં
પણ ભીલ કુટુંબો વધારે બહાર જાય છે તેથી તેની આવક
વધુ હતી. જંગલ ગૌણુ પેદશમાં પણ એવિલ કુટુંબોની આવક
૨૧૮વા કરતાં વધુ જોવા મળી હતી.

આમ બેકંદરે ચિત્ર જોઈએ તો મજૂરીના દરેક
કામમાં ભીલ જાતિનાં કુટુંબોની આવક વધુ જોવા મળી
હતી. ભીલોમાં શિક્ષણનું પ્રમાણ બિલકુલ નહિ હોવાથી
અથવા કોઈ આગવી પ્રતિસા નહિ હોવાના કારણે
કાથમી નાંકડી પણ મેળવી શક્યા નથી તે સ્થાપ દેખાય
છે. તેમનો વારસાગત ધંધો ખેતી, મજૂરી અને પણપાલનનો
ધંધો કરી આવકો મેળવતા માટુમ પડયા હતા.

કુટુંબીઠ વાળીકિ આવકનો ખ્યાલ નીચેના કોઠા
દૂબારા જોઈએ તો.

કંદુંઅણી ૬ આવક દર્શાવતો કોણે

જાહિ કુલ ખેતી નોકરી ધેંધાની ખેત - જેથે ધેંધા દ્વારા જુગાલ અને કંદુંઅણી ૬
 કંદુંઅણી પણ - તી આવક મજૂરી મજૂરી કાન્ય મજૂરી ગાડું એવી આવક
 પાલનની આવક પ્રદાન
 આવક

૩૧૬૭૧ ૪૪ ૧૫૨૭ ૧૪૭૩ ૭૨ ૧૪૫ ૨૦ ૨૪૫ ૨૧૬ ૩૭ ૫૩ ૩૮૫૦

૫૮૪ ૪૬ ૧૫૨૫ ૧૯૩ ૩૪ ૨૪૪ ૩૭ ૩૨૪ ૧૪૫ ૫૩ ૩૦ ૩૨૧૩

૧૬૦૨

કુદુંબદી ૮ વાર્ષિક આવકનો કોઠો જોતાં ૩૫૭૮ ખાતે અવે છે કે તપાસેલ ૨૦ કુદુંબોની સરેરાશ વાર્ષિક આવક ૩૨૧૩.૩ પિયાની હતી. વિવિધ પ્રકારનાં કામો કરવા છતાં એક કુદુંબની આવક અપૂરતી જોવા મળી હતી. જુદા જુદા બ્યવસાયમાંથી આવકો મેળવે છે જેનું પ્રમાણ ઘણું જ ઓછું હતું. ઐતી પશુપાલનમાંથી ફક્ત ૧૫૨૫ ઇપિયાની જ આવક મેળવે છે કે વધારેમાં વધારે છે. નોકરીની આવક ૩૮.૮૧૩, ધંધાની આવક ૩૮.૩૫, ઐતમજૂરીની આવક ૩૮.૨૪૪, જંગલ મજૂરી ૩૮.૩૭, બાંધકામ ૩૮.૩૨૫, છૂટક મજૂરી ૩૮.૧૪૫, જંગલ ગાંધું પેદાશ ૩૮.૫૩ જ્યારે અન્ય આવકોમાંથી ૩૮.૩૦ મેળવે છે જેનું પ્રમાણ ઘણું જ ઓછું કહી શકાય.

તપાસેલ ૪૪ ૨૧૬વા અને ૪૬ ભીલ કુદુંબોની સરેરાશ કુદુંબદી ૮ આવકો જોઈએ તો ઐતી અને પશુપાલનની આવકોમાં ખાસ લાદવાલ જોવા મળતો નથી. નોકરીની આવકમાં ઘણું લાદવાલ જોવા મળો છે. અગણ જોથું તેમ ૨૧૬વા કોળીમાં નોકરીનું પ્રમાણ વધારે હતું. તે જ રીતે ઐતમજૂરીમાં અને બાંધકામમાં ભીલો ૨૧૬વા કરતો વધુ આવક મેળવે છે, કારણ કે મજૂરી સ્વિવાય તેમને બીજો કોઈ વિકલ્પ નથી. જંગલ ગાંધું પેદાશો પણ ૨૧૬વા કરતાં ભીલ કુદુંબો વધારે એકઠી કરે છે. આમ છતાં કુદુંબદી ૮ આવકોનું પ્રમાણ ઘણું જ ઓછું કહી શકાય.

ऐતી પશુપાલનમાંથી થતા વાર્ષિક ઉત્પાદનમાં કેટલું ધરવપરાશ માટે અને કેટલું કેચાણ કરે છે તેનો ખાતે નીચેના કોઠા ઉપરથી આવી શકે છે. તપાસેલ ૨૦ કુદુંબોના કુલ ઉત્પાદનના ૭૬.૪ ૮૫૧ ધરવપરાશ માટે જ્યારે ૨૩.૬ ૮૫૧ જ કેચાણમાં આવે છે. એટલે કે મોટાસાગનું ઉત્પાદન ધરવપરાશ પૂરતું મય્યાંડિત હતું અથવા ધરવપરાશ પૂરતું ન હોય ત્યાં તેનું કેચાણ કથાં કરતું તેનો પ્રશ્ન ઉભો થાય છે. આમ છતાં અગણ જોથું તેમ આદિવાસીને પણ પોતાના બ્યવહારો હોય છે. સામાજિક, ધાર્મિક, વારતહેવાર વગેરે બ્યવહારોમાં ઐત-ઉત્પાદન અને પશુનું કેચાણ મને કમને પણ કરતું પડતું હોય છે.

તપાસેલ ૪૪ રુટેવા કુદુંબો કુલ ઉત્પાદનના
 ૭૩. ૭ ૮૫૧ ઘરબપરાશ માટે રાખતા જ્યારે ૨૬.૩ ૮૫૧
 વેચાણ કરતા હતા. જ્યારે ૪૬ ભીલ કુદુંબોમાં ૭૨.૧ ૮૫૧
 ઘરબપરાશ માટે જ્યારે વેચાણમાં ૨૦.૬ ૮૫૧ રાખતા
 માતુમ પડથા હતા.

એતી અને પણુપાલનમાંથી થતું વાળીક ઉત્પાદન
 (૩ પિથામાં)

જાતિ	કુલ	ઘરબપરાશ	વેચાણ	કુલ
	કુદુંબો			
રુટેવા	૪૪	૫૦,૩૦૪	૨૧,૫૨૦	૮૧,૮૨૪
		૭૩.૭	૨૬.૩	૧૦૦.૦૦
ભીલ	૪૬	૬૬,૦૭૩	૧૭,૪૩૧	૮૩,૫૦૪
		૭૨.૧	૨૦.૬	૧૦૦.૦૦
કુલ	૨૦ ૧,૨૬,૩૭૭	૩૬,૦૨૧	૧,૬૪,૩૮૮	
	૭૬.૪	૨૩.૬	૧૦૦.૦૦	

તપાસેલ ૨૦ કુદુંબોનો મુખ્ય વ્યવસાય એતી પણ-
 પાલનનો છે. એતી માટેની જીનો હુંગરો ઉપર જ્યાં
 ચાપાટ મેદાન હોથ, જ્યાં માટીના થર હોથ તેવી
 જગ્યાએ એતી કરે છે. હુંગરના ટોટાવવાળી જીનમાં
 પણ એતી કરે છે. આવી અસપાટ જીનમાં એતી થઈ રહે
 તેવી જીનોમાં મુખ્ય પાક મકાઈ, જુવાર, બંટી, તુંબે,
 આડા, તલી, ભીંડી, કપાસ, વગેરેના પાકો લેતા હોથ
 છે. આટલા બધા પાકો જોથા પછી આપણને એમ થાય કે
 આવા સરસ પાકો થાય છે તો ત્યાંની જીનો સારી
 હશે, સુધરેલી પદ્ધતિથી એતી થતી હશે. પણ તેણું નથી.
 જીનો હુંગરની તણેટીની કેટલીક સારી છે, થીકણી અને
 કાંપવાળી છે ત્યાં કપાસ અને જુવાર સારી થાય છે. પણ

જ્યાં પદ્ધતિવાળી, લાલ માટીવાળી અથવા જેના થર
ઓળા હોથ, નીચે પદ્ધત હોથ લેવી જમીનોમાં જંગલી
ઘાસની માછક ખેતી કરવામાં આવે છે, ત્યાં બણાયી
ખેતી ચારું પાઠી તેમાં તુંબેર, અડદ, જુવાર, બંટી, ભીંડી
બંધું બેંગું વિધારણ ઓરવામાં આવે છે. આ પદ્ધતિની
અગવાનના લરોસો ને પાક તે ખરું તે રીતે ખેતી કરવામાં
આવે છે. પણ જુવાર અને મકાઈનો પાક પ્રમાણમાં સારો
થાય છે. સાથે સાથે તલતો પાક પણ સારો થાય છે. તલને
ઓળો વરસાદ અને સૂક્કું વાતાવરણ મળે બાં પાક સારો
થાય છે તેમ માનવામાં આવે છે. તપાસેલ ૨૦ કુદુંબોટું
પાકવાર ઉત્પાદન નીચેના કોઠામાં આપવામાં આવ્યું છે.

પાકવાર ખેતી માંથી ૩ લાખ ૧૦૮ લાખ વિતો કરોડો (૩ લાખ ૧૦૮)

ઉપરોક્ત કોઠો જોવા તપાસેલ છુટુંથોમાં

કુલ ઉત્પાદનના ૮.૪ ટકા મકાઈ, ૪૬.૬ ટકા જુવાર,
૫.૧ ટકા બંદી, ૭.૧ ટકા તુવેર, ૭.૧ ટકા અડદ,
તલી ૬.૫ ટકા, લીંડી ૧.૬ ટકા, કપાસ ૦.૬ ટકા
ધાસ ૧૩.૪ ટકા જોવા મળ્યું હતું. કુલ ઉત્પાદનમાં
૪૬.૬ ટકા ઉત્પાદન જુવારનું જોવા મળ્યું હતું ને સૌથી
વધારે છે. એટલે કે મુખ્ય ધાન્ય જુવાર જોવાથી ખોરાકમાં
જુવારનો ઉપયોગ વધારે થાય છે. ત્થાર પછી ૮.૪ ટકા
મકાઈનું ઉત્પાદન જોવા મળ્યું હતું. આગળ જોથું તેમ તલના
પાક માટે આખોળવા માટે જોવાથી તેનું ઉત્પાદન પણ
મકાઈ પછી આવે છે જેનું પ્રમાણ ૬.૫ ટકા હતું. તલનો
ઉપયોગ મોટાખાગે કેચી દેવામાં થાય છે તેનું તેલ કાઢી
ખાવામાં ઉપયોગ કરતા નથી તેનું કારણ એ પણ હોઇ શકે
કે તલનો ભાવ સારો મળે છે. ત્થાર પછી કઠોળમાં તુવેર
અને અડદના પાકનું પ્રમાણ ૭.૧ ટકા જેટલું સરખું જોવા
મળ્યું હતું. તુવેર અને અડદ ઓછા પ્રમાણમાં કેચે છે કારણ
કે તેમનો મુખ્ય ખોરાક દાંડ અને રોટલાનો છે. જરૂર પડે
તો તેને પણ કેચવામાં આવે છે પણ આગળના કોઠામાં
જોથું તેમ ખાધાખોરાકી માટે આવતા અનાજને ખારા કેચ-
વામાં આવતું નથી. બંદીના પણ રોટલા બનાવી ખાઈ
શકાય છે. તેની થૂલી જેનું પણ બનાવે છે જેનું પ્રમાણ ૫.૧
ટકા હતું. આ શર્યર્ણની વાત એ છે કે લીંડીનો ઉપયોગ પણ
ખાવામાં કરવામાં આવે છે. લીંડી પાકે ત્થારે તેને સૂક્કવી
તેને દળી તેના રોટલા બનાવી ખાય છે. લીંડીના ઝૂલ્ણની
ભાજી પણ બનાવી ખાઈ શકાય છે. લીંડીનું પ્રમાણ ૧.૬
ટકા જ જોવા મળ્યું હતું. તેના રેસા બનાવી દોળી
બનાવવામાં પણ ઉપયોગ શકે છે. કેટલાક રોટલા
કુટુંબો કપાસનું વાકેલર પણ કરતા થયા છે. જો કે પ્રમાણ
૦.૬ ટકા જેટલું જ જોવા મળ્યું હતું. પણ પાલનનો ધંધો
જોવાથી ખાસ સાચંકી રખવામાં આવે છે ને કુલ ઉત્પા-
દનના ૧૩.૪ ટકાનું પ્રમાણ હતું.

તપાસેલ ૪૪ ૨૧૬વા કુદુર્યો અને ૪૬ લીલ કુદુર્યોમાં
પાકવાર ખેતીમાંથી ઉત્પાદન જોઈએ તો મહાત્ર ૨૧૬વામાં
૧૩.૦ ૮૫૧ જ્યારે લીલમાં ૪.૭ ૮૫૧ જ જોવા મળી હતી
એટલે કે લીલો પાસે મહાત્ર થઈ શકે રેવી સપાટ કે સારી
જમીનો ન હતી રેવી રેખાઓ મહાત્રનો પાક ઓછો મેળવી
શકે છે. જુવારનું પ્રમાણ જોઈએ તો ૨૧૬વાઓ ૪૪.૩ ૮૫૧
છે જ્યારે લીલો ૫૩.૬ ૮૫૧. એટલે કે લીલો મહાત્ર કરતાં
જુવારનું વાવેતર વધુ કરે છે કારણ કે રેમની પાસે જુવાર
માટેની અનુકૂળ જમીન હતી. તે જ રીતે બંદીમાં ૨૧૬વાઓનું
ક્રરક્ષણીં ૭૫૧ ૩.૦ ૮૫૧ હતું જ્યારે લીલોમાં ૬.૮ ૮૫૧
હતું ને ૨૧૬વા કરતાં બમણું જોવા મળયું હતું. તુવરનું
ઉત્પાદન લગભગ સરખું જ જોવા મળયું હતું. તે જ રીતે
અડદમાં પણ સરેરાશ સરખું જ ઉત્પાદન છે. તલનું ઉત્પાદન
લીલ કરતાં ૨૧૬વાઓમાં વધુ જોવા મળયું હતું. લીંડીનું
ઉત્પાદન લીલ કુદુર્યોમાં વધારે હતું જ્યારે કપાસનું વાવેતર
એક પણ લીલ કુદુર્યોમાં જોવા મળયું ન હતું. ધાસનું પ્રમાણ
૨૧૬વા અને લીલોમાં સરખું જોવા મળયું હતું.

આ જોતાં સ્પષ્ટ થાય છે કે રોકડીયા અથવા વધુ
એવક પ્રાર્થ થાય રેવા પાકો લીલો કરતાં ૨૧૬વામાં
વધારે પ્રમાણમાં હતા જ્યારે લીલો હજુ પણ હલકા ધાસના
પાકો જ રેવા માટું પડયા હતા.

અસી-માનગાંધીજી અને રાયાંબોડો (ગુજરાત)

અસી	માનગાંધીજી	રાયાંબોડો
કંપાણી	દરટું	દરટું
કંપાણી	દરટું	દરટું અનીદે
કંપાણી	દરટું	દરટું
કંપાણી	દરટું	દરટું

અસી	માનગાંધીજી	રાયાંબોડો
કંપાણી	દરટું	દરટું

અસી	માનગાંધીજી	રાયાંબોડો
કંપાણી	દરટું	દરટું

એતી અને પશુપાતનની આવક જોઈ હવે એતી અને
પશુપાતન માટે કરવાસ્તું આવતું ખર્ચ જોઈએ તો નિયેના
કોઠામાં બતાવ્યા પ્રમાણે લપાસેલ ૮૦ કુંભોના કુલ
ખર્ચના ૧૪.૮૮૫ ધરના વિધારણ પાછળ જથારે ૪.૪
૮૫ રોડ વિધારણ ખરીદતા હતા. એટલે કે ૨૧૬૧૮
અને સીલો પોતાના ધરતું વિધારણ સંધરી રાખે છે જેનો
ઉપયોગ ચોમાસુ બેસતાં કરવામાં આવે છે. તેમનો મુખ્ય
વ્યવસાય એતી હોવાથી એતરમાં કે કુંઠ પાકે તેમાંથી
અમૃત સારા દાણાવળો ભાગ વિધારણ માટે દરેક કુંભ
વતાઓછા પ્રમાણમાં રાખે છે. ઉમણાં હાઇઝ્વિની જુલાલ
અને મકાઈ મળતી હોવાથી કેની કોથળીઓ કેચાતી
લાવતા થયા છે પણ મોટાભાગના ખૂબો પોતાના ધરમાં
વિધારણ સંધરી રાખતા હોય છે. દરેક કુંભના ધરના
દિયાણાવળા ભાગમાં વિધારણના ઘચક આપણી નજરે
પડે જ. તે જ રીતે ખાતર પાછળનો ખર્ચ જોઈએ તો કુલ
ખર્ચના ૩૧.૦ ૮૫ ધરતું ખાતર જથારે ૫.૮ ૮૫ ખાતર
વેચાતું લાવેલા હતા. એટલે કે પશુપાતનના કારણે ખાતર
થાય તે એતરમાં જ નાંખવામાં આવે છે. આગળ જોયું તેમ
રોજેરોજું ખાતર એતરમાં કેરી દેવામાં આવે છે. કેટલાં
૨૧૬૧૮ કુંભો ખાતરને ખેણું કરતા હતા પણ તેનું પ્રમાણ
ધણું જ ઓછું કહી શકાય. જથારે વેચાતું ખાતર થુરિયે. એ
સણતી ડીમાં મળે અથવા હાઇઝ્વિન વિધારણની કોથળી
લાવ્યા હોય તે એકાદ એલી ખાતર લાવે તો પાક સારો
ઉતરે કે ગણ્યાથી નોકરી કરતા કે આ રીતે સારાં
કુંભો ખાતરનો ઉપયોગ કરે છે. બધા જ રાસાય શિક
ખાતરનો ઉપયોગ કરતા નથી.

નાના ઓજારોનું ખર્ચ કુલ ખર્ચના ૪.૧ ૮૫ કેટલું
હતું. નાના ઓજારમાં કોણાં, કુહાં, દાતરાં
વગેરેને ધાર કાઢવાના વગેરેનો ખર્ચ થાય છે. ધારાયારાનો
ખર્ચ કુલ ખર્ચના ૩૫.૫ ૮૫ કેટલો થાય છે એટલે કે ધારા-
યારો વેચાતો કે પૈસા ખર્ચો નિષ્ઠ લાવતાં ધરનો કે

જંગલમાંથી મેળવી લે છે. ખાસ કરીને જુવારના ધાસના પૂણા સંશરી રાખે છે. જંગલમાંથી મોટું ધાસ કાપી તેના પણ પૂણા બંધી સંશરી રાખવામાં આવે છે. તેની કોઈ ડિઝિટ અઠપણી પડતી નહિ હોવાથી તે ધરનો જ છે તેમ માનવામાં આવે છે. જી ચોમાસામાં જ્યારે સૂકું ધાસ ન મળે ત્યારે અંદરોથેંદર વેચાતો મેળવે છે.

કુલ ખર્ચના ૧.૮૮૭ જમીન મહેશૂલ હતું. એટલે કે મોટાગના ઐહૂતો પાસે નામવાળી જમીનો ઓછો હતી. તેથો જંગલની કે અન્ય પંચાયતની જમીનો ઐહૂતા હતા તેથી જ દંડની રકમ પણ જમીન મહેશૂલ નંટલી જ બરતા હતા. કેટલાંક ઐહૂતો બીકના કારણે ને દંડની રકમ મળે તે આપી હેતા અને તે જ ખેતરમાં ખેતી કરતા. હા સાડે મેળવવાનું પ્રમાણ ધ્યાં ઓછું હતું. કારણ કે દરેક કુટુંબો પાસે બળદ અને હળની સગવડ હતી. ન હોય તો પણ તે જાતિભાઈ પાસેથી કે કુટુંબી પાસેથી એક પે દિવસ બળદ, હા માર્ગી લાબીને પણ ખેતી કરી લેતા હોવાથી હા અને પાડાનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું. અનો જાતિભાઈમાં ખર્ચનું પ્રમાણ લગભગ સરખા જેણું જ જોવા મળ્યું હતું. પણ રાઠવાબો નોકરી કરતા હોવાથી જિયારણ અને ખાતર વેચાતું લાબી ઉપથોગ કરતા હતા જેણું પ્રમાણ લીલા કરતાં વધુ જોવા મળ્યું હતું.

કુલ ઉત્પાદન ખર્ચ

જાતિ	કુલ	ધરણું	રોકડ.	શાખ	કુલ ખર્ચ
કુટુંબો					
રાઠવા	૪૪	૧૩૩૩૫	૫૬૭૪	૧૦	૧૬૦૧૬
		૭૦.૧	૨૮.૮	૦.૧	૧૦૦.૦૦
લીલ	૪૬	૧૪૪૩૦	૨૦૩૭	૨૮૦	૧૬૭૪૭
		૮૬.૨	૧૨.૨	૧.૬	૧૦૦.૦૦
કુલ	૪૦	૨૭૭૬૫	૭૭૧૧	૨૬૦	૩૪૭૬૬
		૭૭.૬	૨૧.૬	૦.૮	૧૦૦.૦૦

કુલ ઉત્પાદન ખર્ચનો કોઈ જોતાં સ્વચ્છ અથવા આવે છે કે તપાસેલ ટ૦ કુટુંબો કુલ ઉત્પાદન ખર્ચના ૭૭.૬ ૮૫ ધરનો જ ખર્ચ કરતા હતા એનો અર્થ એ થમો કે હજુ તેમને અધુનિક કળી શક્ય રેવાં સાધનો, વિદ્યારણ, ખાતરનો ઉપયોગ કરતા નથી પણ પોતાની જૂની પદ્ધતિ-ઓથી જ પેતી કરે છે. લીલો અર્થ એ પણ ચાચ કે તેમની પારો હજુ એટલી આવકો નથી કે કે રોકડથી પરીદી રહે. રોકડ ખર્ચ જોઈએ તો ૨૧.૬ ૮૫ હતું જેમાં રાઠવા કુટુંબોના કુલ ખર્ચના ૨૮.૮ ૮૫ રોકડમાં અને ૭૦.૧ ૮૫ ધરણું ખર્ચ કરતા હતા જ્યારે શાખ ઉપર ૦.૧ ૮૫ જ ખર્ચ કરતા. રાઠવાઓ રોકડમાં ખર્ચ વધુ કરતા જ્યારે લીલો રોકડમાં ખર્ચ ઓછો કરતા તેનું કારણ તેમની આજો રોકડમાં ન હતી. રેઓ નોકરી કરતા ન હતા જ્યારે શાખ ઉપર પણ રાઠવા કરતાં લીલાંએ વધારે ધીરણ લીધું છે એટલે કે તેનું પ્રમાણ ૧.૬ ૮૫ જેટલું હતું જો કે તે પ્રમાણ ઓછું કળી શક્ય કે તેનું ધીરણ ઓછું કુટુંબો જ લેતાં હોય કે જેઓ પોતાના વ્યવહારો શાહુકાર, વેપારી જોડે સારા રાખતા હોય અથવા કુટુંબોમાંથી પણ લેતા હોય અને અપત્તા હોય.

ପରିବହନ କାର୍ଯ୍ୟ କରିବାକୁ ଅନୁମତି ଦିଲାଏଇବେ ।

କୁଳାଳ ପାଇଁ ଦେଖିଲା ତାଙ୍କ ମହିଳା ଏହାରେ କିମ୍ବା
କିମ୍ବା କିମ୍ବା କିମ୍ବା କିମ୍ବା କିମ୍ବା କିମ୍ବା କିମ୍ବା

१९६४	४४	७५००८	१५८५	७७८५	२२२५	२६३५	३२५५	६३५	३३०	४७८५	२२२०	८८५	१००	३००
भी.८	४४	८०१	५०८	२०१	२०१	२०१	२०४	००४	१०४	३०४	२०१	००४	००४	००४
भी.९	४५	७४३५	१२६०	८४२५	५००	५००	१७१२	११०	१२८०	४२८०	३४०५	४८०	—	—
६३-१	१०	७४३५	०-५	०-५	१-४	१-४	०-०८	३-५	४-१	३-८	०-३	—	—	—

ધર્મપરાશ્રી અણ દસ્તિવતો કોઠો (૩ પ્રિયામણ) ॥૭॥

धर्मवप्त्राश्री अर्थ दशविंशति कोठो (३ पियामी) "अग्नि

ધરવપરાણી ખર્ચનો કોઠો જોતાં સ્પેશ્ટ ખ્યાલ આવે છે કે તપાસેલ છુદુંઘોના કુલ ખર્ચના ૫૮.૪ ટકા અને ૭
પાછળ ખર્ચ થયું છે. શાકભાજ પાછળ ૧.૧ ટકા એટલે કે
શાકભાજ ખાસ કેચાતી લવતા નથી પણ એળ કે ચટણી
બનાવી ખાઈ લે છે. મર્સિ ઈડાં પાછળ ૬.૩ ટકા ખર્ચ
થાય છે. વારતહેવાર કે મહેમાન આવે ત્યારે માંસ અને
દાઢથી સ્વાગત કરવામાં આવતું હોવાથી તેનો ખર્ચ
વધારે છે. દૂધ પાછળ ૧.૩ ટકા, ખાંડગોળ ૧.૩ ટકા
ને કુદુંઘો નોકરી કરે છે અથવા આધીક સ્થાની સારી છે
તેઓ ચા બનાવે છે. ધીતેલ પાછળ ૨.૦ ટકા, ચા કોણી
૦.૨ ટકા ગરમ મસાલા ૧.૭ ટકા. ગરમ મસાલામાં કંઈ
લેજાના મસાલા બાપરતા નથી પણ મરયું, મીઠું, મરી
વગેરેનો ઉપયોગ કરે છે. દારનો ખર્ચ ૩.૯ ટકા થાય છે.
તમારું બીડી પાછળ ૨.૫ ટકા, બળતણ માટે જંગલના
લાકડાનો ઉપયોગ કરે છે. ધરમાં એષુ ચીમની રાખવામાં
આવે છે કે જરૂર પડતાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
દુકાનેથી ૧૦થી ૧૫ પૈસાનું કેરોસીન લાવી રાખતા હોય
છે. ફણફળાદિ જંગલમાં જ મળતાં હોવાથી તેની પાછળ
ખર્ચ કરવામાં આવતો નથી એટલે કે જંગલમાં મળતાં છુટોનો
છૂટથી ઉપયોગ કરે છે. આધીક સ્થાની નણી હોવાથી
અથવા બૌગોલિક પરિસ્થિતિ ચેવી હોવાથી મુશાઝરી
ચાલતા જ કરવી પડે તેથી તેની પાછળ પણ ૧.૧ ટકા
જેટલો ખર્ચ થાય છે. કપડાં પાછળ ૧૦.૯ ટકા ખર્ચ થયો
છે. અત્યારે ખાવા ન મળે તો ચાલે પણ અંગ છેડ્કવા ગાં
તેવું કપડું તો જોઈએ જ તેથી સસ્યું અને છેકું કાપડ તો
ખરીદવું જ પડે તેથી તેની પાછળ ૧૦.૯ ટકા ખર્ચ જોવા
મળ્યો હતો, જો કે આ ખર્ચ પણ ઓછો કણી શકાય. ખૂબ
ગરીબીના કારણે એક૧૬ બે કપડથી ચલાવી લેતા હોય છે.
મોટાલાગના આદિવાસીઓ પગરખાં પહેરતા નથી કારણ
કે લેમની આધીક સ્થાની નણી હોય છે. કુદરતી રીતે
તેઓ પગરખાં વગર ટેવાઈ ગયેલા હોવાથી તેનો ઉપયોગ

ਕੁਝ ਦੀ ਰਾਹਿਕ ਕਰੋਗੇ ਅਤੇ ਉਚਿਤ ਕੀਨੀਆਂ (ਵਿਧਾਨ)

ਕੁਝ ਅਤਾਗ ਰਾਕ- ਮਾਸ- ਦੂਜਾ ਪਾਂਡ ਦੀ- ਚੱਟ- ਗੁਰਨ ਲਮਾਕ ਜਾਤਿਥਾ ਕੁਝ ਆਵੇ ਪਗ- ਸਾਡਾ ਦਲਾ ਅਤੇ ਕੁਝ
ਕੁਝ ਲੋਲ ਦੀ ਭੁਲ ਕੀਨੀਆਂ ਦੀ ਜਾਣੀ ਕੀਨੀਆਂ ਦੀ ਜਾਣੀ ਕੀਨੀਆਂ ਦੀ ਜਾਣੀ ਕੀਨੀਆਂ ਦੀ ਜਾਣੀ ਕੀਨੀਆਂ ਦੀ ਜਾਣੀ

ਪਾਂਡ ਪਾਂਡ

ਰਾਹਿਕ 1481 36 1481 66 66 98 98 52 109 66 20 1 6 83 322 15 3 125 35 31 3092
ਕੀਨੀਆਂ 1416 26 143 13 10 35 2 43 102 98 2 - 22 232 - - 161 12 - 2493

ਕੀਨੀਆਂ 20 1482 31 140 32 32 45 6 49 109 90 14 32 306 6 1 192 14 2420

કુદુંબડી ૬ ખર્ચનું પ્રમાણ જોઈએ તો ૨૧૬વાડોટી
કુદુંબોની આવક અને ખર્ચ સપ્રમાણ જોવા મળે છે. એટલે કે
જે કંઈ મેળવે છે તે બધું ખર્ચાઈ જાય છે અનું કારણ એ પણ હોઈ
શકે કે તેમની આવકો નોકરીના કારણે વધી છે તેથી તેઓ
આવકના પ્રમાણમાં ખર્ચ પણ કરી શકે છે. પણ જીવનધોરણ
જોતાં કુદુંબડી ૬ જે ખર્ચ કરવામાં આવે છે તે અપૂર્વાનું છે. એટલે
કે તેઓ પણ જે આવકો મેળવે છે તેમાં જ પોતાનું ગુજરાત
થાપાવે છે. વર્ષમાં ધળીવાર ભૂપથા રહીને પણ થાપાવે છે. લીલ
કુદુંબોનું સરેરાશ ખર્ચ જોઈએ તો કુદુંબડી ૬ ૨૫૭૩ ઇપિયાનું
છે જે ધાણું જ ઓછું કહી શકાય. અર્ધસૂપણીમાં જવી ૨૭૩
હોય તેવી પરિસ્થિતિમાં તેઓ જીવે છે. ખર્ચ કરતાં કુદુંબડી ૬
આવકનું પ્રમાણ ઓછું જોવા મળતું હતું એટલે કે જીવન જીવવા
માટે શાહુકાર, કેપાણી કે અન્ય સગાસંબંધીનો સહારો લેવો
પડે છે.

કુલ ૪૦ કુદુંબોનું સરેરાશ ખર્ચ ૨૮૨૦ ઇપિયા છે જે
ધાણું જ ઓછું કહી શકાય, તેમાં શંકા નથી. આજની આટલી
મૌંઘવારીમાં ૨૮૨૦ ઇપિયામાં એક કુદુંબને જીવનું તે કેટલી
કઠિન અને કષારી પરિસ્થિતિ કહી શકાય. આમ છિતાં
જંગલનો જીવ હોવાથી જંગલનો આશારો કે છે, નદીનાળાનો
આશારો લઈ પોતાનું જીવન વિતાવે છે.

१०८

३६	२०	५७०.०	४३.०	३.४	५.२	५९०.००
३७	२१	५८०.०	४४.०	३.४	५.२	६००.००
३८	२२	५९०.०	४५.०	३.४	५.२	६१०.००
३९	२३	६००.०	४६.०	३.४	५.२	६२०.००
४०	२४	६१०.०	४७.०	३.४	५.२	६३०.००
४१	२५	६२०.०	४८.०	३.४	५.२	६४०.००
४२	२६	६३०.०	४९.०	३.४	५.२	६५०.००
४३	२७	६४०.०	५०.०	३.४	५.२	६६०.००
४४	२८	६५०.०	५१.०	३.४	५.२	६७०.००
४५	२९	६६०.०	५२.०	३.४	५.२	६८०.००
४६	३०	६७०.०	५३.०	३.४	५.२	६९०.००
४७	३१	६८०.०	५४.०	३.४	५.२	७००.००
४८	३२	६९०.०	५५.०	३.४	५.२	७१०.००
४९	३३	७००.०	५६.०	३.४	५.२	७२०.००
५०	३४	७१०.०	५७.०	३.४	५.२	७३०.००
५१	३५	७२०.०	५८.०	३.४	५.२	७४०.००
५२	३६	७३०.०	५९.०	३.४	५.२	७५०.००
५३	३७	७४०.०	६०.०	३.४	५.२	७६०.००
५४	३८	७५०.०	६१.०	३.४	५.२	७७०.००
५५	३९	७६०.०	६२.०	३.४	५.२	७८०.००
५६	४०	७७०.०	६३.०	३.४	५.२	७९०.००
५७	४१	७८०.०	६४.०	३.४	५.२	८००.००
५८	४२	७९०.०	६५.०	३.४	५.२	८१०.००
५९	४३	८००.०	६६.०	३.४	५.२	८२०.००
६०	४४	८१०.०	६७.०	३.४	५.२	८३०.००
६१	४५	८२०.०	६८.०	३.४	५.२	८४०.००
६२	४६	८३०.०	६९.०	३.४	५.२	८५०.००
६३	४७	८४०.०	७०.०	३.४	५.२	८६०.००
६४	४८	८५०.०	७१.०	३.४	५.२	८७०.००
६५	४९	८६०.०	७२.०	३.४	५.२	८८०.००
६६	५०	८७०.०	७३.०	३.४	५.२	८९०.००
६७	५१	८८०.०	७४.०	३.४	५.२	९००.००
६८	५२	८९०.०	७५.०	३.४	५.२	९१०.००
६९	५३	९००.०	७६.०	३.४	५.२	९२०.००
७०	५४	९१०.०	७७.०	३.४	५.२	९३०.००
७१	५५	९२०.०	७८.०	३.४	५.२	९४०.००
७२	५६	९३०.०	७९.०	३.४	५.२	९५०.००
७३	५७	९४०.०	८०.०	३.४	५.२	९६०.००
७४	५८	९५०.०	८१.०	३.४	५.२	९७०.००
७५	५९	९६०.०	८२.०	३.४	५.२	९८०.००
७६	६०	९७०.०	८३.०	३.४	५.२	९९०.००
७७	६१	९८०.०	८४.०	३.४	५.२	१०००.००

તપાસેલ ૪૦ કુંબોમાં દેવાનું પ્રમાણ જોઈએ તો
 તપાસેલ ૪૪ રોજા કુંબોમાં ૧૬ કુંબો દેવાએટા હતા.
 વધુમાં વધુ શાહુકાર અને વેપારીનું દેવું હતું જેનું પ્રમાણ
 ૪૮.૧ ૮૫ હતું એટલે કે ૨૧૦વા જાતિના કુંબો પણ હતું
 શાહુકાર કે વેપારીની પકડમણી મુશ્કત ન હતી. સરકારે
 જુદી જુદી જાતની શહાયક સ્ક્રીમ બનાવી લોન સથસી ડી
 આપવાની જોગવાઈ કરી છોવાથી સરકારનું દેવું ૧૦.૨
 ૮૫, સહકારી મંડળીનું ૧૪.૭ ૮૫, બેન્કનું ૮.૮ ૮૫
 જ્યારે સગાસંખંડીનું ૧૮.૨ ૮૫ દેવું જોવા મળ્યું હતું. અને
 ખરીદવા કે ખેલ ખરીદવા માટે કે સરકારી લોન મળે તે
 લોન સરકારી, સહકારી કે બેન્કનું દેવું છે. બાકી આધા-
 ખોરાકી કે સામાજિક ખર્ચ પાછળ ખર્ચ કરવો પડે ત્યારે તે
 શાહુકાર કે વેપારી કે સગાસંખંડીનો આશરો લીધાં છે તે
 ૪૫૦૮ દેખાયું છે. કે જ રીતે તપાસેલ ૪૬ બીજી જાતિના
 કુંબોનું ચિત્ર કંઈ જુદું જ જોવા મળે છે. ૨૫ કુંબો દેવાએટા
 હતાં તેમને સરકારી, સહકારી કે બેન્ક પાસેથી કોઈ પણ
 પકારની લોન કે કંઈ લીધું નથી જ્યારે દેવાનું પ્રમાણ પણ
 વધારે છે. તેમને ૫૨.૮ ૮૫ શાહુકાર વેપારી પાસેથી
 જ્યારે ૪૭.૨ ૮૫ સગાસંખંડી પાસેથી દેવું કર્યું છે. એટલે કે
 રેનો મોટાખાગે અને પણ શાહુકાર વેપારી અને સગાસંખંડીનો
 જ ઉપયોગ હો છે. મોટાખાગના કુંબોને નિવીઠખર્યમાં જ
 દેવું કર્યું છે. તપાસેલ ૪૦ કુંબોનું ચિત્ર જોઈએ તો ૫૦.૪ ૮૫
 શાહુકાર વેપારી, ૪.૬ ૮૫ સરકાર, ૭.૧ ૮૫ સહકારી
 મંડળી, ૪.૩ ૮૫ બેન્ક અને ૩૩.૩ ૮૫ સગાસંખંડી પાસેથી
 દેવું કર્યું છે. વધારેમાં વધારે શાહુકાર વેપારી પાસેથી
 નિવીઠ ખર્ચ માટે દેવું કર્યું છે.

દેવાનો પકાર અને હેતુ જોઈએ તો ૫૭ ૮૫ રોકાન
 જ્યારે ૪૩.૦ ૮૫ વસ્તુ ડિમલમાં એટલે કે સરકારી, બેન્ક,
 સહકારી મંડળી, પાસેથી કે દેવું કરવામાં આવ્યું છે. કે
 ૨૦૫૭માં છે જ્યારે શાહુકાર, વેપારી પાસેથી વસ્તુના ૩૫માં

દેવાનો હેતુ જોતાં સ્પેશિયલ ખાત આવે છે કે
૭૮.૮૮૫૮ દેવું નિર્બિહખર્ય માટે, ૧૪.૯.૮૫૮ પણ ખરીદવા
માટે, ૪.૯.૮૫૮ ખેતી થઈ, ૧.૪.૮૫૮ સમાજિક. તપાંશેલ
૨૦ કુટુંબોમાં વધુમાં વધુ નિર્બિહ ખર્ય માટે દેવું કરવામાં
આવ્યું છે. લીલાઓંટો ૨૦.૩.૮૫૮ દેવું નિર્બિહોમાં જ ક્ષુદ્ર
છે. એટલે કે દેવું કરી પરિસ્થિતિ ઉભી થઈ છે.
જ્યારે રાઠવાખોમાં પણ ૬૬.૩.૮૫૮ નિર્બિહખર્ય માટે દેવું
ક્ષુદ્ર છે. કેટલીંક લીલ જાતિનાં કુટુંબોની આધીક સ્થિતિ
નથળી હોવાના કારણે તેમને શાહુકાર કેપારી પણ કંઈ
ઉધાર આપતા નથી. ઉધાર લાવી પાણું આપું કથાંથી
તે બીજથી ભૂખે રહે છે પણ દેવું કરતા નથી. લીલ જાતિના
એક કુટુંબી જે પોતાના નામ પર પેન્નલ જણને અનાજ આપાયું
હોય તેનું પણ જાણવામાં આવ્યું છે. એટલે કે કેની શાખ સાથી
હોય તેને શાહુકાર કેપારી ઉધાર આપતા.

सूचि वर्त-जङ्गम भ्रातृकर्त्ता क्षेत्रविदो कोंडो

નિપરોક્ત મિલકત દર્શાવતો કોઠો જોતાં સ્પષ્ટ થાય છે કે પશુઓ, ધર, જમીન એ આ દિવાસીની મુખ્ય મિલકત છે. કુલ મિલકતમાં ૨૦.૪ ટકા જમીન, ૧૬.૮ ટકા ધર, ૬.૭ ટકા પણો, ૪૦.૪ ટકા પશુઓ, એતીનાં સાધનો ૧.૧ ટકા એટલે કે ધરણી જ પ્રાથમિક કક્ષાનાવર્ષાપરંપરાગત વપરાતાં સાધનો દ્વારા જ અને પણ એતી કરે છે. ધર-વખરીનાં સાધનોમાં ખાટલા, ધંટી, વાસણ, ચિકારનાં સાધન વળે મળી ૫.૭ ટકા જ્યારે દાળના રક્ષ.૯ ટકા હતા. દાળના સોનાયાંદીના ન વાપરતાં કલાઈ અને અન્ય ધાતુના વાપરે છે કારણે કે દાળનાની રોખીન પ્રાંતે પણ સોના યાંદીના દાળના વસાવવાની પરિસ્થિતિ નહિ હોવાથી ધાતુના દાળના વાપરે છે. કેટલાક ગળામાં ઇથિના હાર અનાવી પણ પહેરે છે. આ છે તેમની મિલકત.

તપાસેલ ૪૪ રોઠવા કુટુંબો પાસે કુલ મિલકતના ૨૦.૫ ટકા જમીન, ૧૬.૯ ટકા જમીન ૮.૮ ટકા પણ ૩૨.૮ ટકા પશુઓ ૧.૦ એતીનાં સાધનો ૬.૦ ટકા ધરવખરી અને ૪.૦ ટકા દાળના જોવા મળ્યા હતા.

તે જ રીતે લીલ જાતિનાં ૪૬ કુટુંબોમાં પણ જમીન અને ધરની મિલકત સરખી જોવા મળી છે. અડની મિલકત ૧૦.૯ ટકા પશુઓની મિલકત ૪૧.૧ ટકા એતીનાં સાધનો ૧.૧ ટકા, ધરવખરીનાં સાધનો ૫.૪ ટકા ને ૨૧૬વા કરતાં ઓછાં હતાં. તે જ રીતે દાળના પણ ૧.૫ ટકા ને ૨૧૬વા કરતાં ધરણી જ ઓછા કણી શકાય. આ ઈંકા સ્થિતિ નાણી હોવાના કારણે ધરવખરીનાં સાધનો વસાવી શકતાં નથી કે દાળના ખરીદી શકતાં નથી.

નીચેના કોઠા દ્વારા કુટુંબદીઠ અને વ્યક્તિદી મિલકતનું પ્રમાણું જોઇએ તો,

કુલાંગ જિલ્લાના શાખાઓનો પ્રોત્સાહન (જાળાયા)

અંગે ક્રમાંકાંથી અધ્યાત્મી વિભાગ ક્રમાંક
અંગે ક્રમાંકાંથી અધ્યાત્મી વિભાગ ક્રમાંક

૨૧૬૫ ૧ ૨૪ ૨૩૩૧ ૨૫૪૮ ૧૨૩૦ ૨૩૫૨ ૧૨૨૬ ૨૦
૧૧૧૭ ૨૪૫૮ ૧૦૨૫ ૧૦૩૫ ૧૦૨૫ ૧૩૬૧ ૧૩,૩૦૨ ૧૧૦૩

૧૫૨ ૧૩૬૨ ૧૨૮૨ ૧૨૮૮ ૧૨૮૨ ૧૨૮૮ ૫૨૬ ૧૩,૩૦૨ ૧૧૦૩

૧૨૩૦ ૨૪૫૮ ૧૦૨૫ ૧૦૩૫ ૧૦૨૫ ૧૩૬૧ ૧૩,૩૦૨ ૧૧૦૩

કુટુંબદી ૬ કુલ મિલકત ૧૧૫૦૯ રૂપિયા જોવા મળી હતી. જ્યારે વ્યક્તિગતદી ૬ ૧૪૦૯ રૂપિયા મિલકત જોવા મળી હતી ને ધણી જ ઓછી કષી શકાય. જમીન ધારણા-શક્તિ કુટુંબદી ૬ ૨૩૫૨ની હતી જ્યારે ધરની કુટુંબદી ૬ ૨૨૭૭ રૂપિયા, ઝાડ કુટુંબદી ૬ ૧૧૧૭ રૂપિયા, પશુઓ ૪૬૪૮ રૂપિયાની કિંમતનાં એટલે કે કુટુંબદી ૬ પશુઓની સંખ્યા સારી જોવા મળી હતી. ઘેતીનાં સાધનો કુટુંબ-દી ૬ ૧૨૨ રૂપિયાનાં, ધરનાં સાધનો ૬૬૦ રૂપિયાનાં, ૬૧૭ના ૩૩૦ રૂપિયાના કુટુંબદી ૬ સરેરાશ મિલકત જોવા મળી હતી.

૨૧૬વા અને ભીલોમાં કુટુંબદી ૬ મિલકતમાં ધણો તદ્વારા જોવા મળે છે. એટલે કે ૨૧૬વા કુટુંબની મિલકત ૧૩૩૦૨ની છે જ્યારે ભીલની લેનીસામે ૮૭૬૩ રૂપિયા છે. વ્યક્તિગતદી ૭માં પણ ૨૧૬વા કોળીની મિલકત ૧૭૦૬ની છે જ્યારે ભીલની ૧૧૪૯ રૂપિયા છે. તે જ રીતે ઘેતી ધારણા-શક્તિ પણ રાઠવામાં ભીલ કરતાં વધારે હતી. ધરો પણ ૨૧૬વાઓનાં ભીલો કરતાં સારાં અને વધુ કિંમતનાં હતાં. ઝાડની મિલકત લગભગ સરખી હતી. પશુઓ પાળવામાં પણ ૨૧૬વા કુટુંબો આગળ હતાં તે જ રીતે ઘેતીનાં સાધનો, ધરબપરાશી સાધનો, ૬૧૭ના વળેરેમાં ભીલો કરતાં ૨૧૬વા કુટુંબો વધારે ધરાવતાં હતાં.

આ દિવાસી વિસ્તારમાં અઠવાડિયે એક દિવસ જુદા જુદા વિસ્તારોમાં હાટ બરાતા હોય છે. આ હાટ એ આ દિવાસી માટે ધ્યાન મહત્વની બાબત છે. હાટ અઠવાડિયે એક દિવસ નળુકના સ્થળે ભરાય છે. જ્યાં આ જુયાજુના વિસ્તારના આ દિવાસીઓ આવે છે. વસ્તુઓ તેમ જ વનપેદાશ, પશુઓ કેચીને જીવન જરૂરિયાતની ચીજો ખરીદે છે. છોટાઉદેપુર, તાલુકાના કવાંટ ગામે હાટ ભરાય છે ને મારા અસ્યાસ વિસ્તારમાં આવે છે. કવાંટ વેપારનું મથક છે. જ્યાં કાયમી દુકાનો પણ છે અને હાટના દિવસે વેપાર કરે છે. હાટમાં દરેક પ્રકારની જીવનજરૂરી વસ્તુઓ વેચતાર વેપારીઓ આવે છે. તેમાં વિસ્તારને અનુઝ્યપ વસ્તુઓ મળે છે. તેમાં કરિયાણુંની દુકાન, ઘરેણાંની દુકાનો, કટલરી સ્ટોર્સ, સીવણુકામ કરનાર, પ્લાસ્ટિકની ચીજો અને થંપલની દુકાન, શાકભાજુની દુકાન, ફરસાણાની દુકાનો હોય છે. આમાં કેટલાક પરેવાનેદાર દુકાનદારો હોય છે, કેટલાક બિનપરવાને-દાર પણ હોય છે. હાટમાં ધ્યાન દુકાન હોવાથી ખુલ્લામાં તંબુ બાંધી અથવા ચારઘાંસ રોપી તેના ઉપર કંતાન કે કાપડનો છાંચો કરી દુકાન બનાવે છે.

હાટ અને આ દિવાસી એ ધ્યાન જ મહત્વની બાબત છે. કારણ કે આ દિવાસીને કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય ત્યારે તે હાટના દિવસે જ કરે છે અને હાટ-માંથી જ ખરીદે છે. આ દિવાસીઓ હાટમાં કેટલીક વસ્તુઓ વેચવા લાવે છે તેમાં અનાજ, શાકભાજ, કપાસ, તલ, મરધા, મરધી, ઈંડા, બકરા અને બળદ. આ ઉપરાંત જંગલ ગાંણું પેદાશો પણ લાવે છે. આ દિવાસીને તોલમાપ અને ભાવમાં કંઈ અથાલ હોતો ન હોવાથી વેપારી ને આપે તે લઈ લેતા હોય છે. લેને તેનું બચકુ આપે છે તે વજન કરી પૈસા આપે તે તેમાં માં કે માં એ આ દિવાસી જોતો નથી. પણ એક વસ્તુનો ખ્યાલ રાખવામાં આવે છે કે ટોળાખંધ જાતા હોલોપંગ... હોલો... હોલો... હોલો... હોલો... હોલો...

વેચે લ્યાં જ બધા આવતા હોય છે. એક આપે લ્યાં બીજા
પણ આવે છે. અમને ના ઉપર વિશવાસ હોય કે તે એ
વેપારી સારો છે, છેતરતો નથી લ્યાં બીજવસ્તુઓ આપે
છે. પૈસા લીધા પછી તેની ખરીદી બીજુ દુકાનેથી ૫૨-
વામાં આવે છે. તે ને વસ્તુ માગે તેનો ભાવ કહેવામાં આવે
છે. ભાવમાં એ રૂપિયા ઓછા કરે તો તેને ખરીદવામાં
આવે છે. દા.ત. તૈયાર કપડાનો ભાવ ૮ રૂપિયા હોય
અને તે ૧૦ રૂપિયા ઘતાવી તેને એ રૂપિયા ઓછા કરી
વસ્તુ આપે છે પણ તેને જે ભાવે વેચવી છે તે ભાવે વેચે છે.
અંજ રીતે કેટલીક જવનજરારી વસ્તુઓ તેની પાસેની
ખરીદશક્તિ પ્રમાણે કે આટલા પૈસાનું આપ તેમ માગણી
કરે છે. તે ને આપે તે લઈ લે છે.

પશુઓના વેપારમાં બળદ અને વાળરડાનો વેપાર
થાય છે. તેમાં તેની કિંમત તેને જોઈ કરવામાં આવે છે.
બળદની કિંમત ૩૦૦થી ૧૦૦૦ સુધી કરવામાં આવે છે. તે
અંદરોઅંદર ખરીદી વેપાર કરે છે. મરધાનો ભાવ ૨૫ થી
૩૦ રૂપિયા સુધીનો હોય છે. ને ભાવ નક્કી થઈ ગયા।
પછી તે ભાવમાં ખાસ ફેરફાર થતો નથી. ઈંડાના ભાવ
૨૫ થી ૪૦ પૈસા સુધી રહે છે. નંગલ ગૌણ પેદારો ધણા
સસ્તા ભાવે લેવામાં આવે છે. ચારોળી, ચોખાની કણકી
એ કે દ્વારાવાર આપી જાએ કરવામાં આવે છે. મહૂડા
૨૦ થી ૨૫ રૂપિયાના ૨૦ કિલો લેવામાં આવે છે. અનાજ
૨૫ થી ૩૦ રૂપિયે લેવામાં આવે છે. વેચવામાં ૩૨ થી
૩૫ રૂપિયા સુધી લે છે. હાટમાં પુરુષ, સ્ત્રી સાથે આવે
છે. પોતાની પાસેની ખરીદશક્તિ પ્રમાણેની બીજવસ્તુઓ
ખરીદવામાં આવે છે એવું નથી હોવું કે એક અઠવાંચિયા
સુધી ચાલે તેથું ખરીદી લેવું. પોતાની પાસે ને વેચવા
જેવું હોય તે વેચી વસ્તુ ખરીદવામાં આવે છે. જવનજરારી
વસ્તુઓ ખરીદવામાં પણ કરકસર કરી જેની વધુ અગત્યતા
હોય તેવી વસ્તુઓ ખરીદવામાં આવે છે. દા.ત. સ્ત્રીનાં
કપડાં, બાળકો માટે તૈયાર કપડાં વગેરે હાટમાંથી જ

ખરીદવામાં આવે છે. આમ હાટમાં ખુલ્લી જગ્યામાં એક-
સામની ધણી બધી દુકાનોમાં જીવનજરૂરી શીજલ્લુઓ, હલકી
અને સાસ્તી મળે છે. વળી તે દિવસે બેની પાસે ને શીજ હોય
તે કેચવાની હોય છે. તે દરેક પ્રકારના કેપારીઓ ત્યાં
આવેલ હોય છે. દર હાટવડે જવાની કેટલાક કેપારીઓ
સાથે ઓળખાણો થવાથી થોડ્ધણા પૈસા બાકી રહ્યી
અતિ મહત્વની વસ્તુઓ ખરીદવાની હોય છે. વળી થોડી
થોડી વસ્તુઓ એટલે કે જેટલા પૈસાની ખરીદવી હોય તેટલા
પૈસાની ખરીદી શકાય છે. સાથે સાથે તેમના સગાસંખ્યા
હાટવાખમાં મળવાના હોય એકખીજાના ખણ્ડરંતર પૂછી
સામાનિક સંખ્યાઓ વધારવાના હોય આવો અનેક રીતે
આદિવાસીઓના જીવન સાથે વણાયેલો હાટ બેમના જીવનનો
એક ભાગ છે. જ્યારે તેમને અપરિચિત વિસ્તારમાં કે જ્યાં
તેમને કોઈ ઓળખાણું નથી, બ્યાંસ્થિત બજારો છે જ્યાં
અમુક જ પ્રકારની વસ્તુઓ મળે, અમુક પ્રકારની ન મળે તેવા
સ્થળે જ્યારે જો ત્યારે તેના ઉપર કેવા પ્રત્યાધારો પડો
તે તો તે જ જાણે. પણ આ બધાનો ખ્યાલ રાખી તેમને
યોગ્ય જગ્યાએ, તેમની માંગણી પ્રમાણે તેમની બ્યાંસ્થ।
કરવામાં આવે તો આપણે તેમને છેતથોં નથી પણ તેમના
છિતમાં કંઈક ભાગીદાર બન્યા છીએ તેવી રહી રહી આપણા
દિલમાં પણ થયા સિવાય રહી શકે ન છે.

સમાજિક, ધર્મિક અને શૈક્ષણિક જીવન

કુટુંબ વ્યવસ્થા ॥ ૫

કુટુંબ વ્યવસ્થા પિતૃ સમાજની છે. કુટુંભમાં પુરુષ, પત્ની, અપણિત અપર છિંગ બાળકો સાથે જ રહે છે. કુટુંભમાં સાતથી બાર વ્યક્તિત્વો પણ સાથે રહે છે. કેટલ ૧૫ કુટુંભોમાં તો ૧૫ થી ૨૨ સુધીની વ્યક્તિત્વાળાં કુટુંબો પણ અલ્યા સમાં આવ્યાં છે. કુટુંભમાં પુરુષનું પ્રભુત્વ રહે છે.

ત્યારબાદ સ્ત્રીનું અને મોટા દિકરાનું આમ વડીલનું પ્રભુત્વ જોવામાં આવ્યું. દરેક કુટુંભના વડિલને અથવા અંગેવાનને હાહથા માણસ તરીકે ઓળખવામાં આવે છે.

કુટુંભની કમાણી પુરુષ પાસે રહે છે. પણ મોટાખાગે કમાણી અનાજના ઇપમાં હોય છે. મજૂરીના કે અનાજ વેચવાના પૈસા આવે તે પુરુષ અને સ્ત્રી સાથે હાટમાં કે બજારમાંથી જરૂરી ચીજવસ્તુઓ ખરીદી લાવે છે. પૈસાની જરૂર પડે ત્યારે જ અનાજ કે પણ વેચવામાં આવે છે. સ્ત્રી પાસે પણ પૈસા રાખે છે પણ પુરુષ માગે ત્યારે આપી દે છે. કુટુંભના અગત્યના નિર્ણયો પુરુષ લે છે. પણ તે નિર્ણયમાં સ્ત્રીને અને મોટા દિકરાને પૂછવામાં આવે છે. કુટુંભનું વિસાજન બધા સાહિત્યો લગ્ન કરી લે કે જ ધર નાનું પહુંછોય, સ્ત્રી સંયુક્ત કુટુંબ સાથે રહેવા તૈયાર ન હોય તથા છોકરાનાં છોકરા (પૌરો) થાય ત્યારે અલગ ધર વનાવી રહે છે. કુટુંભમાં લડાઈ ગુઘડા ખાસ થતા નથી પણ છોકરાનાં લગ્ન થયા પણી તેથું થાય તો તેને અલગ આપી દેવામાં આવે છે તેને એક ખેતર આપવામાં આવે છે તે વાવી તેનું અલગ ભરણપોષણ કરે છે. તે કુટુંભના વડિલો જ તે ગુઘડો પતાવી નાખતા હોય છે. કુટુંભની અંદર કોઈ પણ પ્રકારનો ગુઘડો થાય તો તે અંદર અંદર પતાવી દેવામાં આવે છે. પણ પતિપત્ની વચ્ચે ગુઘડો થાય તો તેમાં પંચની કે ડાહથા માણસની સલાહ લેવામાં આવે છે